



વર્ષ ૮ અંક ૪

ઓક્ટોબર - ડિસેમ્બર, ૨૦૦૩

અનુક્રમ

સંપાદકીય	૧
વિકાસલક્ષી મુદ્દાઓ	૨
ભારતમાં ઘટતું જતું સ્ત્રી-પુરુષ પ્રમાણા	૩
આપના માટે રાષ્ટ્રીય સૈચિક ક્ષેત્ર નીતિ - ૨૦૦૩	૪
વિશ્વ સામાજિક મંચ	૧૪
આપણી વાત અવરોધ-મુક્ત પર્યાવરણ: વિકાસનોના સામાજિક સમાવેશની વ્યવસ્થા	૧૭
સાંપ્રદાન પ્રવાહ	૨૧
સંદર્ભ સાહિત્ય	૨૫
અમારા વિશે	૩૦
સંપાદક ટીમ દીપા સોનપાલ હેમન્ટાકુમાર શાહ બિનોય આચાર્ય	

વાર્ષિક લવાજમ: રૂ.૨૫/- રૂફટ કે
મની ઓર્ડર 'ઉન્નતિ' વિકાસ શિક્ષણ
સંગઠનના નામે મોકલવા.

ફક્ત અંગાત વિતરણ માટે

સંપાદકીય

બીજું વિશ્વ શક્ય છે

'વિશ્વ સામાજિક મંચ' (વર્લ્ડ સોશયલ ફોરમ)ની શરૂઆત ૨૦૦૧માં 'વર્લ્ડ ઇકોનોમિક ફોરમ'ની સામે વૈકલ્પિક વિશ્વ શક્ય છે એ દર્શાવવાની ભાવના સાથે થઈ. નવ-ઉદારમતવાદ, નવ-સામ્રાજ્યવાદ અને વૈશ્વિક રણની જે પ્રક્રિયા છેલ્લા બેઝેક દાયકા દરમ્યાન દુનિયાભરમાં શરૂ થઈ છે અને મૂડીનું જે વર્ચસ્વ ઊભું થયું છે તેના વિરોધમાં 'વિશ્વ સામાજિક મંચ' એક નવી દુનિયાના નિર્માણ માટે વિચારનારા અને કામ કરનારાં લોકોને અને સંગઠનોને અનુભવો અને વિચારોની આપલે કરવા માટેનો મંચ પૂરો પાડે છે. મુંબઈમાં તાજેતરમાં જે 'વિશ્વ સામાજિક મંચ'નું ચોથું સંમેલન મળી ગયું કે જેમાં આ અવાજને બુલંદ બનાવાયો. તેમાં ગરીબો, વંચિતો, છેવાડે ફંકાઈ ગયેલા અને અવાજવિહીન લોકોના અવાજને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે પ્રયાસ કરનારાં બિન-સરકારી સંગઠનોને એક થવાની તક મળી છે. આવી તક રંગમંચ, ભીતચિત્રો, દેખાવો, નિર્દર્શનો, સરધસો અને વ્યાખ્યાનો દ્વારા તેમાં મળે છે. તે એમ દર્શાવે છે કે ભાષા, સંસ્કૃતિ, ધર્મ, નાત-જાત કે ચામડીના રંગના તથા ભૌગોલિક બેદભાવ છોરીને જગતના ગરીબો એક થવાની કોશિશ કરે છે. 'વિશ્વ સામાજિક મંચ' આમ સંગઠનાત્મક, આંતરરાષ્ટ્રીય અને ભૌગોલિક અવરોધો દૂર કરે છે અને લોકોની અભિભૂતતા વિશ્વની સમસ્યાઓ પ્રત્યે ઊભી કરવાનો પ્રયત્ન કરે છે.

'વિશ્વ સામાજિક મંચ'નું ચતુર્થ સંમેલન ભારતમાં મળ્યું તે પણ એક સૂચક બાબત છે કારણ કે વિશ્વના સૌથી વધુ ગરીબો ભારતમાં વસે છે. આથી છેક ગ્રામ સ્તરના કર્મશીલોને આશારે એક લાખ લોકોની હાજરીવાળા આ 'મંચ'માં ભાગીદાર થવાની તક સાંપડી. દેશ અને રાજ્ય સ્તરે આવા સામાજિક મંચ ઊભા કરવા માટેની કોશિશ થઈ રહી છે અને ગણે વર્ષે હૈદરાબાદમાં 'ઓશિયન સોશયલ ફોરમ' યોજાયું તે પણ એવા પ્રાદેશિક સ્તરના પ્રયાસોનો જ એક ભાગ હતું. આ જ પ્રકારના પ્રયાસો છેક નીચલા સ્તર સુધી થાય તે જરૂરી છે. સામાજિક ન્યાય માટેના સ્થાનિક, રાષ્ટ્રીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સ્તરનાં આંદોલનોને 'વિશ્વ સામાજિક મંચ' એકતાની ભાવના અને સમર્થનનો સથવારો પૂરો પાડીને હામ આપે છે. તેથી આંદોલનોના કર્મશીલોને એમ લાગે છે કે તેઓ એકલા-અટૂલા નથી અને આખા જગતમાં ચાલતાં એ જ પ્રકારનાં આંદોલનોથી તેમને એમ પણ લાગે છે કે સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય માટેની લડાઈ લડતો નાગરિક સમાજ એક છે અને સંગઠિત પણ છે. બહુરાષ્ટ્રીય કંપનીઓ, આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાઓ અને ધનવાન દેશો સામેની લડાઈ લડવાનું કામ ઘણું અધિરે છે પણ એ લડાઈ લડવાનું અશક્ય તો નથી જ અને જીતવાનું શક્ય છે એવો સૂર 'વિશ્વ સામાજિક મંચ'માંથી સંભાયાય છે. નાંધાપાત્ર બાબત એ છે કે મુંબઈ ખાતેના 'વિશ્વ સામાજિક મંચ'ના સંમેલનમાં અર્થશાસ્ત્રમાં નોબેલ ઈનામ વિજેતા જોસેફ સ્ટેલિલ્ટેજ અને ઈરાનના મહિલા કર્મશીલ શિરિન ઈબાદી પણ ઉપસ્થિત રહ્યાં. 'વિશ્વ સામાજિક મંચ' વૈશ્વિક સ્તરે વધુ ને વધુ સ્વીકૃતિ પામતો જાય છે તેની એ સાબિતી છે.

'વિશ્વ વ્યાપાર સંગઠન' (ડાલ્ટન્યુટીઓ - વર્લ્ડ ટ્રેડ ઓર્ગનાઇઝેશન)ની સ્થાપના ૧૯૮૮ પમાં થયા બાદ સ્પર્ધા અને વ્યાપારના નામે નવ-ઉદારમતવાદ અને નવ-સામ્રાજ્યવાદનાં બળો વધારે મજબૂત બન્યાં છે અને ગરીબો, બેકારી, અસમાનતા, સંધર્થો, હિંસા અને યુદ્ધોની સમસ્યાઓ તીવ્ર બની છે ત્યારે 'વિશ્વ સામાજિક મંચ' એક આશાવાદી સૂર જગવે છે અને તે છે 'બીજું વિશ્વ શક્ય છે'. સામાજિક આંદોલનોને આ રીતે મજજુબત બનાવવા માટેની પ્રેરણા 'વિશ્વ સામાજિક મંચ' દ્વારા પ્રાપ્ત થાય છે. આંદોલનો વચ્ચે સંવાદ અને સખ્ય ઊભાં થાય અને ન્યાય માટેની લડતનો મિજાજ જળવાઈ રહે એ જ અભ્યર્થના.

ભારતમાં ઘટતું જતું સ્ત્રી-પુરુષ પ્રમાણ

ઈ.સ. ૨૦૦૧ની વસ્તી ગાણતરીમાં એક ચોકાવનારી હકીકત એ બહાર આવી છે કે ભારતમાં વસ્તીમાં પુરુષોની તુલનાએ સ્ત્રીઓનું પ્રમાણ ઘટતું જાય છે. પ્રસ્તુત લેખમાં મુંબઈ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના ‘સેન્ટર ફોર વીમેન્સ સ્ટડીઝ’નાં ડૉ. વિભૂતિ પટેલ આ સમસ્યાનાં વિવિધ પાસાં વિશે વિગતે રજૂઆત કરે છે. તેમણે અમદાવાદમાં તા. ૧૭-૧૨-૨૦૦૩ના રોજ યોજાયેલી એક રાષ્ટ્રીય કાર્યશાળામાં જે અભ્યાસ લેખ રજૂ કર્યો હતો તેનો સારાંશ અહીં રજૂ કરાયો છે.

પ્રસ્તાવના

‘ફોરમ અગોર્ન્સ્ટ સેક્સ ડિટર્મિનેશન એન્ડ સેક્સ-પ્રિસિલેક્શન’ દ્વારા ઉભા થયેલા દબાણને પરિણામે ૧૯૮૪માં ‘પ્રિનેટલ ડાયુનોસ્ટિક ટેકનિક્સ એક્ટ’ પસાર કરવામાં આવ્યો. પણ તેનો અમલ થયો નહિ. મહિલાઓના અધિકારોના ક્ષેત્રે કામ કરનારાં સંગઠનોની લગભગ એકાદ દાયકા લાંબી રુંબેશ અને ‘સિહેટ’ તથા ‘માસૂમ’ દ્વારા કરાયેલી જાહેર હિત અરજીઓ પછી આ કાયદામાં ૨૦૦૨માં સુધારો કરાયો. રાષ્ટ્રપતિએ તેને તા. ૧૭-૧-૨૦૦૩ના રોજ મંજૂરી આપી.

આ ધારામાં સ્ત્રી સગર્ભી બને તે પહેલાં કે તે પછી જાતિ પસંદગી ઉપર પ્રતિબધ મૂકવામાં આવ્યો છે અને જનીન ખામીઓ અથવા ચયાપચયની ખામીઓ કે જાતિ સંબંધી ખામીઓ પકડવાના હેતુ માટેની નિદાન પદ્ધતિઓ ઉપર નિયમન મૂકવામાં આવ્યું છે અને સ્ત્રી ભૂણ હત્યા તરફ દોરી જતા જાતિ નિર્ધારણ માટે તેનો દુરૂપયોગ રોકવા માટે અને તેની સાથે સંબંધિત બાબતો માટે નિયમનની વ્યવસ્થા તેમાં કરવામાં આવી છે. આ કાયદા અન્વયો ૨૦૦૩માં જે નિયમો ઘડવામાં આવ્યા છે તે સમાજમાંથી છોકરીઓ અદૃશ્ય (મીસિંગ ગર્લ્સ) થવા તરફ દોરી જતી પ્રણાલીઓ ડામવા માટેના અમલાના તંત્રને સક્રિય બનાવવા માટે છે. આપણી સમક્ષ એક મોટા કાર્યનો પડકાર છે: ડોક્ટરો અને દર્દીઓનું માનસ બદલવાનું છે, એવું સામાજિક-સાંસ્કૃતિક વાતાવરણ ઊભું કરવાનું છે કે જે બાળકીના અસ્તિત્વ માટે સાન્દુક્ષણ હોય અને જાતિલક્ષી પૂર્વગ્રહો ધરાવતા વ્યાપારી તબીબોની પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવાની છે. તો જ આપણે ઘટતા જતા જાતિ

પ્રમાણનો પ્રક્રિયાને રોકવામાં સફળ થઈશું. ભારતનાં શહેરોમાં પ્રજનનલક્ષી નવી તકનિકીનો ઉપયોગ વ્યાપકપણે થચાથી ભારતના વસ્તી ગાણતરીના ઈતિહાસમાં સતત ઘટતા જતા સ્ત્રી-પુરુષ પ્રમાણનું વલાણ ઊભું થયું છે. ઈચ્છનીય પસંદગી અને જે નથી જોઈતું તેના ઈન્કારના સિદ્ધાંત પર આ નવી પ્રજનનલક્ષી તકનિકી ઊભેલી છે. ભારતમાં પુત્ર ઈચ્છનીય છે અને પુત્રી અનિચ્છનીય છે. તેથી પરિણામ સ્પષ્ટ છે. ૨૦૦૧ની વસ્તી ગાણતરી દર ૧૦૦૦ પુરુષે ૮૩૩ સ્ત્રીઓનું પ્રમાણ દર્શાવે છે. નવી સહસ્રાબ્દીના આરંભે ૩.૫ કરોડ સ્ત્રીઓની ખોટ ભારતમાં વર્તતી હતી. વસ્તીના સંદર્ભમાં આ વિગતો કોઈ નં. ૧માં આપવામાં આવી છે.

બાળકોમાં આ જાતિ પ્રમાણ (સેક્સ રેશિયો) ઘટતું જાય છે તે ભારતમાં પુરીને જે ઓદૃષું સામાજિક મહત્વ આપવામાં આવે છે તેનું પરિણામ છે. ભારતની વસ્તી ગાણતરીઓ અનુસાર ભારતમાં બાળકોમાં જાતિ પ્રમાણ ૧૯૮૧, ૧૯૯૧ અને ૨૦૦૧માં અનુક્રમે ૮૭૧, ૮૪૫ અને ૮૨૭ હતું. ૨૦૦૧માં ભારતમાં ૧૫.૮૦ કરોડ નવજાત શિશુઓ અને બાળકો હતાં. તેમાં ૮.૨ કરોડ છોકરા હતા અને ૭.૬ કરોડ છોકરીઓ હતી. આમ, ૫૦ લાખ છોકરીઓની ખોટ હતી. દેશભરમાં કેરળ સહિત બધે જ જાતિ નિર્ધારણ અને જાતિ પસંદગી માટે જે પરીક્ષણો કરાવવામાં આવે છે તેને પરિણામે જ આ પરિસ્થિતિ ઊભી થઈ છે.

સ્ત્રી ભૂણ હત્યાનું ઊંચું પ્રમાણ બિહાર, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, રાજ્યસ્થાન, ઉત્તર પ્રદેશ (બીમારુ રાજ્યો) અને ગ્રામીણ તામિલનાડુ તથા ગુજરાતમાં તે વિશેષ પ્રમાણમાં છે. સ્વાતંત્ર્ય પછીના કાળમાં કરોડો છોકરીઓ લાપતા થઈ ગઈ છે. યુઅનએફ્પીએ એમ જણાવે છે કે છુલ્લા એક દાયકામાં બાળકોમાં જાતિ પ્રમાણમાં ૧૯ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૭૦ જિલ્લામાં લગભગ અડધા ટકાનો ઘટાડો થયો છે. જાતિ નિર્ધારણ અને જાતિ પસંદગીના પરીક્ષણ દ્વારા સ્ત્રી ભૂણ હત્યા માટે નવી વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ થતો રોકવા માટે ૧૯૮૪માં કાયદો પસાર કરાયો છે. પરંતુ મહાનગરો અને નગરોમાં ડોક્ટરો અને પુત્રોષણ ધરાવતાં મા-બાપોએ આ કાયદાનો ભંગ કર્યો છે. જાતિ નિર્ધારણ અને જાતિ પસંદગીની વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ અમુક જનીન

પરિસ્�િતિમાં જ કરવાનો હોય છે. પરંતુ ભારતમાં અને ભારતની બહાર સ્થાયી થયેલા ભારતીયોમાં તેમનો ઉપયોગ સ્ત્રી ભૂણ હત્યા માટે કરવામાં આવે છે. તમામ વર્ગો, ધર્મો અને જ્ઞાતિઓના લોકો આ સગવડનો ઉપયોગ કરે છે. માધ્યમો, વિજ્ઞાનીઓ, ડોક્ટરો, સરકારી અધિકારીઓ, મહિલાઓનાં જૂથો અને વિદ્ધાનોએ આ પદ્ધતિઓના ઉપયોગની તરફે શરીરમાં કે વિરોધમાં જુંબેશો ચલાવી છે. પુરુષોનું આધિપત્ય, વસ્તી નિયત્રણ અને નાણાં કમાવાનો મોહ વગેરે આવાં પરીક્ષણોને ટેકો આપનારા માટે અગત્યની બાબતો છે જ્યારે જેઓ આ પરીક્ષણોનો વિરોધ કરે છે તેમને માટે સ્ત્રીઓનું અસ્તિત્વ ચિંતાનો વિષય છે. ‘ફોરમ અગેઈન્સ્ટ સેક્સ ડિટર્મિનેશન એન્ડ સેક્સ પ્રિ-સિલેક્શન’ દ્વારા ૧૯૮૦ના દાયકા દરમ્યાન આ પદ્ધતિઓના દુરૂપયોગ સામે લડત આપવા સર્વગ્રાહી પ્રયાસો કરાયા હતા.

સ્ત્રી ભૂણ હત્યાની મદદે વિજ્ઞાન

તબીબી વિજ્ઞાનમાં પ્રગતિ થવાથી જતિ નિર્ધારણ અને જતિ પસંદગીની પદ્ધતિઓ વિકસી. તેમાં સોનોગ્રાફી, ફિટોસ્કોપી, નીડલિંગ, કોરિયન વિલિ બાયોપ્સી (સીવીની) અને એમ્બિયોસેન્ટેસિસ તથા અલ્ટ્રાસાઉન્ડ પદ્ધતિઓનો સમાવેશ થાય છે. જો કે, ભારતમાં એમ્બિયોસેન્ટેસિસ અને અલ્ટ્રાસાઉન્ડ પદ્ધતિઓ વધારે લોકપ્રિય બની છે. ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, પંજાબ, પાટ્રિયમ બંગાળ, તામિલનાડુ અને રાજ્યસ્થાનમાં તો નાનાં નાનાં નગરોમાં પણ આ પદ્ધતિઓનો ઉપયોગ દવાખાનાંઓમાં કરવામાં આવે છે. કેટલાક ડોક્ટરો આ માટે એવી દલીલ પણ કરે છે કે ભારત જેવા વિકસતા દેશોમાં કુટુંબમાં બે સંતાનો માટે જ્યારે મા-બાપોને પ્રોત્સાહન આપવામાં આવે છે ત્યારે તેમને આ બેની ગુણવત્તા નક્કી કરવાનો અધિકાર છે. એમ્બિયોસેન્ટેસિસ આ દિશામાં તેમને મદદ પૂરી પાડે છે એમ તેમનું કહેવું છે. જો કે, અહીં, જે ‘ગુણવત્તા’ શબ્દ તેઓ વાપરે છે તેમાંથી ઉત્ભા થતા સંખ્યાબંધ પ્રશ્નો વિશે આપણો વિચારવું પડે.

હાલ અલ્ટ્રાસાઉન્ડ મશિનોનો ઉપયોગ જતિ નિર્ધારણ અને જતિ પસંદગી માટે વ્યાપક પ્રમાણમાં થાય છે. બહુરાષ્ટ્રીય કંપનીઓ ડોક્ટરોને એ માટે પ્રોત્સાહન આપે છે, અને ખાસ્સો નાણાકીય લાભ પણ તેમાં તેમને પ્રાપ્ત થાય છે. પરંતુ છેલ્લા અઢી દાયકાથી એમ્બિયોસેન્ટેસિસની વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ પણ વધ્યો છે. તેનો ઉપયોગ ખામક ખામીવાળું છે કે નહિ તે જાણવા માટે કરવાનો હતો અને ખાસ કરીને ૪૦થી વધુ વધુ વધુની સગર્ભા સ્ત્રીઓ પર કરવાનો હોય. પણ તેનો ઉપયોગ જતિ નિર્ધારણ અને જતિ પસંદગી માટે થાય છે. પણ આ પદ્ધતિ બીજી કેટલીક

કોઠા નં.૧

ભારતની વસ્તીનું ચિત્ર: ૨૦૦૧

૧. ભારતની કુલ વસ્તી	૧૦૨.૭ કરોડ
૨. પુરુષો	૫૩.૧ કરોડ
૩. સ્ત્રીઓ	૪૮.૭ કરોડ
૪. સ્ત્રીઓની ખામી	૩.૫ કરોડ
૫. દર ૧૦૦૦ પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ	૮૩૩

સ્લોટ: ભારતની વસ્તી ગણતરી - ૨૦૦૧

પદ્ધતિઓ કરતાં સ્ત્રીઓના આરોગ્ય માટે વધારે જોખમી છે. નવજાત શિશુઓ ઉપર પણ તેમની વિપરીત અસર થઈ શકે છે. આરંભમાં સરકારી હોસ્પિટલોમાં આ પદ્ધતિનો ઉપયોગ પ્રાયોગિક ધોરણો થતો હતો. પણ પછી એ ખૂબ લોકપ્રિય થઈ ગઈ. હવે એનો ઉપયોગ જાતિ પસંદગી માટે જ થાય છે અને પછી સ્ત્રી ભૂણના ગર્ભપાત માટે તે વપરાય છે. ખાનગી દવાખાનાં અને સરકારી હોસ્પિટલોમાં બધે જ એ ઉપયોગમાં લેવાય છે. પેસાની લાલચ ધરાવતા ડોક્ટરો આ આધુનિક તકનિકીના દુરૂપયોગને પ્રોત્સાહન આપે છે અને તેમણે ભારતીય સ્ત્રીઓને પુરુષ બાળકો ઉત્પત્ત કરતું મશિન બનાવી દીધી છે.

‘વીમેન્સ સેન્ટર’ દ્વારા મુંબઈમાં એક ટુકડીએ છ હોસ્પિટલો અને દવાખાનાંના સર્વેક્ષણને આધારે ૧૯૮૮માં એમ તારણ કાઢવું હતું કે રોજની ૧૦ સ્ત્રીઓ આ પરીક્ષણ કરાવે છે. મહારાષ્ટ્ર સરકારે ૧૯૮૮માં આ પરીક્ષણો પર પ્રતિબંધ મૂક્યો ત્યાં સુધી મુંબઈની વિખ્યાત હરકિસનદાસ હોસ્પિટલમાં કેવો દંભ આચરવામાં આવતો હતો તે પણ આ સર્વેક્ષણમાંથી બહાર આવ્યું હતું. આ હોસ્પિટલનું સંચાલન જૈનોના હાથમાં છે તેથી તેઓ ગર્ભપાતને ટેકો આપતા નહોતા, તો હોસ્પિટલ સ્ત્રીઓને અન્ય દવાખાનાઓમાં ગર્ભપાત માટે મોકલતી હતી અને ત્યાંથી પડેલા સ્ત્રી ગર્ભને વધુ ‘સંશોધન’ અર્થે પાછો હોસ્પિટલમાં મંગાવવામાં આવતો હતો.

૧૯૮૦ના દાયકાની સ્થિતિ

૧૯૮૦ના દાયકા દરમ્યાન જતિ નિર્ધારણનું પરીક્ષણ અન્ય દેશોમાં ભારે ખર્ચથી હતું અને સરકારના અંકુશો તેના પર ખૂબ જ હતા. પણ ભારતમાં તે રૂ. ૭૦થી રૂ. ૫૦૦ સુધીમાં થઈ શકતું હતું. તેથી માત્ર મધ્યમ વર્ગને જ નહિ પણ કામદાર વર્ગને પણ તે પોસાંતું હતું. મુંબઈના જુંપડપટ્ટી વિસ્તારોનાં સર્વેક્ષણો એમ દર્શાવે છે કે ઘણી સ્ત્રીઓ એ પરીક્ષણ કરાવતી હતી અને ગર્ભ સ્ત્રી જતિનો છ તેની ખર્ચર પડ્યા પછી તે ૧૮મા કે ૧૮મા

કોઠા નં.૨

ભારતમાં વિવિધ રાજ્યોમાં જાતિ પ્રમાણ

રાજ્ય	૬૨ ૧૦૦૦ પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ	૦થી ૫ વર્ષની વયમાં જાતિ	પ્રમાણ
૧. આંધ્રામાન અને નિકોબાર	૮૪૯	૮૯૫	
૨. આંધ્ર પ્રદેશ	૮૭૮	૮૯૪	
૩. અરુણાચલ પ્રદેશ	૮૦૧	૮૯૧	
૪. આસામ	૮૩૨	૮૯૪	
૫. બિહાર	૮૨૧	૮૩૮	
૬. ચંડીગઢ	૭૭૩	૮૪૫	
૭. છતીસંગઢ	૮૬૦	૮૭૫	
૮. દાદરા અને નગર હવેલી	૮૧૧	૮૭૩	
૯. દિલ્હી	૮૨૧	૮૯૫	
૧૦. દમણ અને દીવ	૭૦૮	૮૨૫	
૧૧. ગોવા	૮૯૦	૮૩૩	
૧૨. ગુજરાત	૮૨૧	૮૭૮	
૧૩. હરિયાણા	૮૫૧	૮૨૦	
૧૪. હિમાચલ પ્રદેશ	૮૭૦	૮૬૭	
૧૫. જમ્બુ અને કાશ્મીર	૬૦૦	૮૨૭	
૧૬. ઝાર્ખંડ	૮૪૧	૮૯૯	
૧૭. કડાર્ટક	૮૫૪	૮૪૮	
૧૮. કેરળ	૧૦૪૮	૮૯૩	
૧૯. લક્ષ્ણીપ્ર	૮૪૭	૮૭૪	
૨૦. મધ્ય પ્રદેશ	૮૨૦	૮૨૮	
૨૧. મહારાષ્ટ્ર	૮૨૨	૮૧૭	
૨૨. મહિયાપુર	૮૭૮	૮૯૧	
૨૩. મેઘાલય	૮૭૫	૮૭૫	
૨૪. મિઝેરમ	૮૩૮	૮૭૧	
૨૫. નાગાલેન્ડ	૮૦૮	૮૭૫	
૨૬. ઓરિસસા	૮૭૨	૮૫૦	
૨૭. પોંડિયેરી	૧૦૦૧	૮૫૮	
૨૮. પંજાબ	૮૫૭	૭૮૩	
૨૯. રાજસ્થાન	૮૨૨	૮૦૮	
૩૦. સિક્કિમ	૮૭૫	૮૮૭	
૩૧. તામિલનાડુ	૮૮૭	૮૩૮	
૩૨. ત્રિપુરા	૮૫૦	૮૭૫	
૩૩. ઉત્તર પ્રદેશ	૮૮૮	૮૧૯	
૩૪. ઉત્તરાંધ્રાલ	૮૯૪	૮૦૯	
૩૫. પાઞ્ચિયમ બંગાળ	૮૩૪	૮૯૩	
ભારત	૮૩૩	૮૨૭	

સ્તોત: ભારતની વસ્તી ગણતરી - ૨૦૦૧

સપ્તાહે ગર્ભપાત કરાવતી હતી. તેમની દલીલ એવી હતી કે સ્ત્રી બાળકને જન્મ આપવો અને છોકરી મોટી થાય એટલે લગ્ન પાછળ હજારો રૂપિયા ખર્ચવા તેના કરતાં તો ગર્ભપાત માટે રૂ. ૨૦૦ કે રૂ. ૮૦૦ ખર્ચવા એ સસ્તું પડે છે.

લાર્સન એન્ડ ટુબ્રો જેવી બહુરાષ્ટ્રીય ઈજનેરી કંપનીના યુવાન કર્મચારીઓને પણ હુલ્લે પણ આ પરીક્ષણ આકર્ષણું હતું. તેઓ કંપનીમાં તેમના તથીબી ખર્ચનાં જે બિલ રજૂ કરતા હતા તેમાં તેઓ આ પરીક્ષણનો ઉપયોગ કરતા જણાયા હતા. ઉત્તર પ્રદેશના બિજનોર જિલ્લાનાં બે ગામોનું એક સર્વેક્ષણ કરાયું હતું. તેમાં ૩૦૧ સ્ત્રીઓની મુલાકાત લેવાઈ હતી. તેમાંથી પણ એમ જાણવા મળ્યું કે એમનોસેન્ટેસિસની સેવાનો ઉપયોગ સ્ત્રીઓને એ માહિતી આપવા માટે થાય છે કે ગર્ભમાંનું બાળક છોકરો છે કે છોકરી. ઉત્તર પ્રદેશમાં છેલ્લાં ૧૦ વર્ષમાં આ પદ્ધતિ દાખલ થઈ હતી. ૧૯૮૧ની વસ્તી ગણતરી મુજબ ઉત્તર પ્રદેશમાં અને બિજનોર જિલ્લામાં ૧૦૦૦ છોકરાએ છોકરીઓનું પ્રમાણ અનુક્રમે ૮૪૭ અને ૮૭૩ હતું. ઈ.સ. ૧૯૦૦ સુધી જાટ અને રાજ્યૂના સમુદ્યાયમાં જ છોકરીઓની હત્યાનો રિવાજ હતો. પણ હવે તો તે તમામ સમુદ્યાયમાં પ્રયત્નિત થઈ ગયો હતો.

૧૯૭૪માં દિલ્હીમાં ‘ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ’ દ્વારા ૧૧૦૦૦ સાગર્ભી સ્ત્રીઓ માટે એક સર્વેક્ષણ હાથ ધરાયું હતું. જો કે, તેનો હેતુ ગર્ભની સ્થિતિ જાણવાનો હતો, પરંતુ એ સ્ત્રીઓનો હેતુ તો ગર્ભની જાતિ જાણવાનો જ હતો. એક વાર પરીક્ષણ પતી ગયું અને જે સ્ત્રીઓને એમ કહેવામાં આવ્યું કે તેમના ગર્ભમાંનું બાળક સ્ત્રી જાતિનું છે તેમણે ગર્ભપાતની માગણી કરી હતી. અને તેથી ૧૯૭૮માં તમામ સરકારી હોસ્પિટલોમાં જાતિ પસંદગી માટેનાં પરીક્ષણો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. પંજાબમાં ૧૯૮૨માં સ્ત્રીઓ અને પુરુષોનું એક સર્વેક્ષણ કરાયું હતું અને તેમાં આ પરીક્ષણો વિશે તેમના અતિમાયો માંગવામાં આવ્યા હતા. તેમાં બધાએ આ પરીક્ષણોને ઉપયોગી ગણાવ્યાં હતાં. વાસ્તવમાં, પંજાબમાં જ ૧૯૭૮માં પહેલી જ વાર આ પરીક્ષણનો વ્યાપારી ધોરણે ઉપયોગ શરૂ થયો હતો. અમૃતસરના એક દવાખાનાએ તો આને અંગે જહેરખબર પણ આપી હતી.

૧૯૮૫માં મહારાષ્ટ્ર સરકારે એક સર્વેક્ષણ હાથ ધર્યું હતું. તેમાં ૮૪ ટકા ડોક્ટરો એમન્યોસેન્ટેસિસનું પરીક્ષણ કરતા હતા એમ જાણવા મળ્યું હતું. દર મહિને તેઓ સરેરાશ ૨૭૭ પરીક્ષણો કરતા હતા. તેમાંના કેટલાક ડોક્ટરો તો છેલ્લાં દસેક વર્ષથી એ

પરીક્ષણ હાથ ધરતા હોવાનું માલ્યુમ પડ્યું હતું. ૨૮ ટકા ડોક્ટરોએ તો એમ કહ્યું હતું કે જે ૧૦ ટકા સ્ત્રીઓ પરીક્ષણ કરાવતી હતી તેમને એક કે તેથી વધુ તો દીકરાઓ હતા. કેટલાક ડોક્ટરો તો એમ પણ માનતા હતા કે વસ્તી નિયંત્રણ માટે આ પરીક્ષણ એક અગત્યનું સાધન છે. આઠમી પંચવર્ષીય યોજનામાં ભારત સરકારે એક માતાનું સ્થાન એક જ પુની લે એવો ચોખ્ખો પ્રજનન દર એકનો રાખવાનું લક્ષ્યાંક નક્કી કર્યું હતું. આ હેતુ માટે પછી જાતિ નિર્ધારણ અને જાતિ પસંદગી માટેનાં સાધનો સુલાભ સમજવામાં આવ્યાં હતાં. આ વલાણોને પરિણામે જ ભારતમાં સ્ત્રી-પુરુષ પ્રમાણ ચિંતાજનક હેઠળ ગયું છે. સમગ્ર સ્ત્રી-પુરુષ પ્રમાણ અને બાળકોમાં સ્ત્રી-પુરુષ પ્રમાણ જુદાં જુદાં રાજ્યોમાં કેટલું છે તેની વિગતો કોઠા નં.૨માં આપવામાં આવી છે. કોઠા નં.૩ અને કોઠા નં.૪માં આ અંગેની વધુ વિગતો અપાઈ છે.

વિવાદના મુદ્દાઓ

આ સંજોગોમાં મહિલાઓ પ્રત્યે દુર્વ્યવહાર થાય તેના કરતાં તે મરી જાય એ ઈચ્છાનીય છે એમ પણ કહેવાતું રહ્યું છે. ‘જનમવું અને પછી મરવા દેવું એના કરતાં ગર્ભ તરીકે જ મરી જવું સારું નહિ?’ કે પછી ‘શું લાખો વણજોઈતી છોકરીઓનો જન્મ મહિલાઓની સ્થિતિ સુધારે છે?’ જેવા સવાલો પણ પુછ્યાતા રહ્યા છે. ૧૯૭૧થી ૧૯૭૧ સુધી સ્ત્રી-પુરુષનું પ્રમાણ ભારતમાં સતત ઘટતું રહ્યું છે. ૧૯૭૧થી ૧૯૮૧ દરમ્યાન તેમાં સહેજ વધારો થયો હતો. પણ તે પછી વળી પાછું ઘટતું ગયું. ધનવાનો, ગરીબો, શિક્ષિતો કે અભિનો સૌ કોઈ જાતિ નિર્ધારણ અને જાતિ પસંદગી માટેનાં પરીક્ષણોનો ઉપયોગ કરે છે એથી પરિસ્થિતિ વધુ વણાસ્તી જાય છે.

ઘણા અર્થશાસ્ત્રીઓ અને ડોક્ટરો માંગ અને પુરવઠાના નિયમને ટાંકીને આ પરીક્ષણોને વાજભી ઠેરવે છે. તેઓ દલીલ કરે છે કે જો મહિલાઓનો પુરવઠો ઘટી જશે તો તેમની માંગ વધશે અને તેથી તેમની પરિસ્થિતિ સુધરશે. મહિલાઓની અછત તેમનું મૂલ્ય વધારશે એમ કહેવામાં આવે છે. આનો અર્થ એવો થાય કે મહિલાઓને એક પ્રકારે વસ્તુ ગણવામાં આવે છે. પરંતુ સ્ત્રીઓ કંઈ સામાજિક-આર્થિક સ્થિતિમાં જીવે છે તે અર્થશાસ્ત્રીઓ ભૂલી જાય છે. જે સમાજ સ્ત્રીઓને માત્ર જાતીયતા માટેની અને બાળકો પેદા કરનારી વસ્તુ સમજે છે તે સમાજ સ્ત્રીઓ સાથે વધુ માનવીય રીતે વર્તે એમ કેવી રીતે કહી શકાય? તેમનો પુરવઠો ઓછો હશે તેથી તેમની સાથેનો વ્યવહાર સુધરી જશે એવું કેવી રીતે માની શકાય? વાસ્તવમાં બળાત્કાર, અપહરણ અને

કોઠા નં.૩

ભારતમાં ૦-૫ વર્ષનાં બાળકોની વસ્તી

૧. નવજાત શિશુઓ અને બાળકોની વસ્તી	૧૫.૮ કરોડ
૨. પુરુષ શિશુઓ અને બાળકો	૮.૨ કરોડ
૩. સ્ત્રી શિશુઓ અને બાળકો	૭.૭ કરોડ
૪. સ્ત્રી શિશુઓ અને છોકરીઓની ખાધ	૬૦ લાખ
૫. બાળકોની વસ્તીમાં જાતિ પ્રમાણ	૮૨૭

સોત: ભારતની વસ્તી ગણતારી - ૨૦૦૧

બળજબરીના કિસ્સા તો વધી રહ્યા છે. મધ્ય પ્રદેશ, રાજ્યાંન, હરિયાણા અને પંજાબમાં કેટલાક સમુદ્દર્યોમાં સ્ત્રી-પુરુષ પ્રમાણ ઘણું જ નીચું છે. તેમાં ઘણી વાર ઘણા પુરુષો વચ્ચે એક જ પત્ની હોય છે.

બીજી એક દલીલ એવી પણ કરવામાં આવે છે કે જે માતાઓ એક કે તેથી વધુ છોકરીઓ ધરાવતી હોય તેમને એન્ઝિયોસેન્ટેસિસ પરીક્ષણ કરવા દેવું જોઈએ કે જેથી તેઓ સંતુલિત પરિવાર ધરાવી શકે. તેમના ઘરમાં છોકરી પણ હોય અને છોકરો પણ હોય. જો કે આ ખ્યાલ પણ પક્ષપાતી છે. એક કરતાં વધારે પુત્રો હોય તો પછી શું ગર્ભમાંના પુરુષ બાળક માટે ગર્ભપાત કરાવવાની ભલામણ થશે ખરી? તે વખતે સંતુલિત પરિવારનો ખ્યાલ આવશે ખરો? ના, કદી નહિ આવે. વાસ્તવમાં, સ્ત્રી કે પુરુષ કોઈ પણ બાળકના કોઈ પણ ગર્ભપાત માટે થતા પરીક્ષણનો વિરોધ કરવો જોઈએ. વળી, સંતુલિત પરિવાર માટે સ્ત્રીએ કેટલી કિંમત ચૂકવવાની? તેણે ક્યાં સુધી ગર્ભપાત કરાવ્યે જવાના?

વળી, વારંવાર એવું પણ કહેવામાં આવે છે કે સ્ત્રીઓ પોતે જ પોતાની ઈચ્છાથી આ પ્રકારનાં પરીક્ષણો કરાવે છે. આ તો તેમની પોતાની પસંદગીનો વિષય છે એમ પણ કહેવાય છે. પણ શું પસંદગીઓથી સામાજિક શૂન્યાવકાશ ઉત્ભો થાય છે? એ સ્ત્રીઓના દિમાગમાં સામાજિક રીતે એ ઘુસાડવામાં આવ્યું હોય છે કે જો તેઓ દીકરા ઉત્પત્ત નહિ કરે તો તેમની કોઈ સામાજિક કિંમત નથી. તેમને ટોણા મરાય છે, તેમની સત્તામણી થાય છે, પતિ દારા તેમને છોડી દેવામાં આવે છે. આમ, વાસ્તવમાં તેમની પસંદગી તો સમાજની બીક ઉપર આધારિત છે. પોતે કેટલાં બાળકો ઉત્પત્ત કરવા તેના ઉપર સ્ત્રીઓનો પોતાનો અંકુશ હોવો જોઈએ એમ નારીવાદીઓ કહે છે. બાળકો ધરાવવાં કે ન ધરાવવાં તેની અને સલામત કાનૂની ગર્ભપાત અંગેની પસંદગી

કોઠા નં.૪

જાતિ પરીક્ષણ વ્યાપક છે તેવાં રાજ્યોમાં જાતિ પ્રમાણ

રાજ્ય	૧૯૯૧	૨૦૦૧
૧. પંજાબ	૮૭૫	૭૮૩
૨. હરિયાણા	૮૭૯	૮૨૦
૩. ગુજરાત	૮૨૮	૮૭૮
૪. મહારાષ્ટ્ર	૮૪૯	૮૧૭

સ્થોત: ભારતની વસ્તી ગણતરી - ૨૦૦૧

સ્ત્રીઓ પોતે કરે એમ નારીવાદીઓ માંગે છે. પરંતુ ત્રીજા વિશ્વના સંદર્ભમાં આ પ્રશ્નને જરા જુદી રીતે જ જોવો પડે તેમ છે. જો કે, એવી દલીલ પણ કરવામાં આવે છે કે આશરે છ બાળકોમાંથી એક જ બાળક બચવાની શક્યતા હોય છે એ વસ્તી વધારાની મૂળ સમસ્યા છે, માત્ર પુરુષ ધરાવવાની ઈચ્છા જ નથી.

સ્ત્રી ભૂણ હત્યા: રાજકારણ, અર્થશાસ્ત્ર અને સામાજિક ભૂમિકા

કેટલાક લોકો એવો સવાલ પણ ઉઠાવે છે કે જો કુટુંબ નિયોજન ઈચ્છાનીય હોય તો પછી સ્ત્રી-પુરુષ જાતિનું આયોજન કેમ નહિ? પરંતુ પ્રશ્ન આટલો સરળ નથી. દવાઓ અને આરોગ્ય સંભાળની વ્યવસ્થાના વ્યાપારીકરણના સંદર્ભમાં આ પ્રશ્નને સમજવાની જરૂર છે. વસ્તી નિયંત્રણની નીતિમાં જાતિવાદી પક્ષપાત હોય અને પિતૃસત્તાક વ્યવસ્થાનું સ્વરૂપ પ્રવર્તમાન હોય ત્યાં આ પ્રશ્નને વધારે ઊડાણથી વિચારવો પડે તેમ છે. જાતિની પસંદગી સ્ત્રીઓના દમનનો બીજો એક રસ્તો હોઈ શકે છે. નારીવાદીઓ એમ તો કહે જ છે કે સ્ત્રીઓનું અસ્તિત્વ જોખમમાં છે. જાતિ નિર્ધારણનાં પરીક્ષણો કરતાં જાતિ પસંદગીનાં પરીક્ષણો વધારે લોકપ્રિય બન્યાં છે એનું એક કારણ એ પણ છે કે ગર્ભપાત સંબંધી જ નેતિકતાના પ્રશ્નો ઉઠાવાય છે તે તેમાં ઉઠાવવામાં આવતા નથી. ગર્ભપાત-વિરોધીઓ પણ એ પદ્ધતિનો ઉપયોગ કરવામાં વાંધો જોતા નથી. વળી, પુરુષ બાળક માટેની પસંદગી માત્ર ભારત જેવા વિકસતા દેશોમાં જ છે એવું નથી પણ એ ફુનિયામાં બધે જ છે. મૂડીવાદ પહેલાંના, મૂડીવાદી અને મૂડીવાદ પછીનાં એમ તમામ સામાજિક માળખાંમાં આ બાબતનાં મૂળિયાં ઉંડાં છે અને તેમને સતત પડકારવાની જરૂર છે.

આ સંદર્ભમાં ભારતમાં મહિલાઓની ખાધ દૂર કેવી રીતે કરી

શકાય? દેશભરમાં ૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકામાં બિન-સરકારી સંગઠનોએ જોરદાર ઝુંબેશ કરી હતી અને જાતિ નિર્ધારણ તથા જાતિ પસંદગીનાં પરીક્ષણોનો વિરોધ કર્યો હતો. તેમાં કેટલીક સંશોધન સંસ્થાઓ પણ જોડાઈ હતી. તેમણે આ પરીક્ષણોની તરફેણ કરનારા અત્યંત શિક્ષિત એવા પ્રભુદ્વ વિજ્ઞાનીઓ, ટેકનોલોજીસ, તબીબો અને રાજ્ય સામે વાંધા ઉઠાવ્યા હતા. તેને પરિણામે છંબટે મહારાષ્ટ્ર સરકારને અને કેન્દ્ર સરકારને કાયદા કરવાની ફરજ પડી હતી. બિન-સરકારી સંગઠનોની બે અગત્યની માગણીઓ હતી: (૧) કોઈ ખાનગી ડોક્ટરને કે દવાખાનાને જાતિ નિર્ધારણનું પરીક્ષણ કરવાની ધૂટ ન આપવામાં આવે. (૨) જાતિ નિર્ધારણનું પરીક્ષણ કરવાનાર કોઈ સ્ત્રીને સજા ન કરવામાં આવે. જો કે, આ બંને માગણીઓનો સમાવેશ કાયદામાં કરવામાં આવ્યો નહોતો.

જો કે, અગત્યનો મુદ્દો એ છે કે માત્ર કાયદાની મદદથી સ્ત્રી ભૂણ હત્યાને રોકી શકાશે નહિ. લોક શિક્ષણ અને મહિલાઓના અધિકારોનું આંદોલન જ તેમાં અસરકારક ભૂમિકા ભજવી શકે છે. ‘વૃદ્ધાવસ્થામાં મા-બાપને પુત્રીઓ પણ ટેકો આપી શકે છે, અસમાનતા દૂર કરવાની જરૂર છે’ - સ્ત્રીઓને દૂર કરવાની નહિ, દહેજને ડામો - દીકરીઓને નહિ, તમારી દીકરીને સ્વાવલંબી બનાવો - શિક્ષણ આપો - તેને કામ કરવા દો તો તમારી દીકરી તમારા માટે બોજો નહિ બને’ વગેરે જેવા વિચારોનો પ્રચાર વધુ મહત્વનો સાબિત થાય તેમ છે. આમ, સામાજિક વલખોને બદલવાં જરૂરી છે.

તાજેતરમાં ‘વોલન્ટરી હેલ્થ એસોसીએશન ઓફ ઇન્ડિયા’ એ હરિયાણામાં કુરુક્ષેત્ર, પંજાબમાં ફિલેહગઢ્સાહિબ અને હિમાયલ પ્રદેશમાં એક સર્વેક્ષણ હાથ ધર્યું હતું. ૨૦૦૧ની વસ્તી ગણતરી અનુસાર આ વિસ્તારોમાં બાળકોમાં સ્ત્રી-પુરુષ પ્રમાણ ખૂબ જ નીચ્યું છે. તેમાં ગામડાંનાં ૧૪૦૧ ઘરોની મુલાકાત લેવાઈ હતી. તેમાં દસ્ત પરણિત સ્ત્રીઓ, ૭૨ ડોક્ટરો અને ૯૪ પંચાયત સત્યોની મુલાકાત લેવાઈ હતી. આ સર્વેક્ષણમાં એવું તારણ નીકળ્યું કે સ્ત્રી ભૂણ હત્યાનું એક સૌથી મહત્વનું કારણ એ છે કે દીકરીઓને પરિવારમાં સામાજિક અને આર્થિક બોજો ગણવામાં આવે છે અને એનું કારણ દહેજ, એની પવિત્રતા ભંગ થવાનો ડર અને તેના લગ્નની ચિંતા વગેરે છે. આ સંદર્ભમાં વેપારી દિમાગ ધરાવતા ડોક્ટરો અને ગ્રયોગશાળાના માલિકો છેલ્લાં ઘણાં વર્ષોથી સ્ત્રી ભૂણ હત્યા માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. શિક્ષિત કુટુંબોમાં પણ નાના કુટુંબના ધોરણોનો અર્થ એક અથવા બે દીકરાવાળો પરિવાર થાય છે. તેમને મોટે ભાગે દીકરીઓ

વિના ચાલે છે પણ દીકરા વિના ચાલતું નથી. જેમની પાસે ભિલકત છે તેઓ દીકરીઓ ઈચ્છા નથી કારણ કે તેમને ડર છે કે લગ્ન પછી જમાઈ ભિલકતમાં ભાગ માગશે. જેમની પાસે સંપત્તિ નથી તેઓ દીકરીઓ ઈચ્છા નથી કારણ કે તેમને દહેજની સતામણીનો ડર છે. તેઓ જો કે, તેમના દીકરાઓ માટે દહેજ સ્વીકારે છે.

દીકરાને આર્થિક સમૃદ્ધિની તક સમજવામાં આવે છે પણ દીકરીને આર્થિક બરબાદીની સીડી સમજવામાં આવે છે. ઉત્તર ભારતમાં આ વિચારધારા મજબૂત છે પણ એમ લાગે છે કે સમગ્ર દેશમાં તે હવે વધારે પ્રમાણવામાં વ્યાપી રહી છે. આમ, પુત્રેષણાની પરંપરા અને અદ્વારાઓનું ટેકનોલોજીનું અપવિત્ર જોડાણ ભારતીય સમાજને પતનની ખાઈમાં ઉતારી રહ્યું છે. ભારતનાં અનેક રાજ્યોમાં એક, બે કે વધુમાં વધુ ગ્રામ બાળકોવાળાં નાનાં ફુંબો ઈચ્છા લોકોમાં સ્ત્રી ભૂણ હત્યાનું પ્રમાણ ઘણું વધારે છે. નાની છોકરીઓને મારી નાખનારા સમુદ્યોમાં હવે સ્ત્રી ભૂણ હત્યાનું પ્રમાણ વધ્યું છે.

રાજ્ય અને બિન-સરકારી સંગઠનોના પ્રયાસો

૧૯૮૪માં પેરન્ટલ ડાયુનોસ્ટિક (રેગ્યુલેશન એન્ડ પ્રિવેન્શન ઓફ મિસયુઝ) એકટ સંસદ દ્વારા ઘડાયો. તે પછી અનેક રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા એ જ પ્રકારના કાયદા ઘડવામાં આવ્યા. ‘સેન્ટર ફોર ઈન્કવાયરી ઈનટુ હેલ્પ એન્ડ એલાઇઝ થિસ્સ’, ‘માસ્સ્યુમ’ અને ડૉ. સાબુ જ્યોર્જ દ્વારા જાહેર હિતની એક અરજી સર્વોચ્ચ અદાલતમાં કરવામાં આવી હતી. પછી સર્વોચ્ચ અદાલતે તેના તા.૪-૫-૨૦૦૧ના રોજના આદેશમાં તમામ રાજ્ય સરકારોને આ કાયદાનો તત્કાળ અને અસરકારક અમલ કરવા કહ્યું હતું. આ કાયદાનો અમલ તા.૧-૧-૧૯૮૫થી થયો. આ આદેશ અનુસાર ઉપરોક્ત કાયદા હેઠળ જેનેટિક કાઉન્સિલિંગ સેન્ટર, જેનેટિક લોબોરેટરી અને જેનેટિક ક્લિનિકની નોંધણી ફરજિયાત છે. તાજેતરમાં ૨૦૦૩માં પ્રિનેટલ ડાયુનોસ્ટિક ટેકનિક્સ (પ્રોહિબિશન ઓફ સેક્સ સિલેક્શન) એકટ ઘડાયો છે. સંગર્ભાવસ્થાના આર્થિક નિયમોમાં જાતિ પસંદગી ના થાય તે માટે આ કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે. આ કાયદો અસરકારક બને તે માટે પણ તેમાં જોગવાઈ કરવામાં આવી છે. વળી, ૧૯૮૪ના કાયદામાં ૨૦૦૨માં સુધારા કરવામાં આવ્યા છે અને તેને રાખ્યપતિએ તા.૧૭-૧-૨૦૦૩ના રોજ મંજૂરી આપી છે. આ કાયદાના નિયમોમાં ગયે વર્ષે સુધારા કરાયા છે અને તેમાંથી ‘લાપતા છોકરીઓ’ (મિસિંગ ગાર્લ્સ) ઊભી કરતી બદદીરાદાયુક્ત પ્રવૃત્તિઓને ડામવા માટેના અમલના તંત્રને વધુ

સક્રિય બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કાયદો અને ન્યાય મંત્રાલયના આદેશ અનુસાર મુંબઈ મહાનગરપાલિકાએ ગર્ભની જાતિ ગેરકાન્નૂની રીતે નક્કી કરવા સામે ઝુંબેશ ઉપાડી છે. તેમાં તમામ સોનોગ્રાફી કેન્દ્રોની નોંધણી થાય તે ફરજિયાત બનાવાયું છે. ગર્ભની જાતિ કોઈ પણ સંજોગોમાં જાહેર નહિ કરવામાં આવે એવું આ કેન્દ્રોમાં ફરજિયાતપણો પાટિયું લટકવેલું હોવું જોઈશે અને પણ નક્કી થયું છે.

બીજું એક પગલું એ પણ લેવાયું છે કે કોઈ પણ સંસ્થા એવી જાહેર ખબર ન આપી શકે કે ભીતિચિત્ર ન દર્શાવી શકે કે ટીવી શ્રેષ્ઠી પણ એવી ન હોઈ શકે કે જેનાથી જાતિ નિર્ધારણને ટેકો મળે કે પ્રોત્સાહન મળે. પુણોની ‘માસ્યુમ’ સંસ્થાએ ફેબ્યુઆરી-૨૦૦૨ દરમ્યાન બાલાજ ટેલિફિલ્મસની એક ટીવી શ્રેષ્ઠીમાં એક દંપતી બાળકની જાતિ જાણવાનો પ્રયાસ કરતું દર્શાવાયું હતું તેની મહારાઝ્ય રાજ્ય મહિલા પંચ સમક્ષ ફરજિયાદ કરી હતી. પંચે પછીથી મુંબઈ મહાનગરપાલિકાનો સંપર્ક સાધ્યો હતો અને પોલિસ મથક ફરજિયાદ નોંધાવાઈ હતી. પંચે ઊહાપોહ કર્યો એટલે નિર્માતા કંપનીએ પછી પંચ દ્વારા તૈયાર કરાયેલી એક જાહેરખબર આપી હતી. તેમાં એમ દર્શાવાયું હતું કે સ્ત્રી ભૂણ હત્યા માટે જાતિ નિર્ધારણનું પરીક્ષણ કરાવવું એ ફોજદારી ગુનો બને છે. હવે એક બીજી લડત શરૂ થઈ રહી છે. મહિલા જૂથો એવી માગણી કરી રહ્યા છે કે ગ્રામ માસ સુધી દરેક ભાગની પહેલાં એ જાહેર ખબર દર્શાવવી જોઈએ.

ઉપસંહાર

આ રીતે જોતાં લાગે છે કે વણજોઈતા સ્ત્રી બાળકને જન્મ આપવો તેના કરતાં સ્ત્રી ભૂણ હત્યા કરવી એ વધારે સારી બાબત છે એમ માનનારા લોકોને આપણો પડકારવાના છે. તેમનો તર્ક પુરુષોની સંકુચિતતાથી અસરગ્રસ્ત સ્ત્રીને જ મારી નાખે છે, તેને શક્તિમાન બનાવતો નથી. પણ તેને બદલે ‘કરિયાવર પાંચ લાખ રૂપિયા આપવો તેના કરતાં ૫૦૦૦ રૂપિયામાં ગર્ભપાત કરાવવો સારો’ એવી તેઓ જાહેરખબરો આપે છે. આ તર્ક કામે લગાડીએ તો એમ પણ કહેવું પડે કે ગરીબોને કે ત્રીજા વિશ્વાસ લોકોને ગરીબીમાં કે વંચિતતામાં જીવવું પડે તેના કરતાં તેમને મારી નાખવા એ વધારે સારી બાબત છે. આ તર્ક વળી પાછી એવી ધારણા પણ કરે છે કે દહેજ જેવાં દૂષણો ઈશ્વરદંત છે અને એમાં આપણો કશું કરી શકતા નથી. તેથી અસરગ્રસ્તને વધુ અસરગ્રસ્ત બનાવો એમ જ કહેવાય છે. દીકરીના શિક્ષણ,

જુઓ પૃષ્ઠ ૧૯

રાષ્ટ્રીય સૈચિક ક્ષેત્ર નીતિ-૨૦૦૩

ભારત સરકારના આયોજન પંચ દ્વારા દેશમાં સૈચિક સંસ્થાઓના ક્ષેત્ર માટે એક રાષ્ટ્રીય નીતિ ઘડવાનો પ્રયત્ન કરાયો છે. તેણે આ અંગે મુસદો તૈયાર કર્યો છે અને રાષ્ટ્રીય ચર્ચાને નિમંત્રણ આપ્યું છે. અતે આ મુસદાનો ગુજરાતી અનુવાદ અક્ષરશઃ પ્રસ્તુત છે. તેમાં સૈચિક ક્ષેત્રને સ્પર્શતા ઘણા મુદ્દાઓની ચર્ચા કરાઈ છે. આ વિશેનાં પોતાનાં મંતવ્યો સૈચિક સંસ્થાઓના કાર્યકરો આયોજન પંચને મોકલી શકે છે.

આમુખ

ભારતીય પરંપરાઓ અને સંસ્કૃતિઓ દ્વારા સૈચિક કાર્યને અપાયેલા ઊંચા દરજા અને માન તથા આ દેશના લોકોમાં સૈચિક મવૃત્તિની ભાવના વ્યાપકપણે વિદ્યમાન હોવાની બાબતને સ્વીકારીને,

સ્થાનિક પ્રયાસો, સ્થાનિક સંસાધનો અને સામાજિક કાર્ય દ્વારા સહભાગી વિકાસની પરંપરા વિકસાવીને દેશમાં સૈચિક કાર્ય જે મહત્વાનું પ્રદાન કર્યું છે તે પિછાણીને,

સામાજિક અને પર્યાવરણીય મુદ્દાઓ અને સમસ્યાઓ વિશે લોકોમાં જાગૃતિનું સ્તર વધારવામાં, સમાજના તમામ વર્ગોને આર્થિક અને સામાજિક સેવાઓ અસરકારક રીતે પૂરી પાડવામાં અને નીતિવિષયક હિમાયતમાં સરકારી વ્યવસ્થાઓ અને સંસ્થાઓની મર્યાદાઓ સમજીને,

સરકાર દ્વારા કરાતા પ્રયાસોમાં પૂરક બનવાની, આર્થિક, સામાજિક અને પર્યાવરણીય વિકસ માટેના વૈકલ્પિક વાહકો પૂરા પાડવાની અને જાહેર સ્તરોને સુધારવાની સૈચિક ક્ષેત્રની શક્તિની નોંધ લઈને,

સુષુપ્તા શક્તિને ઉજાગર કરવા માટે અને સમાજના તમામ વર્ગો તથા ખાસ કરીને ગરીબો માટે આર્થિક અને સામાજિક વિકાસના સંદર્ભમાં ઈષ્ટતમ અસરો ઊભી કરવા માટે જાહેર, ખાનગી અને સૈચિક ક્ષેત્રનાં કાર્યો વચ્ચે સંવાદિતા ઊભી કરવાની જરૂરિયાત હોવાનું સ્વીકારીને,

સૈચિક ક્ષેત્રને સુગઠિત કરવા અને વિસ્તારવા માટે અને

સામુદ્દરિક કાર્ય તથા સામાજિક ચેતના ઊભી કરવાના એક સાધન તરીકે કામ કરવા તેને સક્ષમ બનાવવા માટે ઉચ્ચિત નીતિવિષયક અને સંસ્થાગત માળખું પૂરું પાડવાની જરૂરિયાત છે તેવો નિર્ણય કરીને, ‘રાષ્ટ્રીય સૈચિક ક્ષેત્ર નીતિ-૨૦૦૩’ આ મુજબ ઘડાઈ છે:

૧. ભાવિ દસ્તિ

ભારતમાં એવી પરિસ્થિતિ ઊભી કરવી કે જેથી પોતાના સમાજના ભલા માટે નિઃસ્વાર્થપણે પ્રદાન કરવાની મનુષ્યોની આંતારિક ઉત્કંઠાને વૈકલ્પિક સંસ્થાગત વાહકો અને વિવિધ ભૂમિકાઓ દ્વારા સંપૂર્ણ અભિવ્યક્તિ પ્રાપ્ત થાય, અને તેમના રાષ્ટ્ર પ્રત્યેના યોગદાનને તમામ આવશ્યક માન-સન્માન અને માન્યતા આપવામાં આવે.

૨. ઉદ્દેશો

આ ભાવિ દસ્તિના સંદર્ભમાં આ નીતિના હેતુઓ આ મુજબ છે:

- ૨.૧ સામાન્ય રીતે સૈચિક કાર્ય અને વિશેષ રીતે સૈચિક સંગઠનોને પ્રોત્સાહન આપવા માટે સક્ષમતાપ્રેરક કાનૂની પર્યાવરણ ઊભું કરવું.
- ૨.૨ લોકોને અને ખાસ કરીને ગરીબો, વંચિતો અને છેવાડાના લોકોને આર્થિક અને સામાજિક સેવાઓની ડિઝાઇન તૈયાર કરવામાં અને તે પૂરી પાડવામાં સૈચિક ક્ષેત્રની સામેલગીરીને પ્રોત્સાહન આપવું.
- ૨.૩ ડિમાયત, જાગૃતિ સર્જન અને સામાજિક એકત્રીકરણમાં સૈચિક ક્ષેત્રની ભૂમિકા વધારવી.
- ૨.૪ આપત્તિ સંચાલન અને તેના સામનાની તૈયારી તથા સ્થાનિક સારે સામાજિક ક્ષમતાના નિર્માણમાં રાજ્યના ભાગીદાર તરીકે કામ કરવા સૈચિક ક્ષેત્રની ક્ષમતા મજબૂત બનાવવી અને વિસ્તારવી.
- ૨.૫ સૈચિક ક્ષેત્ર જાહેર સંસ્થાઓની કામગીરીના રખેવાળની ભૂમિકા અસરકારક રીતે અદા કરે અને જાહેર કામ કરનારાઓના અંતરાત્માના રખેવાળ તરીકે કામ કરે તે માટે સૈચિક ક્ષેત્રને સક્ષમ બનાવવું.
- ૨.૬ કોઈ બિનજરૂરી અવરોધો અને બાંધછોડ વિના સૈચિક ક્ષેત્ર તેનાં કાર્યો કરી શકે તે માટે નાણાકીય સંસાધનોનો

	પૂરતો પ્રવાહ તેના તરફ વહે તે માટેનું માળખું પૂરું પાડવું.	પણ સૈચિછિક સંગઠનો ગણવામાં આવશે.
૨.૭	સાહસિકતા, તકનિકી અને કૌશલ્યોની તબદીલી માટેના માધ્યમ તરીકે સૈચિછિક ક્ષેત્રની ક્ષમતા સુધારવી.	૪.૧ સૈચિછિક સંગઠનોને ઔપયારિક કે કાનૂની માન્યતા અત્યારે સોસાયટીઝ રજિસ્ટ્રેશન એક્ટ-૧૯૭૦, ઇન્ડિયન ટ્રસ્ટ્સ એક્ટ-૧૯૮૨, ચેરિટેબલ એન્ડ રિલિજિયસ ટ્રસ્ટ એક્ટ-૧૯૨૦, ઇન્ડિયન કંપનીઝ એક્ટ-૧૯૫૦ની કલમ ૨૫ અને રાજ્યોના આ જ પ્રકારના કાયદાઓ દ્વારા આપવામાં આવે છે. આ કાયદાઓમાંની ઘણી જોગવાઈઓ જૂની-પુરાણી કે નકામી થઈ ગઈ છે અને આજે સૈચિછિકતાનું નિયમન કરવા કરતાં તેને ગ્રોટ્સાહન આપવાની વધારે જરૂર છે તે જોતાં, આવા તમામ કાયદાઓનું પુનઃ આકલન કરવામાં આવશે અને સૈચિછિક ક્ષેત્રના હિતધારકો અને સૈચિછિક ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે યોગ્ય વિચાર-વિમર્શ બાદ તેમાં સાનુક્ષણ સુધારા કરવામાં આવશે.
૨.૮	સૈચિછિક ક્ષેત્રની છાપ અને પ્રતિષ્ઠા લોકનજરે સતત વધી શકે તેવા માપદંડો દર્શાવવા.	૪.૨ માલિકીની પેઢી, ભાગીદારી પેઢી અને સહકારી મંડળીઓ વગેરે જેવાં કંપનીઓ સિવાયનાં ખાનગી વ્યાપારી સંગઠનો માટે, તેઓ સૈચિછિક પ્રવૃત્તિઓ આસાનીથી કરી શકે તે માટે તેમની કામગીરી અંગેના કાયદાઓમાં યોગ્ય જોગવાઈઓ કરવામાં આવશે.
૩.૧	સૈચિછિક કાર્ય (વોલન્ટરી એક્શન) એક એવું કાર્ય કે પ્રવૃત્તિ છે કે જે કોઈ વ્યક્તિગત નાણાકીય કે ભૌતિક વળતર વિના અન્યોના લાભ માટે વ્યક્તિ કે વ્યક્તિઓ દ્વારા હાથ ધરાય છે.	૪.૩ જે અનૌપયારિક જૂથો કે મંડળો - જેવાં મંડળો કે સામુદ્રાયિક મંડળો, યુવા મંડળો, મહિલા મંડળો વગેરે - તેમની મુખ્ય પ્રવૃત્તિ તરીકે સૈચિછિક કાર્ય હુથા ધરતાં હોય અથવા સ્વસહાય જૂથો જેવાં મંડળો પેટા પ્રવૃત્તિ તરીકે તે હાથ ધરતાં હોય તો, જો તેઓ ઈચ્છે તો ઉચ્ચ સ્તરીય સરકારો સાથે યોગ્ય સંબંધ સાથે સ્થાનિક સ્તરની સરકારોમાં તેમની નોંધણી કરાવી શકે છે. આવી નોંધણી જે જહેર ભંડોળનો ઉપયોગ ન થવાનો હોય તો વપરાશકાર-મિત્ર અને બિન-નિયમનકારી હોય તેની કાળજી રાખવી જોઈએ.
૩.૨	તેથી સૈચિછિક સંગઠન (વોલન્ટરી ઓર્ગનાઇઝેશન)ની વ્યાખ્યા વ્યક્તિગોના એક એવા મંડળ (એસોસીએશન) તરીકે બાંધી શકાય કે જે (અ) સૈચિછિક કાર્યનું આયોજન કરવા અને તેનો માર્ગ પ્રશસ્ત કરવા સ્થપાયું છે, અથવા (આ) તે તેની નિયમિત પ્રવૃત્તિઓ ઉપરાંત તે આવાં કાર્યો હાથ ધરે છે.	૪.૪ સૈચિછિક કાર્ય વ્યક્તિગોની સામેલગીરીને ગ્રોટ્સાહન આપવા માટે સ્થાનિક સ્તરની સરકારોમાં રસ ધરાવતી વ્યક્તિઓનું એક પત્રક રાખવામાં આવશે અને તે સામાજિક અને આર્થિક વિકાસની પ્રવૃત્તિઓમાં સામેલ તમામ સરકારી અને બિન-સરકારી સંસ્થાઓને વિનામૂલ્યે પ્રાપ્ય બનશે.
૩.૩	સામાન્ય લોકોનું ભલું કરવાના સામાજિક ઉદ્દેશો સિદ્ધ કરવાના હેતુ માટે સ્થાપાયેલાં બિન-પક્ષપાતી અને બિન-નફાકારક કે નફો ન વહેંચતાં સંગઠનો, કે જ્યાં હોદેદારો અને સભ્યો સંગઠનમાંથી કોઈ વળતર પ્રાપ્ત કરતા નથી તેમને સૈચિછિક સંગઠનો ગણવામાં આવે છે.	૪.૫ સૈચિછિક સંગઠનોનાં નેટવર્ક્સ, મંડળો અને મહામંડળોને દેશમાં સૈચિછિક આંદોલનને તથા તેમનો અવાજ સંભળાય તે માટે તેમને ટેકો અપાશે. આવાં સંગઠનો ઔપયારિક
૩.૪	તકનિકી અને સંચાલન કૌશલ્યો ગ્રામીણ અને પદ્ધતા વિસ્તારોમાં તબદીલ કરવા માટે સામાજિક સાહસિકતા એક મૂલ્યવાન વાહન તરીકે ઉપસી આવી છે તે હકીકિતને પિણજાળીને આવાં સંગઠનોને પણ સૈચિછિક સંગઠનો ગણવામાં આવશે. તેમાં શરત એ છે કે, તેમાં વળતર અને અથવા મળતર તુલનાત્મક વ્યાપારી સંગઠનો કે જાહેર ક્ષેત્ર કરતાં ખાસાં નીચાં હોય.	
૩.૫	જ્યાં સૈચિછિક કાર્ય વ્યક્તિઓ તેમના વ્યક્તિગત સૈચિછિક સંગઠન તરીકે ગણવામાં આવશે.	
૩.૬	બીજા કોઈ પણ સૈચિછિક કાર્ય કરતું હોય અથવા સામાજિક જવાબદારીઓ નિભાવતું હોય અને જ્યાં માલિકો/સભ્યો આવી પ્રવૃત્તિઓમાંથી વધારાનું વળતર મેળવતા ન હોય, તેમને પણ આવી નિશ્ચિન્તન પ્રવૃત્તિઓ હાથ ધરવાના હેતુ માટે સૈચિછિક સંગઠન તરીકે વર્ગીકૃત કરવામાં આવશે.	
૩.૭	સૈચિછિક સંગઠનોનાં નેટવર્ક્સ, મંડળો અને મહામંડળોને	

	રીતે નોંધણી કરાવે તેવી અપેક્ષા છે.	
૪.૬	તમામ સ્વયંસેવકોને યોગ્ય માન-સન્માન અને સહકાર પ્રાપ્ત થાય તે માટે સ્વયંસેવકોના અધિકારો અને વિશેષાધિકારોના ખતપત્રનો એક નમૂનો તૈયાર કરાશે અને સરકારના તમામ વિભાગો અને જાહેર સંસ્થાઓ તે સ્વીકારશે.	ઉપયોગ કરવા ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવશે. સ્વયંસેવકોની આવી સામેલગીરી માટેની માર્ગરિખાઓ જે તે જાહેર સવલતોમાં ફરજિયાત અમલ માટે રાજ્યો અને સ્થાનિક સરકારો દ્વારા તૈયાર કરવામાં આવશે.
૪.૭	જાહેર નાણાંથી થતા કાર્યમાં સ્વૈચ્છિક સંગઠનોને સામેલ કરવા માટેનાં નિયમો અને કાર્યવિધિઓ ઈ-શાસનનાં સાધનો અને સરળ માળખાં સ્વીકારીને સુધારવામાં આવશે.	૪.૩ જાહેર અને સામુદાધિક અસ્કામતોના ઉપયોગને સુધારવા માટે સરકાર સ્વૈચ્છિક સંગઠનો દ્વારા સરકારી સવલતોના ઉપયોગ માટે મંજૂરી આપવા અને ખરેખર તો તેને પ્રોત્સાહન આપવા માર્ગરિખાઓ ઘડશે કે જેથી આ સંસ્થાઓની સામાન્ય કામગીરીને પૂરક એવું સ્વૈચ્છિક કાર્ય હાથ ધરી શકાય.
૪.૮	તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તથા કેન્દ્રીય સ્તરે આયોજન પંચમાં સ્વૈચ્છિક ક્ષેત્ર સાથે સહયોગ માટે સંયુક્ત તંત્ર કે વિમર્શ મંચ સ્થાપવામાં આવશે.	૪.૪ સ્થાનિક બાબતો અને સર્વસામાન્ય જરૂરિયાતો વિશેની સ્વૈચ્છિક ક્ષેત્રની જાણકારીના સંદર્ભમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ સ્તરે આયોજનમાં સ્વૈચ્છિક સંગઠનોની સામેલગીરીને પ્રોત્સાહન આપવામાં આવશે.
૪.૯	સ્વૈચ્છિક સંગઠનોની ફરજિયાદાના નિવારણ માટે અને તેમના કામ તથા ખાસ કરીને પરિયોજનાઓના અમલ સંબંધી તમામ પ્રશ્નોના ઉકેલ માટે મંત્રાલયમાં / રાજ્ય સ્તરે અને જિલ્લા સ્તરે સંકલન તંત્ર ઊભું કરવામાં આવશે.	૪.૫ હિમાયત અને આયોજનના હેતુઓ માટે સ્થાનિક માહિતી પાયો ઉભો કરવા અને જાળવવામાં સ્વૈચ્છિક સંગઠનોને પ્રોત્સાહન આપવામાં આવશે અને ટેકો આપવામાં આવશે.
૪.૧૦	સ્વૈચ્છિક સંગઠનોની નોંધણી/પત્રક બનાવવાની પ્રક્રિયાનું કોમ્પ્યુટરીકરણ કરાશે અને આયોજન પંચ સ્વૈચ્છિક ક્ષેત્ર વિશે રાષ્ટ્રવ્યાપી માહિતી પાયો પૂરો પાડશે.	૪.૬ કેન્દ્ર અને રાજ્ય સરકારોના મંત્રાલયો અને વિભાગોએ સ્વૈચ્છિક સંગઠનો અને સક્ષમ નેટવર્ક સંગઠનોની પ્રતિનિધિત્વપ યાદી બનાવવી જોઈએ કે જે મની સાથે આર્થિક અને સામાજિક નીતિ, આયોજન અને વિકાસલક્ષી દરમ્યાનગીરીના ઘડતર સંબંધી બાબતો વિશે નિયમિત ઘોરણો ચર્ચા-વિચારણા કરી શકાય.
૪.૧૧	કેન્દ્ર અને રાજ્ય બંને સ્તરે સરકારો સ્વૈચ્છિક ક્ષેત્ર દ્વારા થયેલા નોંધનીય કાર્યની માન્યતા અને પુરસ્કૃતતા માટે અને નીતિવિષયક ચર્ચા ઊભી કરવા માટે કાર્યકારી મોડેલ અને સફળતાની કહાણીઓના પ્રકાશન માટે તથા એવા જ પ્રકારનાં કાર્યોનું પુનરાવર્તન થાય તે માટે અને આવા પ્રયાસોમાં સુધારા થાય તે માટે તંત્ર ઊભું કરાશે.	૪.૭ વિવિધ જાહેર સેવાઓની સવલતો અને કટ્યાશલક્ષી યોજનાઓનાં કામગીરી અને સંચાલનમાં યોગ્ય સત્તા અને અધિકારની વહેંચાણી સાથે સ્વૈચ્છિક સંગઠનોને સામેલ કરવામાં રાજ્ય અને સ્થાનિક સરકારોને પ્રોત્સાહન આપવામાં આવશે.
૫.૧	ભાગીદારીનો અર્થ એ છે કે સહભાગીઓ વચ્ચે સંયુક્ત રીતે સંમત એવા લક્ષ્યાંકો વહેંચાય છે અને સમાન હિત તથા સમાન માલિકીની ભાવના સાથે સક્રિયપણે સાથે કામ કરવાની સહભાગીઓની ફરજ હોય છે.	૪.૮ સ્થાનિક સ્તરે પરિયોજનાઓમાં ભાગીદારી, અમલ અને નિભાવ માટે લોકોને એકત્ર કરવા અને સંગઠિત કરવા માટે સ્વૈચ્છિક સંગઠનોને પ્રોત્સાહન આપવામાં આવશે.
૫.૨	વધારાની માનવ શક્તિની પ્રાપ્તા દ્વારા અને વધુ પ્રતિબદ્ધતા અને સંવેદનશીલતા દ્વારા જાહેર સેવાઓની ગુણવત્તા સુધારવા માટે સરકાર શાળાઓ, વ્યાવસાયિક તાલીમ કેન્દ્રો, કુટુંબ કલ્યાણ કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, હોસ્પિટલો વગેરે જેવી જાહેર સેવાઓ આપતી સંસ્થાઓમાં સ્વયંસેવકોની સામેલગીરીને પ્રોત્સાહન આપશે. નિવૃત્ત વ્યક્તિઓ અને મોટોરાંઓનાં જ્ઞાન અને અનુભવનો	૫.૯ જાહેર ભાગીદારીની ભાવના સાથે સાનુક્ષે સ્થાનિક જાહેર અને અથવા સામુદાધિક પરિયોજનાઓએ હાથ ધરવા માટે સ્વૈચ્છિક સંગઠનોને પ્રાથમિકતા આપવામાં આવશે. આ હેતુ માટે માર્ગરિખાઓ ઘડવામાં આવશે અને તેમની જાહેરાત કરાશે.
૫.૩		૫.૧૦ જાહેર સવલતોની કામગીરીની દેખરેખમાં અને સામાજિક ક્ષેત્રોમાં સરકારી પરિયોજનાઓ અને યોજનાઓના અમલમાં સ્વૈચ્છિક સંગઠનોની, જો અન્યથા દબાણડુપ

નવી સરકારી નીતિ સામાજિક વિકાસ માટે હાનિકારક

નાના દાતાઓ દ્વારા અપાતી નિષ્ઠિત હેતુઓ માટેની સહાય આપણી પ્રાથમિકતાઓને ગેરમાર્ગ દોરે છે અને ભારત એવા તબક્કો પહોંચી ગયો છે કે જ્યાં તે તેનાં આંતરિક સંસાધનો દ્વારા પોતાના મોટા ભગના કાર્યક્રમો ચલાવી શકે તેમ છે અને સમસ્યાઓનો સામનો કરી શકે તેમ છે, એવા બહાના હેઠળ ભારત સરકારે તાજેતરમાં એકપદ્ધિય રીતે અમેરિકા, બ્રિટન, જાપાન, યુરોપીય સંઘ, જર્મની અને રષિયા સિવાયના ઘણા દ્વિપક્ષી સહાયદાતાઓને આવજો કહી દેવાનો નિર્ણય કર્યો છે. આ શું ખરેખર હકીકત છે કે પછી આપણી સરકાર કરોડો ગરીબો અને છેવાડે ફંકાઈ ગયેલા લોકો સાથે રાજ્યરમત રમવાનો પ્રયાસ કરી રહી છે?

એ એક સાર્વનિક હકીકત છે કે ‘મોટા ખેલાડીઓ’ મહત્વના હોય છે અને તેથી મોટા ભગના વિકાસલક્ષી કાર્યક્રમો વિશ્વ બેંક, યુરોપીય સંઘ, એશિયાઈ વિકાસ બેંક, ડિએફઆઈડી અને જાપાનીઓની પકડમાં આવી ગયા છે. પરંતુ એક બાબત ન ભૂલવી જોઈએ કે ‘નાના ખેલાડીઓ’ ગરીબો અને તરફાડાયેલાઓના અધિકારો જેવા ઘણા વાસ્તવિક વિકાસલક્ષી મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતા રહ્યા છે. આ મુદ્દાઓમાં સામાજિક અને આર્થિક સક્ષમતા, સામાજિક અને કોમી એખલાસ અને માનવ અધિકારોનો સામન્યતયા સમાવેશ થાય છે અને વાસ્તવમાં આ મુદ્દાઓ જ સરકારમાં બેસનારા લોકો માટે સમસ્યાઓ ઊભી કરે છે. તેથી તેમણો આવી પ્રવૃત્તિઓને ટેકો આપનારા દાતાઓને રોકવાનો આ રસ્તો અપનાવવાનો નિર્ણય કર્યો છે. જો આ હકીકત ના હોય તો પછી શા માટે સરકારે બિન-સરકારી સંગઠનોને અનુદાન આપવા માટે આગોતરી મંજૂરી મેળવવાની શરત દ્વિપક્ષી દાતાઓ પર લાઈ છે અને વર્ષમાં બે વખત અહેવાલ આપવાનું શા માટે કહેવામાં આવ્યું છે? વળી, નિષ્ઠિત સમયગાળામાં આ ભંડેળનો તેમણો કેવી રીતે ઉપયોગ કર્યો છે તે કહેવાનું પણ શા માટે ફરજિયાત બનાવાયું છે?

સરકારના આ નિર્ણયથી ઘણાં પ્રશ્નો અને શંકાઓ ઊભાં થયાં છે તેથી તેમણે ભારતના લોકો સમક્ષ સ્પષ્ટતાઓ કરવાની જરૂર છે. સૌ પ્રથમ તો, એશિયાના અડધા અને જગતના ચોથા ભાગના ગરીબો ભારતમાં છે ત્યારે સરકાર દેશમાં કેવી રીતે ગરીબીના પ્રશ્નનો સામનો કરશે? ‘સહસ્રાંશી વિકાસ લક્ષ્યાંકો’ પાર પાડવા માટેનાં નાણાં તે કયાંથી લાવશે? બીજું, દ્વિપક્ષી દાતાઓ જે વિકાસલક્ષી યોજનાઓને ટેકો આપે છે તેમાંથી રાજ્ય સરકારો હટી જરૂર તો એ યોજનાઓનું શું થશે? ત્રીજું, નાણાં પ્રધાને મંત્રાલયો અને આયોજન પંચ કે સંસદ સાથે પણ ચર્ચા કર્યા વિના એકપક્ષી ઢબે આ નીતિવિષયક નિર્ણય કેમ લીધો?

ચોથું, ભારત સરકાર આયોજન પંચ અને રાજ્ય સરકારોની માંગો પૂરી કેવી રીતે કરશે? અવારનવાર આયોજન પંચે એમ કહ્યું છે કે ભારતને વધતી જતી સામાજિક વિકાસલક્ષી માંગને પહોંચી વળવા માટે વધુ ને વધુ સંસાધનોની જરૂર છે. ૨૦૦૨-૦૭ની દસ્મી પંચવર્ષીય યોજનામાં સંસાધનોની અધત અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને ઈચ્છિત વૃદ્ધિ દર માટે દેવા સિવાયની બાધ્ય મૂડી પર ખાસ્સો આધાર રાખવામાં આવ્યો છે. આયોજન પંચે સહાયના વધુ પ્રવાહની હિમાયત કરી છે જ્યારે નાણાં મંત્રાલય તદ્દન વિરુદ્ધ દિશામાં વર્તો છે. રાજ્ય સરકારો પડા સમાન રીતે સંબંધિત છે, અને ઘણા રાજ્ય સરકારો તેમના કર્મચારીઓને પગાર ચૂકવવાની સ્થિતિમાં પણ નથી, અને તેથી વિકાસલક્ષી કામો માટેનાં નાણાં પગારો ચૂકવવામાં વાપરે છે. જો રાજ્ય સરકારોને દ્વિપક્ષી સંસ્થાઓ તરફથી ટેકો નહિ મળે તો પછી તેઓ રાજ્યની વિકાસલક્ષી પ્રાથમિકતાઓના પડકારોનો સામનો કેવી રીતે કરશે? પાંચમું, છેલ્લાં ૫૦ વર્ષ દરમ્યાન જે દેશોએ ભારતને ટેકો આપ્યો છે તેમની સાથેના આપણા દ્વિપક્ષી સંબંધોનું શું થશે? ઘણા દ્વિપક્ષી દાતા દેશોએ આ નીતિવિષયક નિર્ણયથી જાહેરમાં પોતાની નારાજગી પણ વ્યક્ત કરી છે. આ રોષને સરકાર ઠંડો કેવી રીતે પાડશે?

ઘણાને માટે આ પ્રકારનો નીતિવિષયક નિર્ણય એવો સંકેત આપે છે કે ભારત એક આર્થિક સત્તા બની રહ્યું છે અને તેથી તે ‘સંયુક્ત રાષ્ટ્રો’ (યુનાઇટેડ નેશન્સ - યુનેન)ની સલામતી સમિતિમાં કાયમી બેઠક મેળવવાને લાયક છે. જો એમ જ હોય તો પછી અમેરિકા, રષિયા, બ્રિટન અને જર્મની જેવા મોટા ખેલાડીઓને આ નીતિવિષયક નિર્ણયથી અસર કેમ થઈ નથી? પરંતુ ‘મોટા ખેલાડીઓ’ આપણાને માન્યતા આપે તે માટે શું આપણો જી-૨૧ કે જી-૨૪ જૂથના વિકસતા દેશો સાથેના આપણા સંબંધોનું બલિદાન આપવું જોઈએ કે નહિ એ પ્રશ્ન ઊભો થાય છે. આ કહેવાતા મોટા ખેલાડીઓમાં રષિયા સિવાય કોઈ ભારતના કુદરતી રીતે ટેકેદાર રહ્યા નથી, ત્યારે વર્ષોથી જેઓ ભારતના મિત્ર રહ્યા છે એવા વિકસતા દેશો ગુમાવવાનું શું ભારત માટે સાચું છે? દેશના સંબંધિત નાગરિકો ભારત સરકાર ઉપર તે આ નીતિવિષયક નિર્ણય બદલે તે માટે દબાડું કરે. અને શા માટે સરકાર નીતિવિષયક નિર્ણયો લેતી વખતે વરંવાર સંસદને ઉવેબે છે તેવો પ્રશ્ન પણ પૂછવો જોઈએ. કોઈ પણ નીતિ વિશે સૌ પ્રથમ સંસદમાં ચર્ચા થવી જોઈએ અને સંસદની મંજૂરી મળ્યા પછી જ એ નીતિની જાહેરાત થવી જોઈએ.

(‘વોલન્ટરી એક્શન નેટવર્ક ઇન્ડિયા’ના સમાચારત્રના નવેમ્બર-૨૦૦૩ના અંકમંથી સાભાર)

કારણો ના હોય તો, વાસ્તવિક કામગીરી અને ક્ષમતાના સંદર્ભમાં તબક્કાવાર સંસ્થાકૃત કરાશે. સૈચિછિક સંગઠનોના દેખરેખના કાર્ય અને અમલમાં તેમની સીધી ભાગીદારીના કાર્ય વચ્ચે કોઈ હિતસંઘર્ષ ના થાય તેની કાળજ રાખવામાં આવશે.	સૈચિછિક સંગઠનો બંદો અને નાણાં સંસ્થાઓનું ભંડોળ માન્યતા કે જુથ બાંધદી દ્વારા પ્રાપ્ત કરી શકે એ માટેની કાર્યવાહી ધરી કાઢશે. આંદો લોનો સૈચિછિક સંગઠનોની આવર્તક આવકમાંથી કે સરકાર પુરસ્કૃત કાર્યક્રમોના ડિસ્સામાં સરકાર દ્વારા છૂટાં કરતાં નાણાંમાંથી પરત મેળવી શકાશે.
૫.૧૧ તમામ સરકારી યોજનાઓ અને કાર્યક્રમો - અને ખાસ કરીને લાભાર્થીલક્ષી હોય તેવા વિશેષ - માં તેમના હેતુઓ, લક્ષ્યાંકો અને લાભોના સ્વરૂપને વિશે શક્ય તેટલી વ્યાપક પ્રસિદ્ધ ઊભી કરવામાં સૈચિછિક સંસ્થાઓને સામેલ કરે તે જરૂરી છે. આ કાર્ય અસરકારક રીતે કરવા માટે સૈચિછિક સંગઠનોને માટે તમામ પ્રસ્તુત માહિતી ઉપલબ્ધ બનાવવામાં આવશે.	૫.૫ સૈચિછિક ક્ષેત્રને ટેકો પૂરો પાડવા માટે સરકાર અને તેની સંસ્થાઓ દ્વારા હાલ જે વિવિધ યોજનાઓ - જેમ કે, કાપાર્ટની - ચલાવવામાં આવે છે તેમને આ નીતિના ઈરાદાઓનું પ્રતિબિંબ પડે તે રીતે સાનુક્ષણ સુધારાઓ કરીને મજબૂત કરાશે અને તે વિસ્તારાશે.
૫.૧૨ સરકાર તાતા સામાજિક અને આર્થિક પ્રશ્નો વિશે જનજાગૃતિ ઊભી કરવામાં નાણાંકીય ટેકો પૂરો પાડવા સહિત સરકાર સૈચિછિક ક્ષેત્ર સાથે સક્રિયપણે સંપર્ક જાળવશે અને પ્રતિભાવ મેળવવા માટે અને તેની પ્રક્રિયા માટે તંત્ર ઊભું કરશે.	૫.૬ બિન-સરકારી સંસ્થાઓને બાધ દ્વિપક્ષી નાણાં ભંડોળ મળે તેને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારે લીધેલા નિષ્ઠયના સંદર્ભમાં આ પ્રક્રિયાને આગળ ધ્યાવવા માટે સરકાર દ્વારા કાર્યવિધિઓ નક્કી કરવામાં આવશે. જો જરૂર જણાશે તો ઔપચારિક સરકારી સંપર્ક દ્વારા પર્યાપ્ત સગવડતાની જોગવાઈ પણ તેમાં કરવામાં આવશે. નાણાંના આવા પ્રવાહ માટે સૈચિછિક સંગઠનોને પ્રાથમિકતા આપવામાં આવશે.
૫.૧૩ સરકાર અને સૈચિછિક ક્ષેત્ર વચ્ચે પારસ્પરિક સમજ અને સંદ્રભાવ વધારવા માટે સરકાર સૈચિછિક કાર્યમાં સરકારી અને જાહેર ક્ષેત્રના કર્મચારીઓ ભાગીદાર થાય તે માટે પ્રોત્સાહન આપશે અને નોકરીના નિયમોમાં તે અંગે યોગ્ય જોગવાઈ કરશે.	૫.૭ એફસીઆરએના નિયમોમાં એક જ જગ્યાએથી મંજૂરી મળે તે માટે યોગ્ય સુધારા કરવામાં આવશે.
૫.૧૪ નાણાંકીય પ્રશ્નો	૫.૮ અમલની ગતિને વિપરીત અસર ના થાય અને સૈચિછિક સંગઠનોની ટકાઉપણા સાથે બાંધછોડ ના થાય તે માટે નાણાંના પ્રવાહની સ્થિરતા અને પૂર્વસૂચનીયતા અનિવાર્ય છે. કેન્દ્ર અને રાજ્ય તકેદારી પંચો સંબંધિત જાહેર કર્મચારીઓના અસાધારણ વર્તન કે ઈરાદાપૂર્વકની વિલંબકારી નીતિના કિસ્સાઓ ઝડપથી ઉકેલવાની કાર્યવાહી નક્કી કરશે.
૫.૧૫ સંબંધિત સૈચિછિક સંગઠન અને અન્ય હિતધારકો સાથે અગાઉથી વિચાર-વિમર્શ કર્યા વિના નાણાંકીય બાબતો અંગેની શરતો કે માળખામાં કોઈ ફેરફાર ના થવો જોઈએ.	૫.૯ સરકાર ખાસ કરીને સૈચિછિક સંગઠનો અને નેટવર્ક સંગઠનો દ્વારા પ્રેરિત સંસ્થાઓને એવા નવા આકાંક્ષાઓને વ્યવસ્થાપી તાલીમ આપવા માટે પ્રોત્સાહન આપશે કે જેઓ કારકિર્દી તરીકે સૈચિછિક કાર્ય અથવા સામાજિક સાહસિકતાને અપનાવવા માગતા હોય, અને તેમને સૈચિછિક સંગઠનો રચવામાં પણ મદદ કરવાનો પ્રયાસ

૬. નાણાંકીય પ્રશ્નો

- ૫.૧ મુખ્ય બાબત એ છે કે સૈચિછિક સંગઠનો સમુદ્દરાયમાંથી અને સખાવતી કે વ્યાપારી સંગઠનોના દાનમાંથી સંસાધનો ઊભાં કરે તેવી અપેક્ષા છે. સામુદ્દાયિક ટેકાનું પ્રમાણ અને સાતત્ય એ સૈચિછિક સંગઠનની ક્ષમતા, પ્રતિષ્ઠા, સ્વીકાર્યતા અને સમર્પિતતાનું ચાવીરૂપ નિર્દેશક બનશે.
- ૫.૨ જાહેર સંસ્થાઓની ચાલુ પ્રવૃત્તિઓમાં જ્યાં સૈચિછિક ક્ષેત્ર પૂરક બને છે ત્યાં સૈચિછિક સંગઠનને જે ખર્ચ થાય તે અથવા કરવો પડે તે ભરપાઈ કરવા માટે સંબંધિત સંસ્થાઓનાં અંદાજપત્રોમાં યોગ્ય જોગવાઈઓ કરાશે.
- ૫.૩ જ્યાં અમુક નિશ્ચિત પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે સૈચિછિક સંગઠનોને જાહેર ભંડોળ તબક્કાલ કરવાની જરૂરિયાત હોય ત્યાં માન્યતા પદ્ધતિ અપનાવવી જ પડે. સૈચિછિક ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે વિચાર-વિમર્શ કરીને વિવિધ નાણાંકીય મયદાઓ સાથે વિવિધ સ્તરની સરકારોએ માન્યતા બદલવા સતરીકરણની પદ્ધતિ વિકસાવાશે.
- ૫.૪ સૈચિછિક ક્ષેત્ર તરફ નાણાંનો પ્રવાહ વહે તે માટે સરકાર

૭. ક્ષમતા વર્ધન અને તાલીમ

- ૭.૧ સરકાર ખાસ કરીને સૈચિછિક સંગઠનો અને નેટવર્ક સંગઠનો દ્વારા પ્રેરિત સંસ્થાઓને એવા નવા આકાંક્ષાઓને વ્યવસ્થાપી તાલીમ આપવા માટે પ્રોત્સાહન આપશે કે જેઓ કારકિર્દી તરીકે સૈચિછિક કાર્ય અથવા સામાજિક સાહસિકતાને અપનાવવા માગતા હોય, અને તેમને સૈચિછિક સંગઠનો રચવામાં પણ મદદ કરવાનો પ્રયાસ

	કરાશે.		આચારસંહિતાઓ અને ધોરણો સ્વીકારે તે અપેક્ષિત છે.
૭.૨	સંગઠનાત્મક, સંચાલકીય અને તકનિકી કૌશલ્યો ઉભાં કરવા માટે પ્રશિક્ષણ કાર્યશાળાઓ યોજવામાં અને અન્ય સૈચિક સંગઠનોની શ્રેષ્ઠ પ્રણાલીઓનો પ્રચાર-પ્રસાર કરવા માટે સૈચિક સંગઠનોને પ્રોત્સાહન આપશે અને તેમને ટેકો આપશે.	૮.૪	પારદર્શિતામાં મહત્વનું તત્ત્વ સૈચિક સંગઠનો દ્વારા અપનાવાતાં હિસાબી ધોરણો છે. સૈચિક સંગઠનોના હિસાબોમાં બે આવશ્યક લક્ષણો પ્રતિબિંબિત થાય છે જરૂરી છે: (૧) સૈચિકતાનું પ્રમાણ. સંગઠનના સત્યો, હોકેદારો અને અગત્યના કર્મચારીઓના ખર્યથી તે માપી શકાય. (૨) સામુદ્દર્યિક ટેકાનું પ્રમાણ અને સાતત્ય. ઔપચારિક સૈચિક સંગઠનો એટલે કે અગાઉ જણાવાયેલાં વિવિધ કાયદા હેઠળ નાંધાયેલાં સંગઠનો કાયદામાં જણાવાયેલાં હિસાબી ધોરણોનું પાલન કરે તે અપેક્ષિત છે. મોટા ભાગના કિસ્સામાં પારદર્શિતાની દૃષ્ટિએ જોઈએ તો આ ધોરણો અપૂરતાં છે અને તેમનું પુનર્મૂલ્યાંકન કરવામાં આવશે અને સૈચિક ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે વિચાર-વિમર્શ કરીને તેમાં યોગ્ય સુધારા કરવામાં આવશે.
૭.૩	સ્થાનિક ક્ષમતાના નિર્માણ માટે અને પંચાયતોની ક્ષમતા વધારવા માટેની તાલીમના આયોજનમાં સૈચિક સંગઠનોને સરકાર પ્રોત્સાહન આપશે અને ટેકો આપશે.	૮.૫	સરકાર સૈચિક ક્ષેત્ર અને જાહેર વૈજ્ઞાનિક અને તકનિકી સંસ્થાઓ વચ્ચે ઉચિત ટેકનોલોજીના વ્યાપક પ્રસાર માટે સંબંધો ઉભા કરવામાં તમામ સહાય પૂરી પાડશે.
૭.૪	સરકાર સૈચિક ક્ષેત્ર અને જાહેર વૈજ્ઞાનિક અને તકનિકી સંસ્થાઓ વચ્ચે ઉચિત ટેકનોલોજીના વ્યાપક પ્રસાર માટે સંબંધો ઉભા કરવામાં તમામ સહાય પૂરી પાડશે.	૮.૬	સરકાર જાહેર સંસ્થાઓમાં કામ કરતા સ્વયંસેવકોને તેમની ક્ષમતા વધારવા માટે ઉચિત પ્રશિક્ષણ પૂર્ણ પાડશે.
૭.૫	તમામ નીતિવિષયક ચર્ચામાં ભાગીદાર થવા માટેની સૈચિક ક્ષેત્રની ક્ષમતા વધારવા નિયમિત ધોરણો વર્તમાન અને ઉપસત્તા જતા તમામ મોટા આર્થિક અને સામાજિક પ્રશ્નો વિશે તેને માહિતગાર રાખવાની વ્યવસ્થાઓ કરાશે. તમામ મહત્વનાં સરકારી મંત્રાલયો અને વિભાગોને તેમની વર્ષ દરમ્યાનની પ્રવૃત્તિઓના ભાગ તરીકે આવી માહિતગારી કાર્યશાળાઓ યોજવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે.	૮.૭	સૈચિક સંગઠનોનાં અન્ય તમામ સ્વરૂપોના કિસ્સામાં યોગ્ય હિસાબી ધોરણો વિકસાવવાં પડશે કે જે પર્યાપ્ત હોય અને વધુ પડતી માગણી કરનારાં પણ ન હોય. આવા હિસાબો સરકાર અને અન્ય જાહેર સંગઠનોને સ્વીકાર્ય બને તે માટેની કાળજી રખાવી જોઈએ. સરકાર ઇન્સ્ટિટ્યુટ એફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ભારતીય નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (કેગ) અને સૈચિક ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે વિચાર-વિમર્શ કરીને નમૂનારૂપ હિસાબી ધોરણો વિકસાવવાનો પ્રયત્ન કરશે.
૮.૧	શાસનમાં ઉત્તરદાયિત્વ અને પારદર્શિતા મહત્વના મુદ્દાઓ છે, અને સૈચિક ક્ષેત્ર આ મામલામાં ઉદાહરણો બેસાડે તે અપેક્ષિત છે. નાણાં આપનારા પ્રત્યે ઉત્તરદાયિત્વ મહત્વનું છે પણ એ પર્યાપ્ત નથી અને હિતધારકો પ્રત્યેની સામાજિક જવાબદારી ઉપર વધારે ભાર મુકાવો જોઈએ.	૮.૮	શાસનનાં અને હિસાબી ધોરણો સ્વીકારવાને માટે નાનાં અને ઓછાં સંસાધનોવાળાં સૈચિક સંગઠનોને મદદ કરવાની જોગવાઈ કરવામાં આવશે.
૮.૨	સૈચિક ક્ષેત્રમાં વિવિધ પ્રકારની સંસ્થાઓ છે તે જોતાં અને તે તમામ માટે એક જ પ્રકારનાં ધોરણો નક્કી કરવાનું ઈચ્છનીય નથી તે જોતાં, સૈચિક સંગઠનોને તેમની પોતાની આચારસંહિતા ઉભી કરવા અને શાસનનાં ધોરણો નક્કી કરવા પ્રોત્સાહન આપવામાં આવશે. તે યોગ્ય રીતે જાહેર થવાં જોઈએ અને જાહેરાત તથા અહેવાલની કાર્યવાહીઓ સાથે તેને મહામંડળો કે નેટવર્ક સંગઠનો દ્વારા પ્રસિદ્ધ અપાવી જોઈએ.	૮.૯	નેટવર્ક્સ અથવા સૈચિક સંગઠનોનાં મહામંડળો સત્યપદ માટે સૈચિક સંગઠનોની ચકાસણી અને માન્યતા અંગે આપમેળે પોતાની પદ્ધતિ વિકસાવે તે અપેક્ષિત છે. યોગ્ય રીતે કામ ન કરતાં કે સૈચિક ક્ષેત્રને બટ્ટો લગાડનારાં સૈચિક સંગઠનો પર તેઓ દેખરેખ રાખે અને તેમને શિસ્તબદ્ધ કરે એ પણ અપેક્ષિત છે.
૮.૩	તમામ સૈચિક સંગઠનો આવાં એક કે તેથી વધુ		આ ‘રાષ્ટ્રીય સૈચિક ક્ષેત્ર નીતિ-૨૦૦૩’ રાખ્ટું આર્થિક અને સામાજિક વિકસનમાં સરકાર અને સૈચિક ક્ષેત્ર વચ્ચે નૂતન ભાગીદારી ઉભી કરવાની પ્રક્રિયાનો આરંભ છે. સરકાર અને સૈચિક ક્ષેત્ર સંયુક્ત રીતે પ્રાપ્ય અનુભવો અને નહેલી સમસ્યાઓના સંદર્ભમાં સંયુક્ત રીતે આ નીતિની સમયાંતરે સમીક્ષા કરશે.

વિશ્વ સામાજિક મંચ

‘વિશ્વ સામાજિક મંચ’ના ધોરણો ગુજરાતમાં ‘ગુજરાત સામાજિક મંચ’ યોજવામાં ચક્કો ગતિમાન થયાં છે. તે સંદર્ભમાં આ લેખમાં ‘વિશ્વ સામાજિક મંચ’ શું છે અને તેના સિદ્ધાંતો કયા કયા છે તેની વિશે આપવામાં આવી છે. ‘વિશ્વ સામાજિક મંચ’ વૈશ્વિકરણ, ઉદારીકરણ અને ખાનગીકરણ તથા લશકરીકરણ દ્વારા જે નવસામ્રાજ્યવાદ ઊભો થાય છે તેની સામે લડતાં સંગઠનો અને આંદોલનોનો એક વૈશ્વિક મંચ છે તે તેના સિદ્ધાંતોમાંથી છતું થાય છે.

પ્રસ્તાવના

‘વિશ્વ સામાજિક મંચ’ (વર્લ્ડ સોશયલ ફોરમ - ડબલ્યુઅસેફ) ૨૦૦૧થી ‘વિશ્વ આર્થિક મંચ’ (વર્લ્ડ ઇકોનોમિક ફોરમ - ડબલ્યુઅસેફ)ના સામા પક્ષ તરીકે યોજાય છે. વૈશ્વિકરણ, નવ-ઉદારીકરણ અને લશકરીકરણના પરિબળમાં તથા વૈકલ્પિક વિચારો અને વ્યવહારો રજૂ કરવા માટે યોજાય છે. આ વર્ષ ૧૯થી ૨૧ જાન્યુઆરી - ૨૦૦૪ દરમ્યાન મુંબઈમાં ‘વિશ્વ સામાજિક મંચ’ મળશે. આ તેની ચોથી બેઠક હશે અને તેમાં આશરે ૭૫,૦૦૦ લોકો એકત્ર થશે એવો અંદાજ છે. ભારતનાં ઘણાં રાજ્યોમાં આવા સામાજિક મંચ હવે સક્રિય થયાં છે. દરેક રાજ્યમાં આવા સામાજિક મંચ માટે સ્થાનિક સ્તરે ‘વિશ્વ સામાજિક મંચ’ વિશેના વિચારો અંગે ચર્ચા થાય, સંકલન થાય અને વ્યૂહરચનાઓ ઘડાય તે માટે સમિતિઓની રચના કરવામાં આવી છે. ગયા વર્ષ હૈદરાબાદમાં ‘એશિયન સોશયલ ફોરમ’ (એઅસેફ) મળ્યું હતું. પ્રાદેશિક સ્તરે સામાજિક મંચ રચાય અને પ્રાદેશિક સ્વરૂપની સામાજિક, આર્થિક અને રાજીકીય સમસ્યાઓની ચર્ચા થાય તથા તેમના ઉકેલો શોધવા માટેનો પ્રયાસ થાય એ તેની પાછળનો ઉદેશ હતો.

આ સંદર્ભમાં ‘ગુજરાત સામાજિક મંચ’ શરૂ કરવા માટે સપ્તેમ્બર માસમાં બે બેઠકો યોજવામાં આવી હતી. ગ્રથમ બેઠક તા.૮-૯-૨૦૦૩ના રોજ અમદાવાદ ખાતે મળી હતી અને તેમાં ગુજરાતના ૧૨ જિલ્લાઓમાંથી ૧૩૦ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. તેમાં આદિવાસીઓ, મહિલાઓ, દલિતો અને બાળ કોની સમસ્યાઓની ચર્ચા થઈ હતી. ઉપરાંત, ગુજરાતમાંના કોમવાદ અને ધર્મજનૂની પરિબળો, પાણીનું ખાનગીકરણ, નાના ઝેડૂતોનું શોષણ, ગામડાંમાં પ્રાથમિક સવલતોનો અભાવ અને બેકારીની સમસ્યાઓ વિશે પડો ચર્ચા થઈ

હતી. ગુજરાતમાં ‘ગુજરાત સામાજિક મંચ’ આગામી ત્રણ માસ દરમ્યાન યોજાય એવી સંભાવનાઓ છે.

‘વિશ્વ સામાજિક મંચ’ના સિદ્ધાંતો

સૌ પ્રથમ ‘વિશ્વ સામાજિક મંચ’ની બેઠક ૨૫થી ૩૦ જાન્યુઆરી-૨૦૦૧ દરમ્યાન બ્રાજિલમાં પોર્ટો એલિગ્રી ખાતે યોજાઈ હતી. તે યોજવાનો વિચાર બ્રાજિલનાં સંગઠનોની એક સમિતિને આવ્યો હતો અને તેણે જ તેનું આયોજન કર્યું હતું. તેના પરિણામો અને તેણે ઊભી કરેલી અપેક્ષાઓનું મૂલ્યાંકન કરતાં તેને એમ લાગ્યું હતું કે ‘વિશ્વ સામાજિક મંચ’નું એક ‘સિદ્ધાંતોનું ખતપત્ર’ (ચાર્ટર ઓફ પ્રિન્સિપલ્સ) બનાવવું જોઈએ કે જેથી એ પ્રયાસને સતત ચાલુ રાખવા માટે માર્ગદર્શન મળતું રહે. ‘વિશ્વ સામાજિક મંચ’ જ્યારે જ્યારે મળે ત્યારે તેની પ્રક્રિયા અને તેના આયોજનમાં ભાગ લેનારા સૌઅં આ ખતપત્રમાંના સિદ્ધાંતોનું પાલન કરવું જોઈએ. પોર્ટો એલિગ્રી ખાતેની બેઠકમાં જે નિયમો લેવાયા અને તેને સફળતા જેને લીધે મળી તેને આધારે આ સિદ્ધાંતો નક્કી કરાયા છે. સાઓ પાવલો ખાતે તા.૮-૯-૨૦૦૧ના રોજની ‘વિશ્વ સામાજિક મંચ આયોજન સમિતિ’ની બેઠકમાં આ સિદ્ધાંતો ઘરી કઢાયા હતા અને પછી તા.૧૦-૯-૨૦૦૧ની ‘વર્લ્ડ સોશયલ ફોરમ ઇન્ટરનેશનલ કાઉન્સિલ’ની બેઠકમાં તે સુધારા વધારા સાથે માન્ય રખાયા હતા. આ મહત્વના સિદ્ધાંતો નીચે મુજબ છે:

- (૧) નવ-ઉદારમતવાદ અને મૂડી દ્વારા વિશ્વ ઉપર વર્ચસ્વ જમાવવાના પ્રયાસનો અને કોઈ પણ સ્વરૂપના સામ્રાજ્યવાદનો વિરોધ કરતા અને માણસજાત વચ્ચે તેમ જ માણસજાત અને પૃથ્વી વચ્ચે ફળદાયી સંબંધો વિકસાવવા માટેની દિશામાં એક ધરતી સમાજ ઊભો કરવા પ્રત્યે પ્રતિબદ્ધ એવાં નાગરિક સમાજનાં જૂથો અને આંદોલનો દ્વારા ચિંતન-મનન, વિચારોની લોકશાહી ઠબની ચર્ચા, દરખાસ્તોના ઘડતર, અનુભવોની મુક્ત આપ-દો અને અસરકારક કાર્ય માટે આંતરસંબંધો ઊભા કરવા માટે ‘વિશ્વ સામાજિક મંચ’ એક ખુલ્લું મિલન સ્થળ છે.
- (૨) પોર્ટો એલિગ્રી ખાતે મળેલી ‘વિશ્વ સામાજિક મંચ’ની પરિષદ સમય અને સ્થળની દ્વારાં સ્થાનિક કક્ષાની ઘટના હતી. હવે ‘બીજું વિશ્વ શક્ય છે’ એવી જે ધોરણા પોર્ટો એલિગ્રી ખાતે કરાઈ છે તેના સંદર્ભમાં વિકલ્પો શોધવા અને ઊભા કરવા

માટે તે એક એવી કાયમી પ્રક્રિયા બને છે કે જેને તેને ટેકો આપતી ઘટનાઓમાં જોઈ શકાય નહિ.

- (૩) ‘વિશ્વ સામાજિક મંચ’ એ એક વૈશ્વિક પ્રક્રિયા છે. આ પ્રક્રિયાના ભાગ તરીકે યોજાતી તમામ બેઠકો આંતરરાષ્ટ્રીય દાખિકોણ ધરાવે છે.
- (૪) ‘વિશ્વ સામાજિક મંચ’માં જે વિકલ્પો સુચવાયા છે તે વૈશ્વિકીકરણની પ્રક્રિયાના વિરોધમાં છે. વૈશ્વિકીકરણની પ્રક્રિયા પર મહાકાય બહુરાષ્ટ્રીય કંપનીઓ અંકુશ ધરાવે છે, અને જે સરકારો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ એ કંપનીઓનાં હિતોની સેવા કરે છે તેઓ અંકુશ ધરાવે છે અને તેમાં રાષ્ટ્રીય સરકારોની ભિલીભગત હોય છે. એ પ્રક્રિયા એ રીતે ઘડાઈ છે કે વૈશ્વિકીકરણ આ એકતા સાથે વિશ્વના ઇતિહાસમાં એક નવા તબક્કા તરીકે આવે. તેનો વિરોધ સાર્વત્રિક માનવ અધિકારોને માન આપવા માટે, તમામ રાષ્ટ્રોના તમામ નાગરિકોને માન આપવા માટે અને પર્યાવરણનું જતન કરવા માટે છે. તે એવી લોકતાંત્રિક આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાઓ અને સંસ્થાઓ પર આધાર રાખે છે કે જે સામાજિક ન્યાય, સમાનતા અને લોકોના સાર્વભૌમત્વની ચિંતા કરે છે.
- (૫) ‘વિશ્વ સામાજિક મંચ’ માત્ર નાગરિક સમાજનાં સંગઠનો અને આંદોલનોને એકત્ર કરે છે અને તેમની વચ્ચે સંબંધ સ્થાપે છે, પરંતુ તે વિશ્વના નાગરિક સમાજ નું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા થવાનો હિરાદો ધરાવતો નથી.
- (૬) ‘વિશ્વ સામાજિક મંચ’ની બેઠક ‘વિશ્વ સામાજિક મંચ’ નામની એક સંસ્થા વતી ચર્ચા-વિચારણા કરતી નથી. તેથી આ મંચની કોઈ પણ આવૃત્તિ વતી કોઈને પણ તેના તમામ સહભાગીઓનું વલણ વ્યક્ત કરવાની સત્તા અપાશે નહિ. ‘મંચ’માંના સહભાગીઓને એક સંસ્થા તરીકે નિરૂપ્યો લેવા કહેવાશે નહિ. તેવું મતદાન દ્વારા કે માન્યતા દ્વારા નહિ થાય, કાર્ય માટેની ઘોષણાઓ કે દરખાસ્તો દ્વારા પણ નહિ થાય. તેઓ બધા કે તેમાંની બહુમતીને એવી કોઈ બાબત પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવાનું કે ‘મંચ’ને એક સંસ્થા તરીકે વલણો પ્રસ્થાપિત કરવાનું કહેવાશે નહિ. એ રીતે તે સત્તાનું કેન્દ્ર નથી કે જેને વિશે તેની બેઠકોમાં સહભાગીઓ વચ્ચે વિવાદો થાય, કે પણી તેમાં ભાગ લેતાં સંગઠનો અને આંદોલનો દ્વારા કાર્ય અને આંતરસંબંધો માટેનો તે એકમાત્ર વિકલ્પ પણ નથી.
- (૭) તેમ છતાં ‘મંચ’ની બેઠકોમાં ભાગ લેતાં સંગઠનો કે સંગઠનોનાં જૂથોને આવી બેઠકો દરમ્યાન જે ઘોષણાઓ કે કાર્યો અંગે નિરૂપ્યો લેવાના હોય તેના પર ચર્ચા કરવાનો અધિકાર રહેશે, તેઓ તેમ વ્યક્તિગત રીતે કે અન્ય સહભાગીઓની સાથે

મળીને કરી શકશે. ‘વિશ્વ સામાજિક મંચ’ સંગઠનો કે સંગઠનોનાં જૂથો દ્વારા થયેલી ચર્ચાઓને આધારે લેવાયેલા નિર્ણયોનો પોતાની પાસે પ્રાપ્ત સાધનો દ્વારા ફેલાવો કરશે અને તેમાં કોઈ આદેશો નહિ આપે, શ્રેણીઓ ઊભી નહિ કરે, તેને સેન્સર નહિ કરે કે તેને નિયંત્રિત નહિ કરે.

- (૮) ‘વિશ્વ સામાજિક મંચ’ એ બહુવાદી, વિવિધીકૃત, કબૂલાત વિનાનો, બિન-સરકારી અને બિનપક્ષીય સંદર્ભ છે અને વિકેન્દ્રિત ફબે તે બીજું વિશ્વ ઊભું કરવા માટે સ્થાનિક સ્તરેથી આંતરરાષ્ટ્રીય સ્તરે નક્કર કામોમાં સામેલ સંગઠનો અને આંદોલનોનો આંતરસંબંધ પ્રસ્થાપિત કરે છે.
- (૯) ‘વિશ્વ સામાજિક મંચ’ હુમેશાં તેમાં ભાગ લેવાનો નિર્ણય કરનારા સંગઠનો અને આંદોલનોની પ્રવૃત્તિઓનાં વૈવિધ્ય અને બહુલતા પ્રત્યે મન ખુલ્લું રાખનારો મંચ છે, તેમાં વિવિધ વંશો, જાતિ, પેઢીઓ અને ભૌતિક ક્ષમતાઓના વૈવિધ્ય પ્રત્યે પણ ‘મંચ’ ખુલ્લો છે. જો કે, તેમણે ‘વિશ્વ સામાજિક મંચ’ના સિદ્ધાંતોને સ્વીકારવા પડે. ‘મંચ’માં પક્ષીય સંગઠનો કે લશકરી સંગઠનો ભાગ લેશે નહિ. આ સિદ્ધાંતોને સ્વીકારનારા સરકારી નેતાઓ અને વિધાયકોને વ્યક્તિગત ધોરણે તેમાં ભાગ લેવા માટે નિમંત્રણ આપી શકશે.
- (૧૦) ‘વિશ્વ સામાજિક મંચ’ અર્થાત્તા, વિકાસ અને ઈતિહાસ વિશેનાં તમામ સર્વસત્તાવાદી અને નિયતિવાદી મંતવ્યોનો વિરોધ કરે છે, અને રાજ્ય દ્વારા સામાજિક અંકુશના સાધન તરીકે હિસાના ઉપયોગનો પણ વિરોધ કરે છે. તે માનવ અધિકારો, ખરી લોકશાહીના વ્યવહારો, સહભાગી લોકશાહી, શાંતિપૂર્ણ સંબંધો અને લોકો, વિવિધ વંશો, જાતિઓ વચ્ચે એકતા અને સમાનતાને માન આપે છે અને એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિ પરના આધિપત્ય અને વર્ચસ્વનાં તમામ સ્વરૂપોને વખોડી કાઢે છે.
- (૧૧) ચર્ચા માટેના મંચ તરીકે ‘વિશ્વ સામાજિક મંચ’ વિચારોનું એક એવું આંદોલન છે કે જે ચિંતન પ્રેરે છે અને એ ચિંતનનાં પરિણામોનો પારદર્શી ફેલાવો કરવા પ્રેરે છે. મૂડી દ્વારા વર્ચસ્વ જ માવવાની રીતો અને વ્યવસ્થાઓ, એ વર્ચસ્વનો પ્રતિકાર કરવાના અને તેને તોડવાના કાર્યો અને સાધનો અને બાદબાકી તથા સામાજિક અસમાનતાની સમસ્યાઓ ઉકેલવા માટેના વિકલ્પો વિશે ચિંતન થશે. આવી બાદબાકી અને સામાજિક અસમાનતાની આ પ્રક્રિયા મૂડીવાદી વૈશ્વિકીકરણી પ્રક્રિયા છે કે જે જાતિવાદી, વંશવાદી અને પર્યાવરણનો વિનાશ કરનારી છે અને આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે એ પ્રક્રિયા ચાલે છે.

- (૧૨) અનુભવોની આપલેના માળખા તરીકે ‘વિશ્વ સામાજિક મંચ’ તેનાં સહભાગી સંગઠનો અને આંદોલનો વચ્ચે સમજ ઊભી થાય અને પારસ્પરિક માન્યતા પ્રાપ્ત થાય તેને પ્રોત્સાહન આપે છે. અને તેમની વચ્ચેની આપલેને ખાસ મહત્વની બાબત ગણે છે. લોકોની જરૂરિયાતોને પહોંચી વળવા માટેની આર્થિક પ્રવૃત્તિ અને રાજકીય પગલાં અને વર્તમાનમાં તથા ભાવિ પેઢીઓ માટે પ્રકૃતિને આદર આપવાની બાબતનાં પ્રવૃત્તિઓ અને પગલાં વિશે આ સમજ વિકસે તે અગત્યનું છે.
- (૧૩) આંતરસંબંધોના સંદર્ભ તરીકે ‘વિશ્વ સામાજિક મંચ’ સમાજનાં સંગઠનો અને આંદોલનો વચ્ચે જાહેર અને ખાનગી બંને જીવનમાં નવા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંબંધો ઊભા થાય અને મજબૂત થાય તેમ ઈચ્છા છે. તે વિશ્વને અમાનવીય બનાવવાની જે પ્રક્રિયા ચાલી રહી છે તેનો અહિસક સામાજિક પ્રતિકાર કરવાની ક્ષમતા વધારશે અને આ આંદોલનો અને
- સંગઠનોનાં કાર્યો દ્વારા જે માનવતાને મજબૂત કરનારાં પગલાં લેવાઈ રહ્યા છે તેને દૃઢ કરશે.
- (૧૪) ‘વિશ્વ સામાજિક મંચ’ એક એવી પ્રક્રિયા છે કે તે તેનાં સહભાગી સંગઠનો અને આંદોલનોને તેમનાં કાર્યો સ્થાનિક સ્તરેથી રાષ્ટ્રીય સ્તરે વિકસાવવામાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય ભાગીદારી પ્રાપ્ત કરવામાં પ્રોત્સાહન આપે છે. કારણ કે તેમનાં કાર્યો સમગ્ર દુનિયાના નાગરિકોના પ્રશ્નો હોય છે. ઐક્ય સાધીને નવા વિશ્વનું નિર્માણ કરવામાં તેમના પ્રયોગો પરિવર્તન લાવવા માટે હોય છે અને વૈશ્વિક કાર્યસૂચિયાં તેમનો સમાવેશ થાય તે માટે ‘મંચ’ પ્રોત્સાહન આપે છે. વધુ માહિતી માટે આ સરનામે સંપર્ક સાધી શકો છો. ‘ગુજરાત સોશ્યલ ફોરમ’, પોસ્ટ બોક્સ-૪૦૮૮, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦ ૦૦૮. ફોન: ૦૭૯-૭૮૧૦૫૪૮. ફેક્સ: ૦૭૯-૭૮૧૧૧૮૧, ઈમેલ: gujsofo@yahoo.com

પૃષ્ઠ ૭નું શેખ

આરોગ્ય અને ગૌરવપૂર્ણ જીવન માટે કે તે સ્વાવલંબી બને તે માટે રોકાણ કરવું એ વધારે માનવીય બાબત છે અને વાસ્તવવાદી છે. તેથી સગર્ભા માતા અને તેની ભાવિ દીકરી પ્રત્યે ઘાતકી વર્તન ના કરવું જોઈએ. તાજેતરમાં લગ્ન સમયે જ નવોઢાએ પોતાના ભાવિ પતિની દહેજ માગવા બદલ ધરપકડ કરાવી હોય એવા ઘણા કિસ્સા બન્યા છે. એ પ્રોત્સાહક છે અને છોકરીઓ શક્તિમાન બની રહી છે તેનો પુરાવો છે. દહેજની આવી સત્તામણીના ડિસ્સાને માધ્યમોએ વ્યાપક પ્રસિદ્ધ આપતાં યુવાન સ્ત્રીઓ વધારે શક્તિમાન બની છે. તેઓ પોતે બીજાઓ માટે ઉદાહરણરૂપ બની છે. આથી આપણો તો ‘જાતિ નિર્ધારણ’ના જોઈએ ‘અન્યાય દૂર કરો, સ્ત્રીઓને નહિ’ જેવાં સૂત્રો જ ગજવવાં જોઈએ.

‘એક માતાનું સ્થાન લે એક દીકરી’ એવું જે સૂત્ર ચલાવાય છે તેને વિશે પણ સમગ્ર દેશમાં તાત્ત્વિક અને તબીબી ધોરણે ચર્ચા થવી જોઈએ. વસ્તી નિયંત્રણાની ટેકનોલોજી સ્ત્રીઓની સુરક્ષાને બદલે બાળકોનાં જન્મ ટાળવાની પદ્ધતિની કાર્યક્ષમતા ઉપર વધારે ધ્યાન ડેન્નિત કરે છે. તેની આડઅસરોના ભોગ પણ સ્ત્રીઓએ બનવું પડે છે. નવી પ્રજનન તકનિકી ડોક્ટરોના અંકુશ હેઠળ છે, સ્ત્રીઓના અંકુશ હેઠળ નથી. તેથી મહિલા જૂથો વારંવાર એમ જણાવે છે કે આ ટેકનોલોજી મૂળભૂત રીતે જ સ્ત્રી-વિરોધી છે. સર્વોચ્ચ અદાલતમાં જે જાહેર હિતની અરજી ‘સિલેટ’ અને ‘માસ્કુમ’ દ્વારા કરાઈ હતી તેમાં જાતિ પસંદગીની

પદ્ધતિઓનો સમાવેશ પણ જીવનના કાયદામાં થાય અને કાયદાનો અસરકારક અમલ થાય એવી માગણી કરાઈ હતી. આ માગણી સ્વીકારાઈ એટલું જ નહિ, પણ અસરકારક અમલ માટેના નિયમો પણ ઘડાયા. રાજ્ય સરકારો ખાનગી અને સરકારી ડોક્ટરો માટે આ અંગે જાગૃતિ લાવવા પરિસંવાદો યોજી રહી છે. મહિલાઓને ન્યાય, તબીબી નૈતિકતા અને માનવ અધિકારો પ્રત્યે પણ વિજ્ઞાનની જવાબદારી છે એમ પણ તેમાં કહેવામાં આવે છે.


ગર્ભપાતના વિરોધનું વલણ અને મહિલાઓને ન્યાયનું વલણ અલગ અલગ છે એ પણ સમજવું જોઈએ. સ્ત્રીઓને તેમના શરીર પર અધિકાર હોવો જોઈએ અને ગર્ભપાત કરાવવાની પસંદગી તેમની હોવી જોઈએ. પણ જાતિ નિર્ધારણ અને જાતિ પસંદગીના આધારે થતા ગર્ભપાતની અનૈતિકતા એ અધિકાર સાથે સંઘર્ષ ઊભી કરે છે. ગર્ભપાત પોતે અનૈતિક નથી, પણ જાતિ પસંદગી માટે થતો ગર્ભપાત અનૈતિક છે. આમ, આપણી સામે ઝૂબ મોટો પડકાર ડોક્ટરો અને દર્દીઓના માનસ પરિવર્તનો છે, એવું સામાજિક અને સાંસ્કૃતિક વાતાવરણ ખાંડું કરવાનો છે કે જેમાં છોકરીઓનું અસ્તિત્વ શક્ય બને અને સ્ત્રીઓ પ્રત્યેના પૂર્વગણોથી પીડિત એવા વેપારી દિમાગ ધરાવતા ડોક્ટરોની પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખી શકાય. તો જ આપણે ‘લાપતા છોકરીઓ’ની ઘટનામાં પરિણામતા ઘટતા જતા જાતિ પ્રમાણની પ્રક્રિયાને ખાળવામાં સફળ થઈશું.

અવરોધ-મુક્ત પર્યાવરણ: વિકલાંગોના સામાજિક સમાવેશની વ્યવસ્થા

વિકલાંગ લોકોના સામાજિક સમાવેશ માટે નાગરિક સમાજની ભાગીદારી વધારવાનો પ્રયાસ ‘ઉન્નતિ’ અને ‘હેન્ડિકેપ ઇન્ટરનેશનલ’ દ્વારા ગુજરાતની અનેક સહભાગી સંસ્થાઓના સહયોગમાં કરવામાં આવી રહ્યો છે. તેની મુખ્ય વ્યૂહરચનામાં ક્ષમતા વર્ધન, સાધનસામગ્રીનો વિકાસ અને વહેંચણી, નેટવર્કિંગ, ભાગીદારીનું નિર્માણ અને હિમાયતનો સમાવેશ થાય છે. આ પ્રયાસમાં વિકલાંગોના સામાજિક સમાવેશ માટેનો એક અગત્યનો પ્રશ્ન ‘પહોંચ’ જણાયો છે. ૨૦૦૭ના આર્થભમાં આ મુદ્દે કામ કરવાના પ્રયાસો શરૂ થયા છે. આ લેખ સુશ્રી ગીતા શર્મા, સુશ્રી અર્યાના શ્રીવાસ્તવ અને શ્રી અરિંદમ મિત્રા દ્વારા લખાયો છે અને તેમાં છેલ્ખા ૧૧ માસના અનુભવો જણાવાયા છે.

પ્રસ્તાવના

“વિકલાંગતા એવી કોઈક ચીજ નથી કે જે તમે ધરાવો છો, પણ તે એક એવી બાબત છે કે જે પોતાની જીવનશૈલી માટે જ દુનિયાને ઘડનારા અમુક લોકો દ્વારા અવરોધો ઉભા કરે છે.” હવે આજે વધુ ને વધુ એમ માનવામાં આવી રહ્યું છે કે આપણી ભૌતિક ચીજોની ડિજાઇનમાં જ અવરોધો છે અને આપણે ટેકનોલોજી અને માહિતીની વ્યવસ્થા જે રીતે ઘડીએ છીએ તેમાં જ વિવિધ અવરોધો અસ્તિત્વ ધરાવે છે. અહીં ભૌતિક અવરોધો વિશે વાત કરવામાં આવી છે અને વિકલાંગો આસાનીથી સલામત રીતે હરીફરી શકે તેવું પહોંચવાનું



પર્યાવરણ ઉભું કરવાની બાબત ચર્ચામાં આવી છે.

સામાન્યતયા લોકો માને છે તેનાથી તદ્દન વિરદ્ધ, અવરોધ-મુક્ત પર્યાવરણ વિકલાંગ લોકો ઉપરાંત પણ સમાજના ઘણા લોકો માટે લાભદારી બને છે. ખાસ કરીને, જે મને કામચલાઉ રીતે ટેકાની જરૂર પડે છે તેવાં વૃદ્ધો, સગર્ભી સ્ત્રીઓ, બાળકો અને કામચલાઉ આપંગતા ધરાવતા લોકોને આવા અવરોધ-મુક્ત પર્યાવરણનો લાભ મળે છે. આ તમામ લોકોમાં વિકલાંગોને સૌથી વધુ સહન કરવાનું આવે છે કારણ કે ડિજાઇન ઘડનારાઓએ અવરોધ-મુક્ત પર્યાવરણ માટેની તેમની જરૂરિયાતો જાણવા અને સમજવા માટે તેમને ખૂબ ઓછી તકો પૂરી પાડી હોય છે. વિકલાંગો માટે ભૌતિક અવરોધો ઘણાં અગત્યનાં પરિબળોમાંનું એક એવું પરિબળ છે કે જે સમાજમાંથી તેમની બાદબાકી અથવા તો તેમને અલગ પાડવા તરફ દોરી જાય છે. તેમની અને સમાજ વચ્ચે સંવાદનો અભાવ હોય છે તેથી તેમની સુષ્પુત્ર શક્તિઓને પિછાણવામાં આવતી નથી, તેમની જરૂરિયાતો અને આકંશાઓને ઓળખવામાં આવતી નથી અને તેથી તેમના સામાજિક સમાવેશના અધિકાર વિશે બહુ જ ઓછી સંવેદનશીલતા પ્રવર્તે છે.

દુનિયાના અન્ય ભાગોની જે ભારતમાં પણ વિકલાંગોના પુનર્વસન માટેના તબીબી અને કલ્યાણલક્ષી મોડેલને સ્થાને સામાજિક મોડેલ પર ભાર મુકાઈ રહ્યો છે અને તેમાં વિકલાંગોના સામાજિક સમાવેશને એક જરૂરિયાતને બદલે માનવ અધિકાર તરીકે જોવામાં આવે છે. વિકલાંગોના સામાજિક સમાવેશ માટે તેમને સમાન તકો પૂરી પાડવી અને સંપૂર્ણ સહભાગિતા માટેની તકો પૂરી પાડવી ખૂબ જ મહત્વની બાબત છે. જો પર્યાવરણ અવરોધમુક્ત અને પહોંચ ધરાવતું ના હોય તો વિધાયક ભેદભાવ ઉભા કરવા માટેનાં પગલાં ધાર્યું પરિણામ આપી શકે નહિએ.

વિકલાંગોની પહોંચ વધારવાને પ્રોત્સાહન આપીને તેમના સામાજિક સમાવેશ માટે ભારતમાં લોવાયાં પગલાંની આપણો સૌથી મુશ્કેલી સમીક્ષા કરીએ. કાનૂની મોરચે અને અમલની બાબતમાં જે કેટલાક પ્રયાસો કરાયા છે તે નીચે મુજબ છે:

- (૧) વિકલાંગ વ્યક્તિઓ (સમાન તકો, અધિકારોના રક્ષણ અને સંપૂર્ણ સહભાગિતા) ધારો ૧૯૮૫માં ભારતની સંસદે પસાર

- કર્યો. વિકલાંગ વ્યક્તિઓના સામાજિક સમાવેશ અને સંકલનના બે હેતુઓ તેમાં રહેલા છે. તેમાં વિકલાંગ વ્યક્તિઓ માટે પહોંચપાત્ર વાતાવરણ ઊભું કરવા માટેનાં મહત્વ, જરૂરિયાત અને પગલાં વિશે વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિકલાંગ લોકોનાં શિક્ષણ અને રોજગારી માટે અનામતની જોગવાઈ તેમાં કરાઈ છે. તે ઉપરાંત, તે રાજ્ય સરકારોને મકાનો અને અન્ય સ્થળોએ વિકલાંગોની પહોંચ વધે તે માટે યોગ્ય જોગવાઈઓ કરવા માટે અરજ કરે છે. ધારાના પ્રકરણ-૮ની કલમ-૪૮થી ૪૯માં વિકલાંગ વ્યક્તિઓ પ્રત્યે પરિવહનની સવલતો, રસ્તા, ફૂટપાથ અને મકાનોમાં ભેદભાવ ના રહે તે માટે વિધાયક પગલાં લેવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
- (૨) એશિયા-પ્રશાંત પ્રદેશ માટે ‘એસ્કેપ’ દ્વારા વિકલાંગો માટે ૧૯૯૭-૨૦૦૨ના દાયકાની કરાયેલી જાહેરાતમાં ભારતે સહી કરી હતી. તેથી અવરોધ-મુક્ત વાતાવરણ ઊભું કરવામાં પ્રોત્સાહન પૂરું પાડવામાં અને પ્રતિબદ્ધતા ઊભી કરવામાં સહાય મળી છે.
- (૩) કેન્દ્ર સ્તરે અને કેટલાંક રાજ્યોમાં કેટલીક પરિયોજનાઓ શરૂ કરાઈ છે અને એવા કેટલાક પ્રયાસો કરાયા છે કે જેનાથી આવા અવરોધ-મુક્ત પર્યાવરણના લાભો દર્શાવી શકાયા છે.
- (૪) કેન્દ્રીય જાહેર બાંધકામ વિભાગ દ્વારા માર્ગરિખાઓ તૈયાર કરવામાં આવી છે. તેમાં અવરોધ-મુક્ત પર્યાવરણ ઊભું થાય તે માટે બાંધકામ અંગોની વિગતો નક્કી કરવામાં આવી છે. ‘રાષ્ટ્રીય બાંધકામ સંહિતા’ (નેશનલ બીલ્ડિંગ કોડ) પણ આ પ્રકારની જોગવાઈઓ કરે છે.
- (૫) બાંધકામ અંગોના પેટા કાયદાઓ વિવિધ શહેરોમાં લાગુ પડે છે. કેટલાંક રાજ્યોએ કેન્દ્રના શહેરી વિકસ મંત્રાલયે આવા જે નમૂનારૂપ પેટા કાયદા તૈયાર કર્યા છે તેમનો સમાવેશ પોતાના પેટા કાયદાઓમાં કર્યો છે. તેમાં અપંગ વ્યક્તિઓને સવલતો પૂરી પાડવાની જોગવાઈ છે. જો કે, તેમનો અમલ હજુ નિષ્ઠાપૂર્વક થયો નથી.

એ નોંધવું રસપદ છે કે કમ-સે-કમ વિકલાંગોની પહોંચ એક જરૂરિયાત તરીકે પિછાણવામાં આવી છે અને તેને માન્ય રાખવામાં આવી છે અને તેને હવે શું કરવાની જરૂર છે અને કેવી રીતે તે થઈ શકે તેને વિશે માહિતી પ્રાપ્ય છે. વળી, કેટલાક અનુભવો એમ પણ દર્શાવે છે કે ખર્ચ, વિકલાંગોને જ લાભદાયી એવી કેટલીક ડિઝાઇન વગેરે અંગે જે ભ્રમો પ્રવર્તતા હતા તે ખોટા છે. સ્થાનિક અનુભવો અને ફુનિયાભરના ડિઝાઇનરોના અનુભવોને આધારે નીચે મુજબની કેટલીક બાબતો શીખવા મળે છે:

- (૧) બાંધકામની ડિઝાઇન એવી જોઈએ કે જે સામાન્ય વ્યક્તિઓ અને વિકલાંગ વ્યક્તિઓ બંને માટે ઉપયોગી હોય. ડિઝાઇન બેમાંથી કોઈ એક માટે ન થવી જોઈએ, તે સૌને માટે હોવી જોઈએ.
- (૨) વિકલાંગોનો સામાજિક સમાવેશ કરનારી ડિઝાઇન કે સ્થાપત્ય વિકલાંગોને અન્ય લોકો સાથે એક કરનારી હોય, તેમને અલગ કરનારી ન હોય. તેના માપદંડો છે: સગવડતા, સુરક્ષા અને તે પોસાય તેવી હોય.
- (૩) જેમાં સૌ પહોંચી શકે તેવા પર્યાવરણામાં તમામ વ્યક્તિઓ માન-સન્માન, ગૌરવ અને સુખ સાથે સ્વતંત્ર રીતે જીવી શકે છે અને કામ કરી શકે છે. અને તેથી અવરોધોવાળું વાતાવરણ જે ‘ક્ષમતા’ અને ‘અસંક્ષમતા’ વચ્ચે કૃતિમ ભેદ ઊભો કરે છે તે દૂર થઈ જાય છે.
- (૪) વિકલાંગો માટે જે પર્યાવરણાની જરૂર હોય છે તેમાંનાં મોટા ભાગનાં લક્ષ્યજો થોડાંક જુદાં અને સંવદેનશીલતા ધરાવતાં હોય છે. ખાસ કરીને આયોજનના તબક્કે જો તેમનો સમાવેશ કરવામાં આવે તો એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં મોટું ખર્ચ થાય જ એવું જરૂરી નથી.

જીવનમાં ક્યારેક ને ક્યારેક આપણામાંના મોટા ભાગના લોકોએ અથવા તો કોઈ નજીકના સગા કે મિત્રના સંદર્ભમાં કોઈ સ્થાને પહોંચી શકતું ન હોવાની સમસ્યાનો અનુભવ તો કર્યો જ હોય છે. તેમ છતાં ડિઝાઇનરો, સ્થપતિઓ, આયોજકો, નીતિ નિર્ધારકો, વિદ્વાનો કે સંશોધકો એ મુદ્દાને પૂરતી પ્રાથમિકતા આપતા નથી. જે મને અવરોધોનો કાયમ માટે કે હંગામી ધોરણે અનુભવ કરવો પડે છે તેઓ પણ તેમની સમસ્યાઓ વિશે પૂરતો અવાજ ઉઠાવતા નથી કે જેથી આ સમસ્યાને યોગ્ય પ્રાથમિકતા પ્રાપ્ત થાય.

અત્યાર સુધીમાં મોટા ભાગની ડિઝાઇનો વિકલાંગોની બાદબાકી કરનારી છે અને વિકલાંગોની પહોંચની જરૂરિયાત પ્રત્યે તેમાં ધ્યાન અપાયું નથી તે દૃષ્ટિએ ભાવ કાર્ય ઘણું જ પડકારજનક અને પ્રચંડ છે. ઉપરોક્ત સંદર્ભમાં ગુજરાતમાં જે પ્રયાસ કરવામાં આવ્યો તેમાં વિવિધ સ્તરે જાગૃતિ ઊભી કરવા માટે બહુપાંખી વ્યુહરચનાનો ઉપયોગ કરવાનો અને અવરોધ-મુક્ત પર્યાવરણ ઊભું કરવા માટે સામૂહિક કાર્ય કરવાનો સમાવેશ થતો હતો. તેમાં નીચેની બાબતોનો સમાવેશ કરાયો:

જગૃતિ લાવવી

જાહેર પ્રસંગ

આ પ્રસંગ અમદાવાદમાં લો ગાર્ડન ખાતે તા-૨૦-૩-૨૦૦૩ના રોજ



યોજવામાં આવ્યો. બગીચાના આ સ્થળની મુલાકાત સંખ્યાબંધ લોકો વારંવાર લેતા હોય છે. વિકલાંગતાના વિવિધ પ્રકારોના પ્રશ્ને કામ કરતાં સંગઠનો, વિકાસલક્ષી સંગઠનો, સરકારી સંસ્થાઓ, વ્યવસાયીઓ અને સંબંધિત નાગરિકોની આ એક બેઠક હતી. તેનો હેતુ અવરોધમુક્ત પર્યાવરણ ઊભું કરવા માટેની જરૂરિયાત વિશે સહાનતા લાવવાનો હતો. તેમાં લગભગ ૨૫૦ જણા હજર રહ્યા હતા. મુખ્ય પ્રવાહના સ્થાનિક અખભારો અને ટીવી મારફતે લગભગ એકાડ લાખ લોકો સુધી આ સંદેશો પહોંચ્યો હતો.


માધ્યમોની સંવેદનશીલતા ઊભી કરવી

'ટેલિપરેન્ટ મિડિયા નેટવર્ક' સાથેના સહયોગમાં વિવિધ જિલ્લાઓના મુદ્રિત અને વીજાણુ માધ્યમોના પત્રકારો સાથે વિકલાંગતા અને વિકાસના પ્રશ્ને વાતરીત કરવામાં આવી અને વિકલાંગ લોકોના માનવ અધિકારો તથા તેમના સામાજિક સમાવેશના દૃષ્ટિ કોણથી પહોંચના પ્રશ્ન વિશે સંવાદ થયો. તેને પરિણામે વિકલાંગતા એ પણ વિકાસનો એક અગત્યનો અને આસાનીથી ઉકલી શકે તેવો પ્રશ્ન છે તેમ દર્શાવતા અનેક લેખો વિવિધ સામગ્રીકો અને અખભારોમાં પ્રકાશિત થયા. વળી, વિકલાંગો વિશે વિધાયક છાપ ઊભી થાય તેવા અને સંસ્થાઓની કામગીરીની રજૂઆત કરતા અનેક લેખો પણ પ્રસિદ્ધ થયા.

ભાગીદારીનું નિર્માણ

જગૃતિ લાવવાની પ્રક્રિયામાં જ તમામ હિતધારકોનું એક જુથ હોય એની જરૂરિયાત અનુભવાઈ. તેમ જ વિવિધ જુથો અવરોધમુક્ત પર્યાવરણ ઊભું કરવા તેમની ભૂમિકા સમજે, તેને વિશે ચિંતન-મનન કરે અને વ્યૂહરચના ઘડી કાઢે તેવી જરૂરિયાત પણ અનુભવાઈ. જુલાઈ-૨૦૦૩માં તેથી 'રિસોર્સ ગ્રૂપ ઓન એક્સેસિબિલિટી' સાથેના સહયોગમાં અનેક નાની નાની કાર્યશાળાઓ યોજવામાં આવી. સેવા ઉદ્યોગ, વિદ્યાકીય સંસ્થાઓ, બિન-સરકારી સંગઠનો, માધ્યમો, સ્થપતિઓ, આયોજ કો અને ડિઝાઇનરોઓ તેમાં ભાગ લીધો હતો.

આશરે ૪૦૦ વ્યક્તિઓ અને જુથોએ તેમાં ભાગ લીધો અને વિકલાંગોની જરૂરિયાતો પિછાડી, સંભવિત ભાવિ વ્યૂહરચનાઓ વિશે વિચાર્યુ અને આ મુદ્રાને પ્રસિદ્ધ આપી અને આશરે બેલાખ લોકો સુધી એનો સંદેશો પહોંચ્યો. તે પછી સંશોધન અને તપાસ-આધારિત અહેવાલો સતત પ્રસિદ્ધ થતા રહ્યા છે.



સામગ્રીની તૈયારી અને પ્રચાર-પ્રસાર

જગૃતિ અને સંવેદનશીલતા ઊભાં કરવાની પ્રક્રિયા દરમાન સામગ્રીની તુલના, વિકાસ અને પ્રસાર-પ્રચારની જરૂરિયાત ધ્યાનમાં આવી. બધી સામગ્રીને એક્સાથે મૂકવાથી વિવિધ જુથો અને વ્યક્તિઓ સુધી પહોંચવાની તકો વધી ગઈ. વિકલાંગો તમામ સ્થાનોએ પહોંચી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ અને સામગ્રીઓ કેટલી છે અને તેમની શી મર્યાદાઓ છે તેને વિશે ટુકડીની જગૃતિ વધી. ઉપરાંત, પ્રયાસો અને વ્યૂહરચનાઓ વિશેની માહિતી, રસ ધરાવતી વ્યક્તિઓ અને જુથોની ઓળખ, સમાન ધ્યેય માટે સંબંધો ઊભા કરવા અને એકતા ઊભી કરવી વગેરેની તકો પણ વધી. બાંધકામના પેટા કાયદાઓ, માગરિખાઓ, દશ્ય-શ્રાવ્ય સાધનો, લેખો અને વાચન સામગ્રી વગેરે પણ આ પ્રક્રિયાના ભાગરૂપે એકત્ર કરાયા. સામગ્રી તૈયાર કરવામાં



આવી તેથી દૃષ્ટિકોણ વધારે વ્યાપક બન્યો, સભાનતા વધી અને સામેલ દુક્કિની જ નહિ પણ બીજા ઘણા બધાની સંવેદનશીલતામાં વધારો થયો. ફોટો પ્રદર્શન રખાયું અને જગ્યાતિ માટે પરિપત્રો તથા અહેવાલો તૈયાર કરવામાં આવ્યા. જે સાહિત્ય અને સામગ્રી તૈયાર કરવામાં આવી તે ખૂબ જ સમૃદ્ધ બની અને પ્રચાર-પ્રસાર માટે અને નવા લોકો સુધી પહોંચવા માટે તેનો ઉપયોગ એક સાધન તરીકે કરાયો.

નેટવર્કિંગ, સંબંધો અને સંસાધનોના ભંડારનું નિર્માણ
વક્તિઓ અને સંગઠનો વચ્ચે સંબંધો ઊભા કરવા અને નેટવર્કિંગ ઊભું કરવા માટે અને તેનાં ધ્યેયો સિદ્ધ કરવા માટે માહિતીની આપંલે અને વ્યૂહાત્મક વિચારણા પૂર્વશરતો છે. વિવિધ વ્યવસાયોના વિવિધ હિતધારકો એક સંસાધન ભંડાર રચવા માટે એકત્ર થયા છે. શહેરમાં અને જિલ્લા સ્તરે વિકલાંગો માટે પહોંચ ઊભી કરવા માટે આ સંસાધન ભંડાર ઊભો કરાયો છે. બિન-સરકારી સંગઠનો અને વિકલાંગો સાથે સહયોગ સાધવા સ્થપતિઓ અને ડિઝાઇનરોના જૂથ માટેની જરૂરિયાત વિવિધ ચર્ચાઓ દરમ્યાન જણાઈ હતી. તેને પરિણામે જ આ જૂથોની રચના થઈ. વપરાશકાર પોતાનો દૃષ્ટિકોણ જણાવે અને સમાજમાં સાથે સાથે સભાનતા પણ ઊભી થાય તે માટે આમ કરવામાં આવ્યું.

આ સંસાધન ભંડારને જરૂરિયાત-આધારિત સામગ્રી વિકસાવવા માટે અને તેની વ્યૂહરચના ઘડવા માટેનું કામ કરવાનું છે. તે તકનિકી તાલીમ દ્વારા ક્ષમતા નિર્માણ પણ કરે છે, માહિતી બેંક ઊભી કરે છે, હેલ્પ લાઈન ચલાવે છે અને નીતિ વિષયક ફેરફારો માટે હિતમાયત પણ કરે છે. આ જૂથ ઊભું થતું જાય છે. તે તરવરિયું છે અને વારંવાર મળે છે. તે વિવિધ હિતધારકોની ભૂમિકા નક્કી કરે છે, વ્યૂહાત્મક આયોજન કરે છે, જવાબદીઓ વહેંચે છે અને અનુવર્ત્તી કાર્ય પણ કરે છે.

હિમાયત

કોઈ એક ગ્રશે હિમાયત (એડવોકરી) કરવી એ સતત ચાલતી ગ્રહિયા છે અને તેમાં અનેક વ્યૂહરચનાઓનો ઉપયોગ થાય છે. વિકલાંગતાના ગ્રશે હિમાયત કરવા માટે જે વિવિધ પ્રયાસો કરવામાં આવ્યા તેની વિગતો અહીં આપવામાં આવી છે. આ અંગેની વ્યૂહરચનાઓ નીચે મુજબ છે:

(૧) માધ્યમોમાં હિમાયત:

વિવિધ કાર્યક્રમો અને પ્રસંગો દ્વારા લોકો સુધી પહોંચવું અને આખા ગ્રશનાને સતત જીવંત રાખવો.

(૨) પહોંચનું અન્વેષણા:

જીલ્લા ત્રણ માસ દરમ્યાન પહોંચનું અન્વેષણ કરાયું, અહેવાલો તૈયાર કરાયા અને નિર્દર્શન કરાયું. અને તે બધાનાં ઘણાં વિધાયક પરિણામો આવ્યાં. ઓફિસો, મકાનો, જાહેર જગ્યાઓ વગેરે સહેજસાજ સુધારા કરાય તો વિકલાંગો માટે અનુકૂળ બની જાય તે દર્શાવાયું. વળી, નવા મકાનો અને જાહેર સ્થળોએ એ બાબતનું ધ્યાન રખાય તેનું પણ નિર્દર્શન કરાયું. એ માટેના નમૂના પણ તૈયાર કરાયા. સંબંધિત સરકારી સત્તાવાળાઓ અને નાગરિક સમાજ સમક્ષ એ જ અહેવાલો હિતમાયતના સાધન તરીકે રજૂ થયા. આ માટે શહેરમાં બે ડિ.મી.ની ત્રિજયાના વિસ્તારમાં સૌથી વધુ દરમ્યાન અને સૌથી વધુ ઉપયોગી એવા વિસ્તારની પસંદગી કરવામાં આવશે, અને તેમાં અન્વેષણ હાથ ધરાશે અને વપરાશકાર અને ડિઝાઇનર જૂથને તે સુધારાઓ દર્શાવાશે.

(૩) અન્ય:

લોબીંગ માટે અને નીતિઓમાં ફેરફાર થાય અને અસરકારક અમલ થાય તે માટે બાંધકામના પેટા કાયદા, તકનિકી સામગ્રી અને ૧૯૮૫ના કાયદાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ઉપસંહાર

આ સમગ્ર ગ્રહિયા દરમ્યાન નક્કર અને નિશ્ચિત પગલાં ભરાયાં છે અને તેમાં ઘણાં ઉત્તેજના અને આનંદ રહ્યાં છે. વિવિધ લોકો તરફથી જે પ્રતિભાવ મળ્યો છે તે ખૂબ જ પ્રોત્સાહક રહ્યો છે અને શું કરવાની જરૂર છે તેનું માર્ગદર્શન પણ તેમાંથી પ્રાપ્ત થયું છે. સંદેશાનો પ્રચાર કરવાનું મુશ્કેલ નથી. કોણ તેનો પ્રચાર-પ્રસાર કરે છે અને કેવી રીતે કરે છે એ વધારે મહત્વાનું છે.

વિધાયક વિચારણા અને કાર્યો માટે પૂરતા પ્રમાણમાં પ્રોત્સાહન અપાયું છે. ભવિષ્યની ચિંતાજ નક બાબતો વિશે વિચારવાની જરૂરિયાત પણ જૂથને સમજાઈ છે અને તેમને વિશે વિશે વિચારવાનો પ્રયત્ન પણ તેણે કર્યો છે. એમાંના કેટલાક પ્રશ્નો તો આ જૂથ ટકાઉ બને તેને અંગેના જ હતા. તેમાં સંવાદિતા જળવાય, માન-આદર જળવાય, સામેલ વ્યવસાયીઓની વિશ્વસનીયતા અને ભૂમિકા જળવાય અને પર્યાપ્ત માત્રામાં નાણાકીય ટેકો ઊભો થાય વગેરે બાબતો પણ તેમાં ચર્ચાઈ. આગામી દિવસો દરમ્યાન જ્યાં કામગીરી અત્યારે ચાલુ છે ત્યાં કામ વધુ મજબૂત બને અને સંધન બને તે માટે વધુ પ્રયાસો કરવામાં આવશે. તેમાં મુખ્ય બાબત એ ધ્યાનમાં રખાશે કે સૌને ગૌરવપૂર્વી જીવન જીવવા સમાન તકો મળે, સૌસહભાગી થાય અને પાયાના અધિકારો મળે તેવું વાતાવરણ ઊભું થાય.

સંપ્રતિ પ્રવાહ

જૈવ પંચાયત અધિવેશન

‘નવદાન્ય’ અને ‘રિસર્વ ફાઉન્ડેશન ફોર સાયન્સ, ટેકનોલોજી એન્ડ ઇકોલોજી’ દ્વારા નવી ડિલ્લી ખાતે તા. ૧૭-૧૮ નવેમ્બર, ૨૦૦૩ દરમ્યાન આ અધિવેશનનું આયોજન કરાયું હતું. ‘જૈવ પંચાયત’ પાંચમી જુન-૧૯૮૮ના રોજ વિશ્વ પર્યાવરણ દિને શરૂ થઈ હતી. તેનો આરંભ ગઢવાલ પ્રદેશના રૂપ્રપ્રયાગ જિલ્લામાં અગસ્ત્યમુની ગામે થયો હતો. તે સમયે તેમાં ૨૦૦ ગામો જોડાયાં હતાં. આજે દેશભરનાં ૪૦૦૦ ગામો આ આંદોલનમાં જોડાયાં છે. જીથી, જીમાન અને અન્ન સંબંધી પ્રશ્નોના સંદર્ભમાં આ આંદોલન કામ કરે છે. જ્યાં જ્યાં ‘જૈવ પંચાયત’ નું આંદોલન ચાલે છે ત્યાં ત્યાં પાણીનું ખાનગીકરણ, જનીન ઈજનેરી ધરાવતા પાકનું વાવેતર, જૈવ ચોરી અને બૌદ્ધિક ભિલકત અધિકારોની વ્યવસ્થાનો અમલ લગભગ અશક્ય બની ગયો છે. લોકોના જીવન જીવવાના અને જીવનનિર્વાહના અધિકારનું રક્ષણ કરવાનું કામ ‘જૈવ પંચાયત’ દ્વારા થાય છે.

‘જૈવ પંચાયત’ અધિવેશન ગ્રામ સ્તરે થતાં આંદોલનોની સમીક્ષા કરવા માટે અને તેમની વચ્ચે એકતા ઊભી કરવા માટે બોલાવવામાં આવ્યું હતું. ‘જૈવ પંચાયત’ની પ્રવૃત્તિઓને મજબૂત બનાવવાની વ્યૂહરચના પણ તેમાં નક્કી થઈ હતી. તેમાં ભારત સરકારની નદીઓને જોડવાની જે યોજના છે તેને વિશે પણ ચર્ચા થઈ હતી. ‘જૈવ પંચાયત’ ‘વસુધૈવ કુટુંબકર્મ’ની ભાવના પર આધારિત છે. તે માને છે કે મનુષ્યો સજ્જવ જગતના ભાગ છે અને તેનાથી પર નથી. આથી આપણી ઉત્પાદન અને વપરાશની તરાફ, ટેકનોલોજી અને વ્યાપારની વ્યવસ્થા, કાયદાઓ તથા નીતિઓ એવાં હોવાં જોઈએ કે તેનાથી ન્યાય, ચિરંતનતા અને શાંતિ ઊભાં થાય. સંસાધનોના સંચાલન અને ઉપયોગનો નિર્ણય સમુદ્દર્ય લે કે જેથી પંચાયત દ્વારા સમુદ્દર્યનું અસ્તિત્વ સુનિશ્ચિત બને એ તેનો ઉદ્દેશ છે.

સંસાધનોના રક્ષણ માટે અને અધિકારો પરના આકમણનો પ્રતિકાર કરવા માટે ‘જૈવ પંચાયત’ કામ કરે છે. ‘જૈવ પંચાયત’ અન્વયે સમુદ્દર્યોએ બિયારણ બેંકોની સ્થાપના કરી છે અને રસાયણ-મુક્ત ખેતીની શરૂઆત કરી છે. ઓરિસ્સામાં જૈવ પંચાયતો પાણીના ખાનગીકરણ સામે લડત આપે છે. ‘ઓરિસ્સા લિફ્ટ ઇરિગેશન કોર્પોરેશન’નું ખાનગીકરણ કરીને સિંચાઈના પાણીનું ખાનગીકરણ કરાયું છે અને તેની સામે લડત આપવામાં આવી રહી છે. વધુ વિગત

માટે સંપર્ક સાધો: ‘નવદાન્ય’, એ-૫૦, હૈઝ ખાસ, નવી ડિલ્લી-૧૧૦૦૧૬. ફોન: ૦૧૧-૨૫૫૫૧૮૬૮, ૨૬૮૯૦૭૭. ફેક્સ: ૦૧૧-૨૫૫૫૨૦૮૩, ૨૬૮૫૯૭૮૫. ઈમેલ: rfste@vsnl.com

સંકલ્પ સભા અને યાત્રા

ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશની સૈચિછિક સંસ્થાઓએ મહિલાઓ પરની હિંસા સામે ઝુંબેશ શરૂ કરી છે અને તેના ભાગરૂપે ૧૦મી ડિસેમ્બર-૨૦૦૩ના રોજ માનવ અધિકાર દિને વડોદરામાં નર્મદા ભવનથી ન્યાયમંદિર સુધીની એક સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે દિવસે સાંજે ૪.૩૦થી ૬.૧૫ દરમ્યાન આ યાત્રા યોજાઈ હતી. નર્મદા ભવન ખાતે સૌ એકત્ર થયા હતા અને ત્યાં મહિલાઓના અધિકારો વિશેનાં ગીતો ગાવામાં આવ્યાં હતાં અને સૂગ્રો પોકારવામાં આવ્યાં હતાં. ત્યાં મહિલાઓ પરની હિંસા સામેની ઝુંબેશ વિશે થોડીક વાત પણ કરવામાં આવી હતી અને ઝુંબેશની કમગીરી વિશે રજૂઆત કરાઈ હતી.

પછી મૌન રેલીની શરૂઆત થઈ હતી. રેલી દાંડિયા બજાર, ફાયર બિગેડ, સુરસાગર વિસ્તારમાં ફરીને ન્યાયમંદિર પહોંચી હતી. યાત્રામાં ભાગ લેનારાઓએ પોસ્ટર્સ અને પ્લેકાર્ડ્સ વગેરે હાથમાં લીધાં હતાં. અંતે ન્યાય મંદિર ખાતે માનવ સાંકળ રચવામાં આવી હતી. દરેક સંસ્થા દ્વારા કામગીરીની રજૂઆત કરાઈ હતી, લોકોમાં ચોપાનિયાં વહેચવામાં આવ્યાં હતાં અને શપથ લેવામાં આવ્યા હતા. અગાઉ ૨૫મી નવેમ્બરથી ૧૦મી ડિસેમ્બર, ૨૦૦૩ સુધી ભાવનગર, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ અને કચ્છ જિલ્લામાં આશરે ૨૦૦ ગામોમાં આ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. તેમાં ૧૫૦૦૦ જેટલાં સ્ત્રી-પુરુષોએ ભાગ લીધો હતો. આ ઝુંબેશમાં ‘સ્વાતિ’, ‘ઉત્થાન’, શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર, મહિલા સામજિક સોસાયટી, કચ્છ મહિલા વિકાસ સંગઠન, નવજ્યોત મહિલા વિકાસ સંગઠન, ‘આનંદી’ જેવી સંસ્થાઓની સક્રિય ભૂમિકા રહી હતી.

દરેક ગામમાં ઘણા લોકોએ ઝીંસા નહિ ચલાવી લેવાની પ્રતિજ્ઞા લીધી હતી અને ૪૦૦૦ પુરુષોએ એ માટેના એક પ્રતિજ્ઞાપત્ર પર સહીએ કરી હતી. આ સંકલ્પયાત્રા જ્યારે ૨૦૦ જેટલાં ગામોમાં ફરી ત્યારે તેને ખૂબ સારો પ્રતિભાવ મળ્યો હતો. ‘સંકલ્પ સભા’ આ સંકલ્પ યાત્રાને અંતે યોજાઈ હતી. ૧૦ ડિસેમ્બર,

૨૦૦૩ના રોજ યોજાયેલી આ સભામાં ‘નયા માર્ગ’ના તંત્રી શ્રી ઈન્દ્રુકુમાર જાની, ગાંધીવાદી કાર્યકર સુશ્રી દ્વાકા પટણી અને ‘ઉત્થાન’ના શ્રી નફિસા બારોટ વગેરેએ રજૂઆતો કરી હતી. વિખ્યાત કથાકાર શ્રી મોરારીબાપુનો ૧૫ મિનિટનો વિરિયો સંદેશો પણ એ સભામાં સંભળવાયો હતો. વધુ વિગતો માટે સંપર્ક સાધો: સુશ્રી પુનમ કથુરિયા, ઈમેલ: pswati@satyam.com ફોન: ૯૮૨૫૦૮૪૯૦૧.

મજદૂર કિસાન કિરાણા સ્ટોર

‘મજદૂર કિસાન શક્તિ સંગઠન’ (અમેરિકેઅસઅસ) દ્વારા રાજ્યાનમાં ‘મજદૂર કિસાન કિરાણા સ્ટોર’ ચલાવવામાં આવે છે. મધ્ય રાજ્યાનમાં ૧૯૯૧થી આવી પાંચ દુકાનો ચલાવવામાં આવે છે. આવી પહેલી દુકાન ભીમમાં ખોલવામાં આવી હતી અને પછી જવાજા, સૂરજપુરા અને તોડગઢમાં ખોલવામાં આવી હતી. આ દુકાનોનો હેતુ એ દર્શાવવાનો છે કે ખેડૂતો અને કામદારો સંગઠિત રીતે વ્યાપાર સંબંધી આર્થિક પ્રવૃત્તિઓ કરી શકે છે. નવી આર્થિક નીતિમાં અમ સમજવામાં આવે છે કે તમામ આર્થિક બીમારીઓનો ઉપાય મુક્ત બજાર છે. આથી આ મુક્ત બજારને સમજવાનો પ્રયત્ન આ દુકાનો દ્વારા કરવામાં આવે છે. ગારીબોના લાભ માટે બજારનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે આ સ્ટોર દ્વારા સમજાયું છે.

છેલ્લાં ૧૦ વર્ષ દરમ્યાન અનેક પડકારો છતાં આ દુકાનો બજારમાં પોતાનું સ્થાન જમાવવામાં સફળ થઈ છે. ગોળ, ખાંડ, તેલ વગેરેના ભાવ નીચા લાવવામાં અને સ્થાનિક વેપારીઓની ગેરરીતિઓને આપોઆપ અંકુશમાં લાવવામાં આ દુકાનો સફળ થઈ છે. આ દુકાનોએથી ખર્ચ વતા સ્થાયી ખર્ચ મુજબ વાજબી ભાવ લેવાય છે. સંગઠનના કેટલાક કાર્યકરો આ દુકાનો ચલાવે છે અને તેમને માનદ્દ વેતન પણ ચૂકવવામાં આવે છે. આરંભમાં સ્થાનિક સ્થાપિત હિતોએ આ દુકાનોનો જબરદસ્ત વિરોધ કર્યો હતો. તેમ છતાં આ દુકાનોએ ભારે દબાડો વચ્ચે પણ સફળતા પ્રાપ્ત કરી છે. કાર્યકરોએ એ માટે લોકોમાં જાગૃતિ ઉભી કરી અને ખેડૂતોએ દુકાનો ચલાવવા માટે આરંભમાં વ્યાજમુક્ત ધિરાણ આપ્યું.

દુકાનોએ બે વર્ષમાં પોતાના વચન મુજબ એ પેસા પાછા આપી દીધા. જીવન જરૂરિયાતની વસ્તુઓનું વેચાણ કરતી આ દુકાનોને લીધે સંગઠનની પકડ પણ લોકો ઉપર મજબૂત બની. આ દુકાનોમાં પરંપરાગત ઊર્જાનું ખર્ચ ઘણું વધારે છે તેથી તમામ દુકાનોમાં સૌર વિદ્યુત પેનલ બેસાડવાનું નક્કી કરવામાં આવ્યું અને રૂ. ૯૩૦૦૦ના ખર્ચો તે બેસાડવામાં આવી છે. આ માટે ટૂંકા ગાળાનું ધિરાણ પ્રાપ્ત થયું છે. સંગઠને આ અંગે દાન મેળવવા માટે એક અપીલ પણ જારી કરી છે. વધુ વિગતો માટે સંપર્ક સાધો: ‘મજદૂર કિસાન શક્તિ

સંગઠન’, ગામ: દેવદુંગારી, પોસ્ટ: બરાટ, જિ. રાજસમંદ, રાજ્યાન-૩૧૩૩૪૧. ફોન: ૦૨૮૫૧-૨૪૩૨૫૪, ૨૫૦૯૫૫. ફેક્સ: ૦૧૪૯૩-૨૮૮૨૦૭.

સામાજિક દિક્કાર રેલી અને સભા

રાજ્યાનના જોધપુર જિલ્લાના શેરગઢ તાલુકાના સિહાંદા ગામના સુખરામ ભીલનાં પત્ની શ્રીમતી ચૈન દેવી ઉપર બળાત્કારના થયેલા પ્રયાસના વિરોધમાં તા. ૧૩-૧૧-૨૦૦૩ના રોજ આ રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૈન દેવી અને સુખરામના પરિવારમાં બે પુત્રો અને બે પુત્રીઓ છે. પતિને દમ થયેલો છે. પરિવારનો સમગ્ર બોજો ચૈન દેવી ઉપર છે. તેઓ શાક વેચીને ગુજરાન ચલાવે છે. ચૈન દેવી છલ્લાં બે વર્ષથી ‘દલિત મહિલા મંચ’ સાથે જોડાયેલાં છે.

તા. ૮-૭-૨૦૦૩ના રોજ સવારે પાંચ વાગ્યે જ્યારે તેઓ પોતાના ઘરમાં સૂતાં હતાં ત્યારે એ જ ગામના શંકરદાન ચારણ દ્વારા તેમના પર બળાત્કાર કરવાનો પ્રયાસ કરાયો હતો. ચૈન દેવીએ શોરબકોર કર્યો એટલે તેમના પતિ જાગી ગયા અને તેઓ બહાર સૂતાં હતાં ત્યાંથી તરત જ અંદર આવ્યાં અને તે વખતે શંકરદાન ભાગી ગયો. શંકરદાન ગામનો અધ્યાશી આવારા માણસ છે, અને તેઓ આખા



ગામને હેરાન-પરેશાન કરી મૂક્યું છે. એ જ દિવસે તરત જ શેરગઢના પોલિસ સ્ટેશને ફરિયાદ કરવામાં આવી અને ચૈન ડેવી ‘દલિત અધિકાર અભિયાન’ કાર્યાલય પર પહોંચી. ત્યાં તેમણે અભિયાનના કાર્યકર્તા પ્રેમલતાને સમગ્ર વાત કહી. પછી મંચની મહિલાઓની એક બેઠક બોલાવાઈ અને આરોપીને સજા થાય અને ન્યાય મળે તે માટે કાર્યવાહી કરવાનું તેમાં નક્કી થયું. નવ દિવસ વીતી ગયા છતાં પણ પોલિસ તપાસ કરવા ન આવી ત્યારે એસ.પી. (ગ્રામીણ)ને મળીને ન્યાય માંગવામાં આવ્યો. તેમ છતાંથી કોઈ કાર્યવાહી ના થઈ ત્યારે જોધપુર જઈને પોલિસ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી.

તેમ છતાંથી કશું પરિણામ ન આવ્યું. તે પછી ઓગસ્ટ, ૨૦૦૩ના રોજ કલેક્ટરની કંયેરી સામે ઉપવાસ પણ કરવામાં આવ્યા. પછી કલેક્ટરે એક સમિતિની નિમણૂક કરી કે જેણો ગ્રાશ દિવસમાં તેનો અહેવાલ આપવાનો હતો. દરમ્યાન, વડી અદાલતે આગોત્રા જમીન આરોપીને આપી દીધા. પછી આરોપી શંકરદાન ચારણને સામાજિક રીતે અપમાનિત કરવાનું નક્કી કરવામાં આવ્યું. અને એનો કાર્યક્રમ ૧૩-૧૧-૨૦૦૩ના રોજ રખાયો.

આ દિવસે પણ્ણભી રાજ્યસ્થાનમાં કાર્ય કરનારા ‘દલિત અધિકાર અભિયાન’ના લોકો શેરગઢમાં ‘દલિત સંદર્ભ માહિતી કેન્દ્ર’ ખાતે એકઠા થયા અને શેરગઢના સ્થાનિક લોકો પણ એકત્ર થયા. લગભગ ૨૦૦ જણાએ ત્યાંથી શેરગઢના પોલિસ મથક સુધી હથમાં ઝંડા અને સૂત્રો લઈને રેલી કાઢી. ત્યાંથી તેઓ વાહનોમાં બેસીને સિહંદા ગામે ગયા. ગામમાં સ્થાનિક ૪૦૦ લોકો પહેલેથી જ એકત્ર થયેલા હતા. ત્યાં એક સભાનું આયોજન કરાયું હતું. પછી મામલતદારને રાષ્ટ્રપતિને સંબોધિને એક આવેદનપત્ર અપાયું અને તેમાં ‘દલિત અધિકાર અભિયાન’ના કાર્યકર્તાઓએ હસ્તાક્ષર કર્યા હતા. શંકરદાન ચારણના ઘર આગળ જઈને પણ સૌઅં સૂત્રોચ્ચાર કર્યા હતા.

આ કાર્યક્રમમાં ‘ઉન્નતિ’, મરુધરા ગંગા સોસાયટી, ગ્રામીણ વિકાસ સંસ્થાન, આઈડિયા સંસ્થાન, લોક કલ્યાણ સંસ્થા, ‘પ્રયાસ’, ગ્રામ વિકાસ સંસ્થા અને જ્ય ભીમ શિક્ષણ સંસ્થાન જેવી સ્વૈચ્છિક સંસ્થાઓએ ભાગ લીધો હતો.

વિશ્વ વિકલાંગતા દિનની ઉજવણી

સાબરકાંડામાં ‘ગ્રામ વિકાસ સેવા ટ્રસ્ટ’, અમદાવાદમાં ‘સાથ’, પાટણમાં ભણસાલી ટ્રસ્ટ અને વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સમાજ કાર્ય વિભાગ દ્વારા તા.૩-૧૨-૨૦૦૩ના રોજ વિકલાંગતા દિનની ઉજવણી કરવામાં આવી હતી. એ તમામે ‘સોલિડારિટી બ્લૂ’ ઊભાં કર્યી હતાં અને ‘ગ્રામ વિકાસ સેવા ટ્રસ્ટ’ દ્વારા એક રેલી અને



જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. મામલતદારની કંયેરી, બસ સ્ટેશન, રેલવે પ્લેટફોર્મ અને અન્ય સ્થળોએ સ્ટોલ્સ ઊભા કરાયા હતા. તેમાં વિકલાંગો વિશે ચોપાનિયાં, ભીતંચિત્રો, પરિપત્રો અને અન્ય માહિતી રાખવામાં આવી હતી. તેનો હેતુ જગૃતિ ફેલાવવાનો હતો કે જેથી સામાન્ય માણસો વિકલાંગોના સમાજમાંના સ્થાન અને તેમના અધિકારો વિશે જાણે. સૂત્રો દ્વારા વિકલાંગોનો સામાજિક સમાવેશ થાય તેના પર ભાર મૂકવામાં આવ્યો. આ સ્ટોલ્સ પર સંકલ્પપત્રો પણ રાખવામાં આવ્યા હતા. સ્ટોલ્સના મુલાકાતીઓ એ વાંચીને તેના પર સહી કરતા હતા. વિકલાંગોના અધિકારો વિશે કામ કરવા માટે સામાન્ય રીતે લોકો સંમત થયા હતા.

ભીતંચિત્રો દ્વારા વિકલાંગ વિકિત્ત ધારા - ૧૯૮૮ની જોગવાઈઓ પણ ત્યાં દર્શાવવામાં આવી હતી. ઈડર ખાતે ‘ગ્રામ વિકાસ સેવા ટ્રસ્ટ’ દ્વારા મહિલા આર્ટ્સ કોલેજથી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં લગભગ ૫૦૦ જણાએ ભાગ લીધો હતો. તેમાં વિકલાંગ લોકો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓનો સમાવેશ થતો હતો. કમિશનરની કંયેરીએ રેલી પૂરી થઈ હતી અને કમિશનરને એક આવેદનપત્ર સુપરત કરાયું હતું.

તેમાં રસ્તાઓ અને જાહેર સ્થળોએ વિકલાંગોને ચાલવા કે ચડવા-ગુતરવામાં મુસીબત ના પડે તેવી વ્યવસ્થા ઊભી કરવી, ૪૦ ટકાથી વધુ વિકલાંગતા ધરાવતા લોકોને માસિક ૩. ૫૦૦ પેન્શન આપવું, તેમને સ્વાવલંબી બનવામાં મદદ કરવી વગેરે માગણીઓ રજૂ કરવામાં

આવી હતી. પોલિયો-વિરોધી રસી જુંબેશની જે મ જ વિકલાંગતા વિશે લોક જાગૃતિ લાવવાની માગણી પણ કરાઈ હતી. રેલીને અંતે એક જાહેર સમાચાર યોજાઈ હતી. તેમાં કલેક્ટર અને ઈડર તાલુકા પંચાયતના પ્રમુખ વગેરેએ પ્રવચનો કર્યો હતાં. તેમણે બંનેએ વિકલાંગોના અધિકારોના પાલનના સંદર્ભમાં સહકારની ખાતરી આપી હતી.

રાજસ્થાનમાં વિચરતી જાતિઓનું પુનર્સ્થાપન

રાજસ્થાનમાં અરવલ્લી પ્રદેશની જે વિચરતી જાતિના લોકોને અંગેજોએ ગુનેગાર જાતિના ગણાવ્યા હતા તેવા આશરે ૪૫૦૦૦ લોકોનું પુનર્સ્થાપન કરવામાં વકીલ શ્રી રતન કાત્યાયની સફળ થયા છે. ૧૩ વર્ષના પ્રયાસો પછી આ વિચરતી જાતિના લોકો માટે તેમણે સમાન તકો સહિતનો સમાજ ઉભો કરવામાં સફળતા મળી છે. આ કાર્ય બદલ તેમને ૨૦૦૩ના વર્ષનું ‘શારદા સમાન તક પારિતોષિક’ એનાયત કરવામાં આવ્યું છે.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને તેમને આ પારિતોષિક એનાયત કર્યું હતું. ભારતના બંધારણામાં પણ વિચરતી જાતિઓના અસ્તિત્વને માન્ય રખાયું નથી એવી ખબર પડ્યા બાદ તેમણે આ જાતિઓના કાયમી વસવાટ માટે પ્રયત્નો શરૂ કર્યા હતા. તેમના મને દેશમાં આશરે ૪.૫ કરોડ લોકો અને ૨૦૦ સમુદ્ધાયો વિચરતી જાતિના છે અને તેઓ ભારતમાં અસ્તિત્વ જ ધરાવતા નથી કરાણ કે ભારતનું બંધારણ ઘડાયું ત્યારે તેમનું કોઈ પ્રતિનિધિત્વ જ નહોતું.

૧૮૭૧માં ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા વિચરતી જાતિઓને આદતી ગુનેગાર ગણવામાં આવ્યા હતા. એનું એક કારણ એ હતું કે સ્વાતંત્ર્ય માટેની આર્થિક લડતોમાં આ જાતિઓ ખૂબ સંક્રિય હતી. પણ સ્વાતંત્ર્ય પછી પણ આ જાતિઓ બાંસુરુ સ્વાતંત્ર્ય મેળવી શકી નથી એ એક કમન્સિની છે. વધારે ફુઃખદ બાબત તો એ છે કે ૧૮૫૧માં જ્યારે બ્રિટિશ કાનૂનોની સમીક્ષા કરવામાં આવતી હતી ત્યારે ભારત સરકારે પણ ‘હેબિસ્યુઅલ ઓફેન્ડર્સ એક્ટ’માં કોઈ સુધારા કર્યા નહોતા. સંખ્યાબંધ આદિવાસી સમુદ્ધાયોનો સમાવેશ ભારતીય રાજ્યમાં કરવામાં આવ્યો નથી. અને એ રીતે બંધારણના ઘડકેયાઓએ જ તેમના માનવ અધિકારોનો ભંગ કર્યો છે એમ કાત્યાયની કહે છે. વિકાસ તેમને સ્પર્શર્યો નથી અને કોઈ રાજકીય પક્ષ તેમના પ્રત્યે ધ્યાન આપતો નથી કારણ કે તેઓ મતબેંકનો ભાગ નથી.

બિનવિવાદસ્પદ સરકારી જમીન પર આ વિચરતી જાતિઓને સ્થાયી બનાવવાનો પ્રયાસ તેમણે કર્યો છે. ‘જો જમીન સરકારી હૈ, વહ જમીન હમારી હૈ’ એમ તેઓ કહે છે. તેથી સત્તાવાળાઓને આ આદિવાસી વિચરતી જાતિના અધિકારોને સ્વીકારવાની ફરજ પડી

છે. શ્રી કાત્યાયની હવે તેમને માટે રેશન કાર્ડ અને મતાધિકારની માગણી કરી રહ્યા છે. અત્ર, વસ્ત્ર અને શિક્ષણના પાયાના અધિકારો તેમને મળે તે માટે તેઓ પ્રયાસ કરી રહ્યા છે. લગભગ ૨૦૦૦ જે ટલા આદિવાસીઓનો સમાવેશ ગરીબીની રેખા નીચે જવતા લોકોની યાદીમાં કરવામાં આવ્યો છે. સમાજનું વલણ પણ હવે આ વિચરતી જાતિઓ પ્રત્યે બદલાયું છે. અરવલ્લી પ્રદેશમાં લગભગ પાંચ ગામોમાં આ જાતિઓના લોકો સરંચં પણ બન્યા છે.

આપત્તિના સામનાની તૈયારી: અભિન સુરક્ષા

બે વર્ષ અગાઉ ગુજરાતમાં ભૂકુંપ આવ્યો તેના સંદર્ભમાં આઈસીઈટી દ્વારા અમદાવાદ નગરમાં આપત્તિના સામનાની તૈયારી અને આપત્તિ સંચાલન માટેની પરિયોજનાઓ હાથ ધરવાનું નક્કી થયું હતું. તેમાં તકનિકી તાલીમ, સાધનો પૂરાં પાડવાં અને લોકજાગૃતિના કાર્યક્રમોનો સમાવેશ થાય છે.

‘ઉન્નતિ’ તેની પ્રાયોગિક પરિયોજનામાં લોકજાગૃતિ કાર્યક્રમ હાથ ધરે છે. આ કાર્યક્રમમાં અભિન સુરક્ષા અંગે લોકજાગૃતિ ઊભી કરવાના કાર્યક્રમોનો સમાવેશ થાય છે. તેમાં આ પ્રકારની પ્રક્રિયા હાથ ધરાઈ હતી:

- (૧) સહભાગી સંગઠનો સાથે બેઠકો યોજવામાં આવી અને તેમાં અભિન સુરક્ષાના મુદ્દાને પ્રાથમિકતા આપવાનું નક્કી કરવામાં આવ્યું. તે માટે સામગ્રી તૈયાર કરવાનો વિચાર પણ કરાયો. આગની આપત્તિના સામનાની તૈયારી માટે લોકજાગૃતિ ઊભી કરવાની જરૂર છે એમ લાગ્યું. નાગરિકો, શાળાનાં બાળકો અને વહીવટી તંત્રને આગ સામે જાગૃત કરવાનું નક્કી કરાયું.
- (૨) તે અંગે અમદાવાદ ફાયર બિંગોડ સાથે પ્રવૃત્તિઓનું આયોજન કરવાનું પણ નક્કી થયું.
- (૩) શૈક્ષણિક સંસ્થાઓનો સંપર્ક કરવામાં આવ્યો. શાળાઓની યાદી બનાવાઈ અને તેમને નિર્દશન અંગે નિયંત્રણ આપવામાં આવ્યું,



અને કાર્યક્રમની વિગતો અપાઈ.

- (૪) ઈમરજન્સી નંબર માટેનાં સ્ટિકર્સ, કોમિક બુક અને એક પોસ્ટર તૈયાર કરાયાં, અને તે શાળાઓમાં વહેંચવામાં આવ્યાં.
- (૫) રેઝિયો મિર્ચી, સ્થાનિક કેબલ ટીવી વરોરેનો સંપર્ક દિવાળી દરમ્યાન સુરક્ષાનો સંદેશો પહોંચાડવા માટે કરાયો.
- (૬) આગની સામે સુરક્ષા અંગેનાં છ નિર્દર્શનો કરાયાં. તેમાં ૨૧ શાળાઓનાં ૧૮૦૦ બાળકોએ ભાગ લીધો.
- (૭) દિવાળીમાં આગ સામે સુરક્ષા માટે ૫૫ સેકન્ડની સંગીતમય જિગલ અને એનિમેટેડ વિડિયો તૈયાર કરાયાં. જુદા જુદા સમયે ગ્રાણ દિવસ સુધી સ્થાનિક રેઝિયો પર જિગલ ૨૪ કરાઈ. પાંચ દિવસ સુધી સિનેમાધરોમાં શો અગાઉ એનિમેટેડ મેસેજ કિલેપ ૨૪ થઈ.

વિવિધ જૂથોને ઈમેલ દ્વારા સંદેશો પહોંચાડવાયો. ગુજરાતમાં દિવાળીના સપ્તાહ દરમ્યાન ૧૫ થિયેટરોમાં સ્લાઇડ શો પણ દર્શાવવાયો. આને પરિણામે શાળાનાં બાળકોમાં આગ લાગતી રોકવાનાં પગલાં અને સુરક્ષા વિશે જાગૃતિ આવી. આગ લાગે તો મોટું જાનમાલનું નુકસાન થતું કેવી રીતે અટકાવવું તે પણ તેમણે જાણ્યું. અમદાવાદ ફાયર બિગેડ સાથે અનેક બેઠકો યોજને વધુ નિર્દર્શનો યોજવામાં આવશે. સ્ટિકર્સ અને કોમિક બુક વધુ શાળાઓમાં વહેંચવામાં આવશે. ઔદ્યોગિક વિસ્તારોમાં પણ આગ સામે સુરક્ષાનાં પગલાં હાથ ધરવામાં આવશે. આ મુદ્દ અમદાવાદનું એક બિન-સરકારી સંગઠન સીએઈ દ્વારા સહયોગ પ્રાપ્ત કરવામાં આવશે.

પંચાયતોમાં નભળા વર્ગોની ભાગીદારી વિશે સંમેલન

બનાસકંઠા જિલ્લા દલિત સંગઠન-પાલનપુર, બિહેવિયરલ સાયન્સ સેન્ટર-અમદાવાદ, સામાજિક ન્યાય નંચ-સાબરકંઠા અને 'ઉન્નતિ'ના સંયુક્ત ઉપકરે પાલનપુર ખાતે તા. ૪ અને ૫ નવેમ્બર, ૨૦૦૩ના રોજ એક સંમેલન યોજવામાં આવ્યું હતું. પંચાયતોમાં શાસન વ્યવસ્થામાં ભાગીદારી અંગેના દલિતો, આદિવાસીઓ અને મહિલાઓના અનુભવોની તેમાં આપલે કરવામાં આવી હતી અને પ્રશ્નોનો ઉકેલ લાવવા વિશે ચર્ચા કરવામાં આવી હતી.

સામાજિક ન્યાય સમિતિઓના સભ્યો, અધ્યક્ષો, પંચાયતોના સભ્યો, સરપંચો, સમુદાય-આધારિત સંગઠનોના પ્રતિનિધિઓ અને સ્થાનિક નેતાઓ મળીને તેમાં કુલ ૭૦૦થી વધુ લોકો હાજર રહ્યા હતા. તેમાં ગુજરાત પંચાયત કાનૂનમાં સુધારા માટે એક આવેદનપત્ર તૈયાર કરાયું. તેને અંગે પછીથી એક કાર્યશાળાનું આયોજન તા. ૨૮-૧૧-૨૦૦૩ના રોજ કરાયું હતું. તેમાં આ આવેદનપત્રને બિન-સરકારી સંગઠનોના નેતાઓ, વિદ્ધાનો અને કર્મશીલાએ આખરી ઓપ આપ્યો

હતો. આ સંમેલનને પરિણામે દલિતો, મહિલાઓ, આદિવાસીઓ અને પદ્ધતા વર્ગોના જે પ્રતિનિધિઓ પંચાયતોમાં ચૂંટાયેલા છે તેમને બળ મળ્યું હતું. તેમાં કુલ ૨૭ માગણીઓ ૨૪ કરાઈ છે. આમાંની કેટલીક અગત્યની માગણીઓ નીચે મુજબ છે:

- (૧) સરપંચની સામેના અવિશાસના પ્રસ્તાવ ઉપર ગ્રામ સભાની અનુમતિ મળે ત્યારે જ અમલ થાય.
- (૨) ચૂંટાયેલા સરપંચ પર અડધા કાર્યકાળ સુધી અવિશાસની દરખાસ્ત ન લાવી શકાય.
- (૩) કુલ જનસંખ્યાનો અડધો ભાગ મહિલાઓ હોવાથી ગ્રામ સભા માટે જરૂરી કોરમાં પણ ૫૦ ટકા મહિલાઓની હાજરી ફરજિયાત કરવી.
- (૪) દરેક ગ્રામ પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિની રચના ફરજિયાત કરવી જોઈએ.
- (૫) અનામત બેઠકો પર ચૂંટાતા સભ્યોની તાલીમ માટેની વ્યવસ્થા કરવી જોઈએ.
- (૬) દરેક પંચાયતની સામાજિક ન્યાય સમિતિ હસ્તક લઘુતમ રૂ. ૨૦૦૦ અથવા તેની વસ્તીના ધોરણે સપ્રમાણ રકમ વાર્ષિક ધોરણે મૂકવી જોઈએ.
- (૭) સરપંચોની તાલુકા પંચાયતમાં દર ત્રણ મહિને મીટિંગ રાખવી જ જોઈએ.

નવીનતમ વિચારો માટે આદવાન

'ગ્રામીણ સેવાઓમાં સુધારો: પહોંચ અને ગુણવત્તા' વિષય વિશે ડીએફાઈડી અને ફિક્સી સાથેના સહયોગમાં વિશ્વ બેંક જૂથે પહેલી જ વાર ભારતમાં 'કન્ટ્રી લેવલ ડેવલપમેન્ટ માર્કેટ પ્લેસ'ની જાહેરાત કરી છે. તે ૧૫મી એપ્રિલ દિલ્હી ખાતે યોજાશે. તેનો દીરાદો નવીનતમ પ્રયોગો કરતાં બિન-સરકારી સંગઠનો, સમુદાય આધારિત સંગઠનો, પ્રતિષ્ઠાનો, વિદ્યારીય સંસ્થાઓ, નાગરિક સંગઠનો અને ખાનગી ક્ષેત્રને ટેકો આપવાનો છે.

ગારીબી નિવારણના થયેલા નવીનતમ પ્રયોગોને ધ્યાનમાં લેવામાં આવશે, ખાસ કરીને ગ્રામીણ સેવાઓની ગુણવત્તા અને પહોંચ સુધારવા માટેના અભિગમો અને અનુભવોની આપલે તેમાં કરવામાં આવશે આ માટે ગ્રામીણ પાણી પુરવઠો અને સફાઈ, રસ્તાઓ, શિક્ષણ, આરોગ્ય, વીજળી અને ધિરાણ જેવા ક્ષેત્રો માટે પરિયોજનાઓ આવકારવામાં આવી છે. તે માટે ૧૦થી ૧૫ હજાર ડોલર અમલ માટે પૂરા પાડવામાં આવશે. વિગતો માટે સંપર્ક સાધો: વિશ્વ બેંક, ૭૦, લોદી એસ્ટેટ, નવી દિલ્હી-૧૧૦૦૦૩. ફોન: ૦૧૧-૨૪૯૯૮૪૮૧. ઈમેલ: mrego1@worldbank.org

સંદર્ભ સાહિત્ય

વંચિતલક્ષી જનજગૃતિ શ્રેણીની પુસ્તિકાઓ

આ શ્રેણીમાં કુલ ૧૦ પુસ્તિકાઓ પ્રગાટ થઈ છે: (૧) આજાદ ભારતના ગારીબોનો સવાલ: અમારે આંગણે સ્વરાજ ક્યારે આવશે? (૨) અન્યાયી સમાજ ના લડવૈયા અને ઈતિહાસ પુરુષ: ભારતરન ડૉ. બી. આર. આંબેડકર. (૩) ખેતવિકાસ અને ગામડાંમાંથી શહેર ભણી થતાં સ્થળાંતરોની સમસ્યાઓ. (૪) દલિતો, આદિ જાતિઓની વિપદ્ધાઓ અને નકસલવાદીઓની સમસ્યાનાં મૂળ. (૫) વિકાસની આ તરાફ: થોડી ખુશી, આંગું દુઃખ. (૬) કોણ સાંભળશે વંચિતોની આ વેદનાઓ?

આ પદ્ધીની જે ચાર પુસ્તિકાઓ છે તે નાનાં જીવનચરિત્રોથી અને તેમના તથા તેમને વિશેના લેખકના વિચારોથી ભરેલી છે: (૧) ડાબેરી ચળવળના મશાલચીઓ. તેમાં કેફી આજમી, સરદાર જાફરી, મજરૂહ સુલતાનપુરી, ઈન્દ્રજિત ગુપ્તા, હરકિસનસિંહ સુરજુત, ચંદ્રશેખર રાવ, બી. ટી. રણાદીવે, નામ્બુડ્રીપાદ, શ્રીપાદ અમૃત ડાંગે વિશે આલેખન કરાયું છે. (૨) શોષણ અને અન્યાયના વિરોધી ભરજીવાઓ. આ પુસ્તિકામાં સાને ગુરુજી, શ્રીપાદ અમૃત ડાંગે, જ્યોતિ બસુ, રેણુ ચક્રવર્તી, દાદાભાઈ નવરોજી, ડૉ. નેલ્સન મંડેલા, નારાયણ સુર્વે અને માલતી ચૌધરી વિશે લેખો લખવામાં આવ્યા છે. (૩) ગુજરાતનું ગૌરવ: પ્રગતિશીલ પ્રતિભાઓ. આ પુસ્તિકામાં ઈન્ડુલાલ યાણીક, દિનકર મહેતા, ચંદ્રભાઈ ભટ્ટટ, ધનવંત ઓઝા, જગમાથ વોરા અને જયંતી પારેખનાં જીવનચરિત્રો આલેખાયાં છે. (૪) જનવાદી આંદોલનકારીઓ અને શોષિતોના હાથીઓ: આ પુસ્તિકામાં જ શવંત ઠાકર, નીરુભહેન પટેલ, હિંમત ખટસુરિયા, વિહુભાઈ પટેલ, મંદુભાઈ ગાવિત, સુબોધ મંગળદાસ, જવેરચંદ મેઘાણી, જ શવંત ચૌહાણ, ઠાકોરભાઈ દેસાઈ અને મગનલાલ ચાંદલિયાનાં જીવન અને કાર્ય વિશે લેખો લખવામાં આવ્યા છે.

આ પુસ્તિકાઓ વંચિતલક્ષી જનજગૃતિ શ્રેણી હેઠળ પ્રકાશિત કરાઈ છે. લેખકે ભારતની સમસ્યાઓનું આલેખન મહિંશે ડાબેરી કે સમાજવાદી દ્વારા કર્યું છે. એ જ રીતે જે વાક્તિકા વિશે લેખો લખાયા છે તેમાંના ઘણા ગુજરાતના કે દેશના સમાજવાદી ચિંતકો કે કર્મશીલો કે રાજ કારણીઓ હતા. લેખક: બટુક દેસાઈ. પ્રાપ્તિસ્થાન: ગુજરાત ખેત વિકાસ પરિષદ, ખેત ભવન, ગાંધી આશ્રમની બાજુમાં, અમદાવાદ-૩૮૦ ૦૨૭. ફોન: ૭૫૫૭૭૭૨. પ્રથમ આવૃત્તિ-માર્ચ, ૨૦૦૩.

પંચાયતો કા સશક્તિકરણ: પ્રધાન

પ્રશિક્ષકોકે લિયે પુસ્તિકા

પંચાયતી રાજ ક્ષેત્રો કાર્ય કરતા કર્મશીલોના ક્ષમતા વર્ધનની આવશ્યકતાનો અહેસાસ આજે મોટા પાયા પર થાય છે. આ પુસ્તક આવા કર્મશીલોની તાલીમનાં તમામ પાસાંને આવરી લે છે. તેમાં ‘બેઝ મોડચુલ’ ઉપરાંત બીજાં ૧૦ મોડચુલ છે. ‘બેઝ મોડચુલ’માં પાંચ ભાગ છે. તેમાં સામાન્ય, રાજ કીય-કાન્ટૂની, વ્યવસ્થાપન, ભૂમિકા અને લઘુ સ્તરીય આયોજનની અભિમુખતાનો સમાવેશ થાય છે. આ મોડચુલ તાલીમ સંબંધી જ રૂરિયાતોના ગહન અધ્યયન તથા પંચાયતી રાજના વિશેજણોની સલાહને આધારે તૈયાર કરવામાં આવ્યાં છે. તેમાં તાલીમની એવી પદ્ધતિનો સમાવેશ કરાયો છે કે જે સહભાગી ભડાતર અને કાર્ય પર આધારિત છે.

તાલીમ માટે ઉપયોગી આલેખો, રેખાચિત્રો, ભીતચિત્રો અને રમતોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની વિગતવાર સમજૂતી અપાઈ છે. આ પુસ્તકમાં ૨૦ રંગીન ભીતચિત્રો પણ સામેલ છે. તે ભારતના બંધારાણમાંની ૧૧મી અનુસૂચિમાં આપવામાં આવેલાં પંચાયતોનાં કાર્યો સંબંધિત વિષયો અંગે છે. વળી, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એમ ગ્રાણી સ્તરની પંચાયતો વિશેનાં તમામ પાસાંઓનો સમાવેશ આ મોડચુલસમાં કરવામાં આવ્યો છે. ગ્રામ સભા વિશે પણ તાલીમ આપવાની બાબત ઉપર તેમાં ધ્યાન અપાયું છે. જુદા જુદા ઉદ્દેશ્યો વિશે કુલ ૪૫ ચિત્રો તેમાં ૨૪ કરાયાં છે. છેલ્દે ત્રણ પરિશિષ્ટોમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનાં કાર્યોની યાદીઓ આપવામાં આવી છે, અને કેટલાંક અંગેજી પુસ્તકોની યાદી અપાઈ છે. ચાર પાનાંમાં વિષયવાર સંદર્ભસ્થૂચી પણ આપવામાં આવી છે. આ પુસ્તક અમલદારો, પ્રશિક્ષકો, પંચાયતી રાજ ક્ષેત્રો કામ કરતાં બિન-સરકારી સંગઠનો અને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે.

લેખકો: ડી. બંદોપાધ્યાય, અમિતાભ મુખજી, ચિત્રાલી સેન ગવર્દી. **પ્રકાશક:** રાજીવ ગાંધી ફાઉન્ડેશન, નવી દિલ્હી. **પ્રાપ્તિસ્થાન:** કન્સેપ્ટ પબ્લિશિંગ કંપની, એ/૧૫-૧૬, કોમર્શિયલ બ્લોક, મોહન ગાડીન, નવી દિલ્હી - ૧૧૦૦૫૮. ફોન: ૨૫૩૫૧૪૯૦, ૨૫૩૫૧૭૮૭. **ફેક્સ:** ૨૫૩૫૭૧૦૩. **E-મેલ:** publishing@conceptpub.com **કિંમત:** રૂ.૭૫૦ પ્ર. ૩૭૦.

જન વકાલત

આ પુસ્તક સ્થાનિક સ્તરે કામ કરનારા કાર્યકર્તાઓ માટે છે કે જેઓ લોકો માટે સમાજ અને સરકાર સમક્ષ હિમાયતનું કામ કરે છે. લોક હિમાયતની પ્રક્રિયાની શરૂઆત અને અંત બંને જનતાથી થાય છે, ખાસ કરીને એવા લોકોથી થાય છે કે જેઓ અધિકારોથી વંચિત છે અને અન્યાયનો ભોગ બનેલા છે. લોકો પોતાનાં કાર્યોના કર્તા છે અને પોતાના નસીબના માલિક છે. લોકો કોઈની કઠપૂતળી નથી. જાહેર નીતિઓ લોકો માટે ઘડવામાં આવે છે. એટલે એ નીતિઓની શરૂઆત પણ લોકોથી થવી જોઈએ. લોકશાહીનો અર્થ જ એ છે. સમાજની પરિવર્તન માત્ર નીતિઓમાં ફેરફાર કરવાથી આવતું નથી. જો કે, તે એક અગત્યનું સાધન તો છે જ. સમાજમાં પરિવર્તન ત્યારે આવે છે કે જ્યારે લોકો પોતે પરિવર્તનની પ્રક્રિયા હાથ ધરે છે. વળી, તે માટે નીતિઓ ઘડનારાઓમાં પરિવર્તન લાવવાની ઈચ્છા શક્તિ પણ જોઈએ. તે માટે નીતિનિર્ધારકોના દૃષ્ટિકોણમાં ફેરફાર થવી જોઈએ. આ પુસ્તક આ સપનાને સાકાર કરવાની દિશામાંનું એક કદમ છે. હિમાયતના અભિયાનને વધુ બળવતાર બનાવવાનો આ પુસ્તકનો ઉદેશ છે. પણ સાથે સાથે હિમાયત કરનારા કાર્યકરોના ક્ષમતા વર્ધનનો પણ તેનો ઉદેશ છે.

જાહેર હિમાયત શું છે, જાહેર નીતિ શું છે, મૂલ્ય-આધારિત રાજકીય પ્રક્રિયા, અભિયાન કરનાર સંગઠનની આચારસંહિતા, જાહેર હિમાયતમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય, જાહેર હિમાયતનો ઉદેશ શું છે, જાહેર હિમાયતની તાકાત ક્યાંથી ઊભી થાય છે, જાહેર હિમાયતની પ્રક્રિયા શું છે, જાહેર હિમાયતના અભિયાનની યોજના કેવી હોય વગેરે મુદ્દાઓ વિશે આ પુસ્તકમાં વિગતે ચર્ચા કરવામાં આવી છે. ઉપરાંત, વેઠ મજૂરોને મુક્ત કરવવા માટેની અને કેરળના શાંત ઘાટ (સાયલંટ વેલી)ના પાર્યવરણની રક્ષા કાજેની જાહેર હિમાયતનાં સફળ ઉદાહરણો પણ તેમાં આપવામાં આવ્યાં છે. જાહેર હિમાયતનો હેતુ શાસન વ્યવસ્થામાંના અસમાન સત્તા સંબંધોનો વિરોધ કરવાનો અને તેને બદલીને ન્યાય, સમાનતા અને સામૂહિકતા પર આધારિત સંબંધો ઊભી કરવાનો છે. આ ઉદેશ પાર પાડવા માટે કામ કરતા સૌને આ હિંદી પુસ્તક ખૂબ જ ઉપયોગી થાય તેમ છે. ચિત્રો દ્વારા આ પુસ્તકને આકર્ષક બનાવવાનો પ્રયાસ પણ કરાયો છે.

પ્રાપ્તિસ્થાન: રાજ્યીય જન વકાલત અધ્યયન કેન્દ્ર, સેરિનિટી કોમ્પ્લેક્સ, રામનગર કોલોની, પાણપાણ, પુષો-૪૧૧૦૨૧. મહારાષ્ટ્ર. ફોન: ૦૨૦-૨૮૫૨૦૦૩-૪, ઈમેલ: ncas@vsnl.com પૃષ્ઠ: ૨૮.

રિક્ષા: જિંદગી હે યારો

આ હિંદી પુસ્તકમાં પેઢલ રિક્ષાચાલકોની આપવીતી અને તેમના

અધિકારોના હનન વિશેનું આલેખન કરવામાં આવ્યું છે. આ પુસ્તક સાયકલ રિક્ષાચાલકોની મુસીબતો અને સરકારની પરિવહન નીતિ વચ્ચે કેટલું અંતર છે તે સમજાવવાની કોશિશ કરે છે. સંખ્યાબંધ રિક્ષાચાલકોની મુલાકાતો આ પુસ્તકમાં પ્રસિદ્ધ કરાઈ છે અને રસ્તાઓ પર તેમને પડતી મુસીબતોનું બયાન તેમાં છે. એ પ્રકારણ-૧ માં છે કે જેનું નામ છે 'રિક્ષા જિંદગી'. બીજા પ્રકારણનું નામ છે 'મંથન'. તેમાં દિલ્હી, કલકત્તા, કાનપુર, પટના વગેરે જેવાં મોટાં નગરોમાં રિક્ષાચાલકોને પડતી મુસીબતો અને ખાસ કરીને ટ્રાફિક પોલિસ દ્વારા પડતી મુસીબતોની ઉદાહરણો સાથે રજૂઆત કરવામાં આવી છે. આ પ્રકારણમાં કેટલાક લેખો પણ આપવામાં આવ્યા છે કે જે માં સાયકલ રિક્ષાનું પરિવહન ક્ષેત્રે શું મહત્વ છે તેની રજૂઆત કરાઈ છે અને તેમાં રિક્ષા ચાલકોએ પોતે રિક્ષાચાલનમાં ઓછી મહેનત પડે તેવાં જે સંશોધનો કર્યા છે તેનો ઉલ્લેખ કરાયો છે.

ત્રીજું પ્રકારણ 'ચર્ચા' છે. તેમાં બે રિક્ષામાલિકો સાથેની પ્રશ્નોત્તરી છે. દિલ્હી નગર નિગમના નાયબ કમિશનરની મુલાકાતના અંશો પણ તેમાં આપવામાં આવ્યા છે. દિલ્હીના નાયબ ટ્રાફિક પોલિસ કમિશનરની મુલાકાત પણ તેમાં અપાઈ છે. આ બધાની વિચારવાની દિશા કેટલી અલગ અલગ છે તે આ પ્રકારણમાંથી દેખાઈ આવે છે. ચોથા પ્રકારણનું નામ છે 'દિશા'. તેમાં આરંભમાં રિક્ષાચાલકોની સમસ્યા અંગે વડા પ્રધાને દિલ્હીના ઉપરાજ્યપાલને તા.૨૩-૮-૨૦૦૧ના રોજ જે પત્ર લાખ્યો હતો તે આપવામાં આવ્યો છે. આ પત્રની વિગતો વિશે પણ ટીકા-ટિપ્પણી કરાઈ છે. રિક્ષાચાલકોની પરવાના પ્રથા અને કેવા પ્રકારની વ્યવસ્થા છે તેની વિગતો પણ તેમાં અપાઈ છે. વૈકલ્પિક નીતિ કેવી હોવી જોઈએ તેનો પણ વિચાર તેમાં કરવામાં આવ્યો છે.

પાંચમા પ્રકારણનું નામ છે 'અંકડે બોલતે હું.' આ પ્રકારણમાં જનપરિવહન પંચાયત દ્વારા દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજ્યાનમાં કરવામાં આવેલા સર્વેક્ષણની વિગતો આપવામાં આવી છે. આ વિસ્તૃત અભ્યાસમાં ૨,૨૭૮ રિક્ષાચાલકોની મુલાકાત લેવામાં આવી હતી. છેલ્લા પ્રકારણ 'સમાન સરકાર' માં વિકાસ માટેની ગલત દિશા કેવી પરિવહન નીતિઓ ઊભી કરે છે અને તેનાથી ગારીબ રિક્ષાચાલકોના અધિકારોનું હનન કેવી રીતે થાય છે તે વિશેનો એક મનનીય લેખ આપવામાં આવ્યો છે.

સમગ્રે પુસ્તક પરિવહનની નીતિ અને દિશા વિશે ચિંતન કરતાં પ્રેરે તેવું છે. લેખકો: રાજેન્દ્ર રવિ અને સ્મિતા સ્નેહી. પ્રથમ આવૃત્તિ-૨૦૦૨. પ્રકાશક: બુક્સ ફોર ચેન્જ, આર-૩૮, સાઉથ એક્સ્ટેન્શન-૨, નવી દિલ્હી-૧૧૦ ૦૪૯. ફોન: ૦૧૧-૨૨૯૧૫૦૨,

કુરકુલ: ૯૨૭, કિંમત: રૂ.૧૨૫, ઈમેલ: mani@actionaid india.org

ક્રેસા વિકાસ, કિસકા વિકાસ

આ પુસ્તકમાં વિકાસ કેવી રીતે થઈ રહ્યો છે અને કોણે માટે થઈ રહ્યો છે તેની પ્રક્રિયા સમજાવવામાં આવી છે અને સાથે સાર્થક વિકાસની પરિભાષાની શોધ કરવામાં આવી છે. આર્થિક વૃદ્ધિનો દર ઉંચો હોવો જોઈએ અને વિકાસના આંકડા અસરકારક હોવા જોઈએ એમ બધા બૂમો પાદીને કહી રહ્યા છે પણ વિકાસની પરિભાષા શું હોવી જોઈએ અને કયા વિકાસને આપણે સાર્થક વિકાસ કહી શકીએ એવી પૂર્યા ભાગ્યે જ કરવામાં આવે છે. આ સંદર્ભમાં આ હિંદી પુસ્તક મહત્વનું થઈ પડે તેમ છે.

આ પુસ્તકનાં પ્રકરણો આ મુજબ છે: (૧) વિકાસની ચર્ચા. (૨) સાર્થક વિકાસનો રસ્તો. (૩) વર્તમાન વિકાસની વિસંગતિઓ. (૪) વિકાસની શોધ સાથે આપણા જીવનને જોડીએ. (૫) સાર્થક સામાજિક પરિવર્તન. (૬) નવા જીવન મૂલ્યને શોધતી નવી શતાબ્દી. (૭) એક સાર્થક રાખ્યીય કાર્યક્રમ તરફ. (૮) ભારતીય ગ્રામદાંનો વિકાસ: શું છોડીએ, શું અપનાવીએ. (૯) ભારત અને ચીનનો વિકાસ: બે રસ્તા વચ્ચેનું અંતર. (૧૦) આધિપત્યના સંબંધોને બદલે સહકારનો સંબંધ. છેલ્લા ૧૧મા પ્રકરણમાં કેટલીક આંકડાકીય વિગતો આપવામાં આવી છે.

સાર્થક વિકાસને સમજાવવા માટે આ પુસ્તકમાં સાત મુદ્રાઓ આ મુજબ આપવામાં આવ્યા છે: (૧) તમામ મનુષ્યની પ્રાથમિક જરૂરિયાતો પરિપૂર્ણ થવી જોઈએ. (૨) મનુષ્ય ઉપરાંત પૃથ્વી પર જ અનેક પ્રકારનાં જીવ-જંતુઓને તમામનાં હુંઘ-દર્દનો ખ્યાલ રખાવો જોઈએ. (૩) ધરતીની ધરોહરને, પ્રાકૃતિક સંસાધનોને આવનારી પેઢીઓ માટે સુરક્ષિત રાખવાં જોઈએ. (૪) સમતા અને સાદગીનાં મૂલ્યો પર આધારિત સમાજ હોવો જોઈએ. (૫) સમાજમાં ભ્રાતૃત્વ, સંદ્રભાવના અને એકતા સ્થાયી થવાં જોઈએ. (૬) સમાજના નિર્માણમાં તમામ લોકોની ક્રમતાઓનું યોગદાન મેળવવું જોઈએ. (૭) સમાજમાં તમામ સતરે લોકશાહી વિચાર અને કાર્યપદ્ધતિનો વિકાસ થવો જોઈએ.

લેખક: શ્રી ભરત ડોગરા. પૃષ્ઠ: ૧૨૦. પ્રકાશક: બુક્સ ફોર ચેન્જ, આર-૩૮, સાઉથ એક્સટેન્શન-૨, નવી દિલ્હી-૧૧૦૦૪૮. ફોન: કુરકુલ: ૯૨૯૧૫૦૨, કુરકુલ: ૯૨૯૧૫૦૩. કિંમત: રૂ.૭૦/-

ધર્માન્તરણ: જરા-સી જિંદગી કે લિયે

આ પુસ્તકના સંપાદક સુશ્રી મહિલાલાએ જ પ્રસ્તાવવાના લખી છે તેનું

શીર્ષક આપવામાં આવ્યું છે કે ‘જ મનું કંઈ બદલાતું નથી એમનો ધર્મ બદલાય છે.’ એમનો કહેવાનો મતલબ એ છે કે વિકાસને નામે થઈ રહેલા અત્યાચારની સામે ધર્મ કે સંસ્કૃતિ જ્યારે લડવાની પરવાનગી નથી આપતી ત્યારે લોકો કોઈક રસ્તો શોધવાનો પ્રયાસ કરે છે અને એમાંનો એક રસ્તો ધર્મપરિવર્તન છે. એટલે જ ધર્મ બદલવાથી કદાચ કશું જ સિદ્ધ થતું નથી. આ સંદર્ભમાં ધર્માન્તરણના વિષય વિશે આ પુસ્તકમાં ચર્ચા કરવામાં આવી છે. આ પુસ્તકમાં પાંચ લેખો છે: (૧) ડૉ. પ્રકાશ લુઈસનો ‘દલિત, આદિવાસી અને ધર્માન્તરણ’. (૨) ડૉ. ગોપા જોશીનો ‘બંચ ઓફ થોટ્સ નથી વાંચી?’ (૩) કંવલ ભારતીનો ‘ધર્માન્તરણ આજના પરિપ્રેક્ષયમાં.’ (૪) અલી અનવરનો ‘ધર્મ બદલવાથી કંઈ નહિ થાય’. (૫) મોહનદાસ નૈમિશરાયનો ‘વેદના અને ધર્મપરિવર્તન’.

પ્રથમ લેખમાં દલિત અને આદિવાસીઃ દશા અને દિશા, ધર્મ અને ધર્માન્તરણ, દલિત અને ધર્માન્તરણ, આદિવાસી અને ધર્માન્તરણ જેવા વિષયોની ચર્ચા કરવામાં આવી છે. બીજા લેખમાં સંઘ પરિવારની વિચારધારા શું છે તે સમજાવવાની કોશિશ કરવામાં આવી છે. ત્રીજા લેખમાં દલિતોના ધર્માન્તરણ વિશે વિગતે ચર્ચા કરવામાં આવી છે. ચોથા લેખમાં મુસ્લિમ સમાજ અને ધર્મપરિવર્તન વિશેના વિચારો વ્યક્ત કરવામાં આવ્યા છે. આ લેખમાં મુસ્લિમ સમાજ એક એકીકૃત સમાજ છે એવી જ સર્વસામાન્ય માન્યતા પ્રવર્તે છે તે હકીકત નથી એમ સમજાવવાની કોશિશ કરવામાં આવી છે. મુસ્લિમોમાં પણ ઉંચાનીયના ભેદ પ્રવર્તમાન છે અને એ ભેદભાવ જાતિગત છે એમ દર્શાવવાનો પ્રયાસ આ લેખમાં આવ્યો છે. છેલ્લા પાંચમા લેખમાં હિંદુ સમાજની રચનામાં મૂળભૂત રીતે ગ્રાસ રહ્યો છે અને તે ધર્મપરિવર્તનનું કારણ બને છે એ સમજાવવાની કોશિશ રહી છે. મહંદુશે અહીં ધર્મપરિવર્તનનું કારણ હિંદુઓની જ્ઞાતિવ્યવસ્થા છે અને ધર્માન્તરણમાં કશું ખોટું નથી એમ જણાવવાની કોશિશ થઈ છે.

સંકલન અને સંપાદન: મહિલાલા, પૃષ્ઠ: ૮૦, પ્રકાશક: બુક્સ ફોર ચેન્જ, આર-૩૮, સાઉથ એક્સટેન્શન-૨, નવી દિલ્હી-૧૧૦૦૪૮. ફોન: કુરકુલ: ૯૨૯૧૫૦૨, કુરકુલ: ૯૨૯૧૫૦૩, કિંમત: રૂ.૭૦/-

મુસલમાન, ધર્મનિરપેક્ષતા, ગુજરાત ટ્રેજેડી ઔર હિંદુ રાખ્ય

“રાખ્યીયતા, રાખ્યીય એકતા અને ધર્મનિરપેક્ષતા માટે એવી મનોવૃત્તિની જરૂર છે કે જેમાં વ્યક્તિઓ, સમૂહો અને સાંસ્કૃતિક વૈવિધ્ય પ્રત્યે ઉચ્ચિત સન્માન અને સંદ્રભાવ હોય.” આ હિંદી પુસ્તકની શરૂઆત જ જયપ્રકાશ નારાયણના આ વાક્યથી થાય છે. તેમની જન્મશતાબ્દી નિમિત્તે આ પુસ્તકનું પ્રકાશન કરવામાં આવ્યું છે. તેમાં

ચાર લેખો છે:

- (૧) પ્રથમ લેખ ‘રાજ્યીયતા, રાજ્યીય એકતા અને ધર્મનિરપેક્ષતા’ જ્યાંપ્રકાશ નારાયણનો જ છે. ૧૯૬૮માં તેમણે દિલ્હીમાં ‘એકતા અને લોકશાહી’ વિશે એક સંમેલનનું આયોજન કર્યું હતું. તેમાં તેમણે પોતે જે અભ્યાસલેખ રજૂ કર્યો હતો તેનો સારાંશ અહીં આપવામાં આવ્યો છે. તેમાં હિંદુ રાજ્યનો જ્યાલ, રાજ્યીય વારસાનો અર્થ, ધર્મનિરપેક્ષતા, રાજ્ય અને ધર્મ, વૈજ્ઞાનિક અને તકનિકી યુગ, રાજ્યીય એકતાની જરૂરિયાત વગેરે જેવા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી છે.
- (૨) બીજો લેખ ‘ગુજરાતની નીચ્ય ટ્રેજરી’ વિશે છે. તેના લેખક છે પ્રેમસિંહ. આ લેખમાં ગોધરાની ઘટના બાદની ગુજરાતની હિંસક ઘટનાઓનું અંશતા: બયાન આપવામાં આવ્યું છે અને તેમાં માધ્યમોની ભૂમિકા, મુસલમાનોના મત, પ્રતિક્રિયા, સામ્રાધાર્યિક વર્તન અને તિરસ્કાર, લશકર સામ્રાધાર્યિક થઈ જાય તો શું, ભારત પાકિસ્તાન નથી, તટસ્થતા વગેરે જેવા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી છે. ‘રાજ્યીય સ્વયંસેવક સંઘ’ની સંસ્થાઓ અને ગુજરાત સરકારની ભૂમિકા અને તેમના માનસ વિશે પણ ચર્ચા કરાઈ છે અને તેઓ દેશને તોડવાની તૈયારી કરી રહ્યા છે એમ કહેવાયું છે.
- (૩) તૃજો લેખ ‘રાજ્ય કો ખોખલા કરતા એક ધર્મ’ અનિલ જેન દ્વારા લખવામાં આવ્યો છે. તેમાં હિંદુ ધર્મની, હિંદુ રાજ્યના જ્યાલની અને ‘રાજ્યીય સ્વયંસેવક સંઘ’ની વિચારધારાની ચર્ચા કરવામાં આવી છે. ખાસ કરીને હિંદુ કટ્ટરતાવાદનાં કેટલાંક તત્ત્વો અને વ્યવહારો પર તેમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
- (૪) ચોથો લેખ ‘સાધારણ સવાલ: અસાધારણ જવાબ’ છે. તેમાં ‘પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ’ના સત્ય શંકર ગોપાલકૃષ્ણને સામાન્યતયા જે સવાલો ઉઠાવવામાં આવે છે તેના જવાબો આપવાની કોશિશ કરી છે. તેમાં ૧૭ સવાલોના ઉત્તર અપાયા છે. તેમાં મુસલમાનોની વસ્તી હિંદુઓની વસ્તી કરતાં ઘણી ઝડપથી વધે છે, ઈસ્લામમાં અન્ય ધર્મો પ્રત્યે સહિષ્ણુતા નથી, સરકાર દ્વારા અપાતી સવલતોથી મુસ્લિમો સમૃદ્ધ થઈ રહ્યો છે, ઈસ્લામ સંપૂર્ણતા હિસા-આધારિત અને જેહાદ-આધારિત છે, ઈસ્લામી અને ઐસ્તી સંસ્કૃતિઓ ભારત માટે વિદેશી છે, હિંદુ ધર્મનો નાશ કરવા માટે મુસ્લિમ શાસકોએ સમગ્ર ભારતમાં મંદિરોનો નાશ કર્યો, પાકિસ્તાન બનવાથી મુસલમાનોને પોતાનો દેશ મળી ગયો તેથી હવે તેમણે આપણો દેશ છોડવો જોઈએ વગેરે જેવા સવાલોનો સમાવેશ કરાયો છે.

સંપાદન: આર. બી. સિંહ, મહિમાલા. પ્રકાશક: જેપી જ ન્મશતાબ્દી

સમિતિ, ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન, ૨૨૨-૨૨૩, દીનદયાળ ઉપાધ્યાય માર્ગ, નવી દિલ્હી-૧૧૦ ૦૦૨. ફોન: ૦૧૧-૨૨૭૭૪૮૧, ૨૨૭૭૪૮૩. પૃષ્ઠ: ૫૦, ડિમ્યુન: ૩.૨૫.

નવી દ્વિતીય

આ પુસ્તક જ્યાલાવ કાર્યક્રમમાં મહિલાઓને અસરકારક રીતે ભાગીદાર બનાવવાની માર્ગદર્શિકા છે. તેમાં જ્યાલાવમાં લોકમાર્ગદારી માટે પરિયોજનાનો અમલ કરનારી સંસ્થાની ભૂમિકા, સંસ્થા અને જ્યાલાવ વિકાસ ટુકડીમાં મહિલાઓને અસરકારક રીતે ભાગીદાર બનાવવાની રણનીતિ, જ્યાલાવ કાર્યક્રમમાં સહભાગી ગ્રામીણ મૂલ્યાંકન દરમ્યાન મહિલાઓ અસરકારક રીતે ભાગીદાર બન્ની શકે તે માટેનાં પગલાં, જ્યાલાવ મંડળ માટેની રણનીતિ, જ્યાલાવ સમિતિઓમાં મહિલાઓને ભાગીદાર બનાવવા માટેનાં પગલાં, જ્યાલાવ કાર્યક્રમમાં ઉપભોક્તા જીથની રણનીતિ, જ્યાલાવ યોજના અંતર્ગત સ્વસહાય જીથને સક્રિય અને ભાગીદાર બનાવવા માટેની રણનીતિઓ, મહિલાઓ અસરકારક રીતે જ્યાલાવ કાર્યક્રમમાં ભાગીદાર બને તે માટે ક્ષમતા વર્ધનનાં પગલિયાં કયાં અને કાર્યક્રમો કયા તબક્કે વગેરે બાબતોની ચર્ચા કરવામાં આવી છે. પુસ્તકના પ્રથમ ભાગમાં ઉપરોક્ત મુદ્દાઓ ચર્ચાયા છે.

પુસ્તકના બીજા ભાગમાં જ્યાલાવ વિકાસ દ્વારા મહિલાઓએ જુદાં જુદાં ગામોમાં જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેની વિગતો છે. તેમાં સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના નારિયેળી ગામનું મહિલા મંડળ, બારા ગામની મહિલા સમિતિ, રાજ કોટ જિલ્લાના માળિયા તાલુકાનું વેણાસર ગામ, સાગબારા તાલુકાનું ઊભારિયા ગામ, દાહોં જિલ્લાના ફટેપુરા તાલુકાનું ધુઘસ ગામ, કચ્છમાં ગોરાડુંગરની દક્ષિણ તળેટીએ આવેલું ખારી ગામ, ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાનું નથુગઢ ગામ, લીમખેડા તાલુકાનું અગાશવાણી ગામ, જામનગર જિલ્લાના ભાણાવડ તાલુકાનું ફેબર ગામ એમ કુલ નવ સફળ કિસ્સાઓની કહાડીઓ આવેખવામાં આવી છે. તે બધે મહિલાઓએ જ્યાલાવ વિકાસ કાર્યક્રમ કેવી રીતે સફળ બનાવ્યો છે અને તેમણે પોતાના તથા સમગ્ર ગામના વિકાસમાં કેવો ફાળો આપ્યો છે તેનું બયાન આપ્યું છે. આ આલોખન આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ, આનંદી, પર્યાવરણીય વિકાસ કેન્દ્ર, પ્રકૃતિ ફાઉન્ડેશન, સહજીવન, ઉત્થાન, સાવાજમ વગેરે સંસ્થાઓએ કર્યું છે. તેની પ્રસ્તાવના ગુજરાત રાજ્યના ગ્રામ વિકાસ કમિશનર શ્રી એ. એમ. તિવારીએ લખી છે. તેનો આર્થિક સહયોગ આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ દ્વારા અપાયો છે. પ્રકાશક: ‘આનંદી’, અર્યાના પાર્ક, શેરી નં.૨, પંચાયત નગર બસ સ્ટોપની સામે, યુનિવર્સિટી રોડ, રાજકોટ-૩૬૦૦૦૫. ફોન: (૦૨૮૧) ૨૫૮૯૦૮૧. સહયોગ રાશિ: રૂ.૫૦. પૃષ્ઠ: ૯૩.

આ ગ્રાણ માસ દરમ્યાન નીચે મુજબ અમે પ્રવૃત્તિઓ હાથ ધરી હતી:

(૧) સામજિક સમાવેશ અને સક્ષમતા

દલિતો

- રાજસ્થાનમાં આ વર્ષે સારો વરસાદ થવાથી દુકાળનો લાંબો ગાળો પૂરો થયો. તેથી જમીનના અધિકારો સંબંધી પ્રશ્નો વધુ આગળ આવ્યા કારણ કે દલિતોની ખેતીની ઘણી બધી જમીન પર દબાણો થયાં છે. હાલ અત્યાચાર સંબંધી અને ૩૦૦૦ વીધા જેટલી જમીન વિશેના ૪૦ કેસો નોંધાયા છે અને તે વિશે કાર્યવાહી ચાલી રહી છે.
- જોધપુર જિલ્લાના શેરગઢ તાલુકામાં સિહાન્દા ખાતે એક દલિત સ્ત્રી ઉપર બળાત્કાર કરવાના થયેલા પ્રયાસના સંદર્ભમાં એક જાહેર ઘિક્કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં બાડમેર અને જોધપુરમાંથી ૩૦૦ જણાએ ભાગ લીધો હતો અને ન્યાય મેળવવા માટે જિલ્લા સ્તરે હિમાયત ચાલી રહી છે.
- ‘દલિત અધિકાર અભિયાન’ની સામૂહિક કાર્યલક્ષી યોજના ઘડવા માટે પ્રાદેશિક સમિતિના સભ્યોની બે દિવસની એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં એ બાબતે સ્પષ્ટ ચર્ચા થઈ કે આંદોલનને એક નિશ્ચિયત ઓળખ આપવાની જરૂર છે કે જેથી આ સુંબેશ સ્વતંત્રપણે ચાલુ રહે.
- બાડમેર જિલ્લાનાં નવ ગામોમાં વરસાદી પાણીના સંગ્રહ માટે ટાંકા, ડિઝાની અને નાડી બાંધવા માટે સહભાગી સંગઠનોને ટેકો પૂરો પાડવામાં આવ્યો. તેના અનુવર્ત્તી કાર્ય તરીકે કાર્યના વધુ પારદર્શી, સહભાગી અને પદ્ધતિસરના અમલ માટે બે દિવસની છ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓની ઓળખ, વ્યવસ્થાનું સંચાલન, સ્ત્રીઓની સામેલાગીરી અને અમલ માટે કાર્યલક્ષી યોજના વિશે આ કાર્યશાળાઓમાં ચર્ચા થઈ.

વિકલાંગતા

- સાબરકાંઠા સહભાગી સંગઠનોના સહયોગથી એક જાહેર બગીચામાં વિકલાંગો માટેની સવલતો વિશે લોકજગૃતિ કાર્યક્રમ યોજાયો. બિન-સરકારી સંગઠનોના પ્રતિનિધિઓ, સરકારી અધિકારીઓ, માધ્યમો, વિશેષ સંસ્થાઓ અને બગીચાના મુલાકાતીઓએ તેમાં હાજરી આપી હતી. અવરોધ-મુક્ત પર્યાવરણ ઊભું કરવા અંગે વિવિધ હિતધારકોની જરૂરિયાત, મહત્વ અને ભૂમિકા વિશે ચર્ચા થઈ. વિકલાંગો અને વૃદ્ધોએ તેમના ચાલવામાં કે ચડવા-ઉત્તરવામાં પડતી મુસીબતો વિશે તેમનાં મંતવ્યો વ્યક્ત કર્યા. જગૃતિ માટે સાહિત્યનું વિતરણ પણ કરવામાં આવ્યું. વીજાણું અને મુક્રિત માધ્યમોએ આ પ્રસંગને પ્રસિદ્ધ આપી હતી.
- ખાસ કરીને જાહેર સ્થળોએ વિકલાંગોને મુસીબતો પડે તેવું વાતાવરણ ઊભું કરવા ‘એક્સોસ રિસોર્સ ગ્રૂપ’ની રચના કરાઈ છે. તેમાં સ્થપતિઓ, ડિજાઈનરો અને બિન-સરકારી સંગઠનોનો સમાવેશ થાય છે. અવરોધ-મુક્ત જગ્યાઓ ઊભી કરવા માટેની માર્ગરિખાઓ વિશે એક વિગતવાર મેન્યુઅલ તૈયાર થઈ રહ્યું છે અને તે આગામી થોડા સમયમાં પ્રસિદ્ધ કરાશે.
- દર સપ્તાહે જે ‘ગામડાનો ધબકાર’ રેઝિયો કાર્યક્રમ પ્રસારિત થાય છે તેમાં વિકલાંગતા દિન નિમિત્તે બે વિશેષ કાર્યક્રમો તૈયાર કરાયા છે. ‘અંધજન મંડળ’ના સહયોગથી તે તૈયાર કરાયા. આ કાર્યક્રમો ક અને ૧૩ ડિસેમ્બર-૨૦૦૩ના રોજ પ્રસારિત થયા. તેમાં વિકલાંગ વ્યક્તિ ધારા-૧૯૮૫ની જોગવાઈઓ અને સ્થાનિક શાસનમાં વિકલાંગ વ્યક્તિઓના પ્રદાન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
- છેલ્લા ગ્રાણ માસ દરમ્યાન માધ્યમોમાં વિકલાંગતાના પ્રશ્ન પ્રત્યે ધ્યાન ભેંચવા માટે અમદાવાદ અને કર્યા છે જિલ્લા માટે પત્રકારો સાથે બે કાર્યશાળાઓનું આયોજન કરવામાં આવ્યું. સાબરકાંઠામાં પણ એવી જ એક કાર્યશાળા યોજાઈ. તેમાં વિવિધ બિન-સરકારી સંગઠનોએ કરેલા પ્રયાસો રજૂ કરાયા. મુખ્ય પ્રવાહનાં અખબારોમાં એક વિધાયક છાપ ઊભી કરવા માટે લેખો પ્રકાશિત થયા છે અને વિકાસની મુખ્ય પ્રવાહની પ્રક્રિયામાં વિકલાંગોના સમાવેશ માટેના પ્રયાસો પણ તેમાં વ્યક્ત થયા છે.
- ‘ઉન્નતિ’ અને ‘હેન્ડિકેપ ઇન્ટરનેશનલ’ના પ્રતિનિધિઓએ બાંગલાદેશમાં ઢાકા ખાતે વિકલાંગતા વિશે યોજાયેલા એક પ્રાદેશિક પરિસરવાદમાં ભાગ લીધો. તેમણે અભ્યાસલેખો રજૂ કર્યા અને ‘સમાવેશ’ તથા ‘પહોંચ’ ઊભી કરવાના તેમના અનુભવોની આપલે

કરી. તેમણે સ્થાનિક બિન-સરકારી સંગઠનોની મુલાકાત પણ લીધી કે જેથી ‘સમાવેશ’ના પ્રશ્ને તેમના અનુભવો પણ જાડી શકાય.

પુનર્વસન

- ગૃહનિર્માણ માટે ટેકો પૂરો પાડવા ૭૫ નબળાં પરિવારો સમુદ્ધાય સાથે ચર્ચા કરીને શોધી કઢાયાં. એમાંથી ૫૮ ઘરોનું બાંધકામ પૂરું થઈ ગયું છે અને બાકીનાં ઘરોનું બાંધકામ ચાલુ છે. ૭૪ પરિવારોને ઘરના સમારકામ માટે સામગ્રી પૂરી પડાઈ અને ૯૩ ઘરોમાં વરસાદી જળના સંગ્રહ માટેની વ્યવસ્થા ઊભી કરવા માટે ટેકો પૂરો પડાયો, ૫૭ ઘરોમાં તો એ કામ પૂરું કરાયું.
- ભરતકામ કરનારી મહિલાઓનાં નાનાં નાનાં જૂથો બનાવવામાં આવ્યાં. એ દરેક જૂથમાં ૧૫-૨૦ સત્યો છે. દરેક જૂથમાં ગ્રાંડ નેતા હોય છે અને તેમની ચૂંટાડી થાય છે. અત્યારે ૬ ગામોમાં આવ્યાં ૧૭ મહિલા મંડળો છે અને જૂથના નેતાઓ કાચો માલ એકત્ર કરવાની અને કામ પૂરું કરાવવાની જવાબદારી નિભાવે છે. ‘દિલ્હી હાટ’ ખાતેના ‘નેચર બજાર’ સહિત ઘણાં પ્રદર્શન-કમ-વેચાણમાં કારીગરોએ ભાગ લીધો હતો.
- ગુજરાત અને રાજ્યસ્થાનમાં કર્મશીલોના ક્ષમતા વર્ધન માટે તા.૮-૧૧, ઓક્ટોબર, ૨૦૦૩ દરમ્યાન અમદાવાદમાં એક પ્રશિક્ષકોના પ્રશિક્ષણાનો કાર્યક્રમ યોજાયો. તેમાં ૧૭ સંગઠનોના ઉજાણાએ ભાગ લીધો.
- અમદાવાદમાં ૮થી ૧૦, ડિસેમ્બર, ૨૦૦૩ દરમ્યાન સ્થાનિક સ્તરના કર્મશીલો માટે સામાજિક વિકાસ વિશે એક તાલીમ યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નબળા લોકોના પ્રશ્નો અને તેમની અસહાયતા ઘટાડવા માટેની વ્યૂહરચનાઓ વિશે તાલીમ અપાઈ. તેમાં ૧૪ સંગઠનોના ઉ૪ સહભાગીઓએ ભાગ લીધો હતો.
- ૨૦-૨૨ નવેમ્બર અને ૧૮-૨૦ ડિસેમ્બર, ૨૦૦૩ દરમ્યાન સ્ત્રી-પુરુષ સમાનતાના વ્યવહારોને મુખ્ય પ્રવાહમાં લાવવાના ભાગરૂપે ‘ઉન્નતિ’ના કાર્યકરો માટે બે તબક્કામાં અભિમુખતા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તાલીમમાં હોદાવાર કાર્યકરોના એ રીતે ભાગ પાડવામાં આવ્યા હતા કે જેથી બંને જૂથોનાં દરેક સ્તરના કાર્યકરો સમાન સંખ્યામાં ભાગ લે.
- આ વર્ષ દરમ્યાન ‘એક્શન એર્ડ’ની ભારત અંગેની વ્યૂહરચનાની સમીક્ષા કરવામાં આવી અને અમે સંગઠનાત્મક સંચાલનની સમીક્ષા કરી. રાજ્યસ્થાનમાં દુકાળ અંગે ‘ઇકો’ના પ્રતિભાવનું મૂલ્યાંકન કરાયું. ‘ઉન્નતિ’ના નિયામકે આ બંને પ્રસંગોનું સંચાલન સંભાળ્યું હતું.

(૨) નાગરિક નેતૃત્વ અને શાસન

ગ્રામીણ શાસન

- ગુજરાતમાં એપ્રિલ-૨૦૦૩થી ૧૫ મિનિટના સાપ્તાહિક રેડિયો કાર્યક્રમના ઉક હપતા પ્રસારિત થયા છે. તેના સંદર્ભમાં સૌરાષ્ટ્ર પ્રદેશના સાત જિલ્લાનું એક શ્રોતા સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં શ્રોતાઓએ કાર્યક્રમની અસર વિશે વાત કરી હતી અને તેમાં કેવી રીતે સુધારા થઈ શકે તે અંગે રજૂઆત પણ કરી હતી.
- ગુજરાતના ૪ જિલ્લાના ૭૦૦ જેટલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સ્થાનિક નેતાઓનું એક સંમેલન ‘બિહેવિયરલ સાયન્સ સેન્ટર’, ‘બનાસકાંઠા દલિત સંગઠન’ અને ‘સામાજિક ન્યાય મંચ’ સાથેના સહયોગમાં શાસનની પ્રક્રિયામાં છેવાડે ફેફાઈ ગયેલા લોકોની સહભાગિતાના પ્રશ્ને યોજાયું હતું. પંચાયતી રાજ ધારામાં સુધારા સૂચાવતું એક આવેનપત્ર તૈયાર કરાયું હતું અને સરકાર સાથે આ સૂચનો અંગે હિમાયતની વ્યૂહરચના ઘડવા માટે એક કાર્યશાળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
- ગુજરાતમાં સાબરકાંઠાના ‘પંચાયત સંદર્ભ કેન્દ્ર’ દ્વારા ‘સામાજિક ન્યાય મંચ’ના સહયોગમાં તાલુકા કક્ષાની સામાજિક ન્યાય સમિતિઓના સભ્યો એક અભિમુખતા તાલીમ યોજવામાં આવી હતી. અમદાવાદના ‘પંચાયત સંદર્ભ કેન્દ્ર’ દ્વારા મહિલાઓનું જે નેટવર્ક ઊભું કરાયું છે તે તેમણે જે તે પંચાયતોનાં અંદાજપત્રો મેળવ્યાં છે અને ગરીબીની રેખા નીચે જીવનારાની યાદી ફરી બનાવવા માટેની સહી ઝુંબેશ તેમણે શરૂ કરી છે.
- ડિસેમ્બર-૨૦૦૩માં રાજ્યસ્થાનમાં ગ્રામ સભા અને વોર્ડ સભા યોજાયાં હતાં તેથી તેમાં લોકો હાજરી આપે તેના પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. ચોપાનિયાં, ભીતચિત્રો, વોર્ડ સભા અને ગ્રામ સભાની કાર્યસૂચિ, ગરીબીની રેખા નીચે જીવતા લોકોની યાદી, મેલોરિયાના સામના માટેના પ્રયાસો અને યોજનાઓના અમલ પરની દેખરેખ વગેરે વિશે જાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ મુદ્દાઓ વિશે ચર્ચા કરવા વોર્ડવાર બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું.

- જોધપુર ખાતે મહિલાઓ અને દવિતો સરપંચ હોય તેવી પંચાયતોના સર્વોને સ્વસહાય જૂથો વિશે જાણકારી આપવામાં આવી.
- જોધપુરના મંદોર ખાતેના પંચાયત સંદર્ભ કેન્દ્ર દ્વારા પંચાયતોના સર્વોનું એક દિવસીય સંમેલન યોજવામાં આવ્યું હતું. તેમાં ૮૦ જગ્યા હાજર રહ્યા હતા. તેમાં તાલુકા વિકાસ અધિકારી સાથે વોર્ડ સભા અને ગ્રામ સભા સંબંધી પરિષનોની પણ ચર્ચા કરવામાં આવી હતી.
- ગુજરાતમાં કચ્છમાં ભચાઉ ખાતે નાની ચિરાઈ અને ભીલવાસ માટે સામુદાયિક આકસ્મિકતા યોજનાઓ સામુદાય સાથે વિચાર-વિમર્શ કરીને તૈયાર કરવામાં આવી હતી. માહિતીના વિશેષજ્ઞ સાથેનો અહેવાલ તૈયાર થઈ રહ્યો છે.

શહેરી શાસન

- ગુજરાતમાં અમદાવાદ ફાયર બિશેડ સાથેના સહયોગમાં અન્નિ સુરક્ષા અંગેનાં પાંચ નિર્દર્શનો યોજવામાં આવ્યાં હતાં. તેમાં ૧૬૦૦ બાળકોને અન્નિ સુરક્ષા વિશે જાણકારી આપવામાં આવી હતી. અંગ્રેજ અને ગુજરાતીમાં આગ સામે સુરક્ષા અંગેનાં પગલાં દર્શાવતી એક સાચિના પુસ્તિકા તૈયાર કરાઈ હતી અને સ્ટિકર્સ પણ વહેંગવામાં આવ્યાં હતાં.
- દિવાળીના તહેવાર દરમ્યાન ઓક્ટોબરમાં અમદાવાદમાં ‘રેડિયો મિય્યી’ પરથી સતત સ્ક્રોનું પ્રસારણ કરાયું હતું અને સિનેમાધરોમાં મધ્યાંતર દરમ્યાન સ્લાઇડ શો દર્શાવાયો હતો. સ્થાનિક કેબલ નેટવર્ક પરથી સંદેશા સાથે એનિમેટેડ ક્લિપ ફિલ્મો પહેલાં પ્રસારિત કરાઈ હતી. આપત્તિના સામનાની તૈયારી અને સુરક્ષા વિશે લોકશિક્ષણના ભાગરૂપે આ કાર્યક્રમો યોજાયા હતા.
- કચ્છમાં ભચાઉમાં ‘ગુજરાત રાજ્ય આપત્તિ સંચાલન સત્તામંડળ’ (જીએસડીએમએ)ના સહયોગમાં એક માહિતી ફુકાન શરૂ કરવામાં આવી છે. નગર આયોજનની યોજનાઓ, વિકાસલક્ષી યોજનાઓ, બાંધકામની પરવાનગી મેળવવાની પ્રક્રિયા, માળખાગત સવલતોનું આયોજન, જ મીન નિયમિત કરવા સંબંધી મુદ્દાઓ વગેરે વિશે ત્યાંથી નગરના નાગરિકોને માહિતી મળી રહેશે.
- ભચાઉમાં ધૂટીછવાયી વસાહતોને માળખાગત સવલતો વિકેન્દ્રિત ફ્લે પ્રાપ્ત થાય તે માટે ભચાઉ નગરપાલિકના સહયોગથી પાણીના સામુદાયિક સંગ્રહ અને પુરવઠા માટે બાંધકામ કરાઈ રહ્યું છે.
- રાજ્યસ્થાનમાં જોધપુર જિલ્લામાં બિલારા નગરના નગરસેવકોની એક ગ્રામ દિવસની તાલીમ ૨૯-૩૦ ડિસેમ્બર, ૨૦૦૩ દરમ્યાન યોજાઈ હતી. તેનો હેતુ સુશાસન અંગે નગરસેવકોનો દૃષ્ટિકોણ વિકસે તે હતો.



ઉન્નતિ
વિકાસ શિક્ષણ સંગઠન

જી-૧, ૨૦૦, આજાદ સોસાયટી, અમદાવાદ-૩૮૦ ૦૧૫.

ફોન: ૨૭૭૪૯૯૪૪, ૨૭૭૩૩૨૮૯ ફેક્સ: ૨૭૭૪૩૭૫૨. ઈ-મેલ: unnatiad1@sancharnet.in

ક્ષેત્રીય કાર્યાલય: જી-૫૫, શાલ્લીનગર, જોધપુર-૩૪૨ ૦૦૩, રાજ્યસ્થાન.

ફોન/ફેક્સ: ૦૨૮૧-૨૭૪૩૨૪૮ ફોન: ૦૨૮૧-૨૭૪૨૧૮૫, ઈ-મેલ: unnati@datainfosys.net

ડિઝાઇન : રમેશ પટેલ, 'ઉન્નતિ'.

મુદ્રણ : કલરમેન પ્રિન્ટર્સ, અમદાવાદ. ફોન: ૦૭૯-૮૦૧૨૬૯૭, મોબાઇલ: ૯૮૨૫૧-૫૫૪૦૨.

આપ લોકશિક્ષણ કે તાલીમ માટે વિચારમાં પ્રકાશિત સામચ્ચીનો સહર્ષ ઉપયોગ કરી શકો છો. ઉપયોગ કરનારને વિનાંતી કે આ સોતનો ઉલ્લેખ કરવાનું ના ભૂલે તથા પોતાના ઉપયોગથી અમને માહિતગાર કરે કે જેથી અમે પણ કંઈક શીખી શકીએ.